

શ્રીમહ યુદ્ધિસાગરસૂરિજી થંથમાળા થંથાંકે ૫૪.

શાસ્ત્રવિશારદ ચોગનિષ્ઠ જૈનાચાર્ય શ્રીમહ યુદ્ધિસાગર-
સૂરિજી વિરચિત

ગણુંલી સંગ્રહ

ભાગ બીજો.

માણસા નિવાસી સુશ્રાવક શા. વીચંદલાઈ કૃષ્ણાજીનાં
પતિન શ્રાવિકા સમરથભાઈની પ્રેરણા અને
દ્વય સહાયથી

ઇપાવી પ્રસિદ્ધ કરનાર

શ્રી અધ્યાત્મજ્ઞાનપ્રસારક મંડલ.

દા. વડોદરા મોહનલાલ હીમયંદ

પાદરા.

પ્રત ૧૦૦૦

સ. ૧૯૭૯

ધ. સ. ૧૯૨૦

કિંમત ર. ૦-૪-૦

શ્રીમહુ અલ્લિસાગરસુરિજી બાંધમાળા બાંધણું પડ.

કાનેનિશારદ યોગનિષ નૈનાચાયેં શ્રીમહુ અલ્લિસાગરસુરિજી વિરચિત

ગાહુલી સંગ્રહ

ભાગ એટિલો.

માણુસા નિવાસી સુશ્રાવક શા. બીજાંકામણી મુખુલાલ
પતિન આવિકા સમરથમાઠની પ્રેરણું કરું
કૃષ્ણ સહાયથી

છપાવી અસિદ્ધ કરનાર

શ્રી અધ્યાત્મજ્ઞાનપ્રસારક મંડળ.

દા. વકીલ મોહનલાલ હીમયંદ

પાદરી.

પ્રત ૧૦૦૦

સ. ૧૬૭૩

ધ. સ. ૧૬૨૦

કિંમત ર. ૦-૪-૦

અંથ મુળવાનાં ટેકાણ્ણાઃ—

શ્રી અધ્યાત્મજ્ઞાનપ્રસારક મંડળ કેપાગંલી મુખ્યાધ.

શા. વીરચંદભાઈ કૃષ્ણાળ પુના ડે. વૈતાલપાઠ તથા ભાષ્યસા.

યુક્તસેવર મેધલુ હીરણ્ય યાયબુની અંબાઈ.

વહીલ મોહનલાલ હીમચંદ પાઠરા (શુન્ઝાત).

શા. આત્મારામ એમચંદ, સાધું

વિલપુર લૈનમિત્ર મંડલ;

. હા. શા. મોહનલાલ જેશીંગભાઈ.

લાંદાદરા—શિયાપુરામાં, લુહાબુનીમિત્ર રીમ પ્રિય: ગ્રેસમાર્ચ, વિદુષભાઇ આંદ્રાધામ
ક્રીક, તા. ૩૦-૧-૧૬૨૦ ના રોજ પ્રકાશકને માટે છાપી પ્રચિન્થ કર્યું.

શુંહલી સંગ્રહ-અનેને કાળ્યા

મર્સ્તાવની.

ભાવત રિક્ષય ની સાલનું જોમાસું પાડરાના વડીલ મોહન-
લાલ હિમચંદ બગેર કેનસંધના આશ્રણીથી પાદરામાં કરવામાં
આંદું. તે પ્રખણે આદરવા માસમાં સુખાઈથી માણસાચળા
આવક શા. વીરચંહલાઈ કૃષ્ણાલું વાંદવા આવ્યા હતા. તેમણે
શુંહલીએ રચવાની વિજ્ઞાનિ કરી તેથી આધિન માસમાં શુંહલીએ.
રચી અને કારતક માસમાં વડીલ મોહનલાલ હિમચંદે છપાવવા
પડોદરા મોકલાવી. પોથ માસમાં ધીને લાગ તેયાર થઈ ગયો.
ધીન લાગની શુંહલીએમાં સુનિયોના શુંહલીએ શુંહલીએ, પવોની
શુંહલીએ, અશ્વ મહાવીર રચામિની અનેકાવસ્થાની શુંહલીએ,
શુંહલીએ શુંહલીએ, નવપદની શુંહલીએ વગેરેનો સમાવેશ કરવામાં
આંદ્યો છે. ધીન લાગની શુંહલીએ કેટલેક ઉફ્ગાર રૂપ અને
અનેકનિયોની અપેક્ષાવાળી આધ્યાત્મક મહાવીર પલુની રતુંિ રૂપછે.
શુંહલુસાગ દશ્ઠિએ અનેક સુનિયોની શુંહલીએ રચવામાં
આવી છે. શ્રી મહાવીર પલુની શુંહલીએમાં કેટલેક સ્થાને આધ્યા-
ત્મિક સર્વનય સાપેક્ષ વિચારોથી મહાવીર પલુને વિશ્વરૂપે અને
જગતને મહાવીરરૂપે જોવાની લાભનાનો ઉદ્વેષ કરવામાં આંદ્યો છે
તેમાં સ્થાનાંગ સૂત્રમાં જેમ એં આયા એક આત્મા છે એમ સંગ્રહનય
સત્તા વડે દર્શીવવામાં આંદ્યું છે, તેમ અત્રપણું સત્તાઓહક સંગ્રહ-
નયપદે તથા એક વસ્તુમાં સર્વેદ્રૂપ વિષયક સત્ત અસત્ત અસ્તિ-
નાસ્તિ સર્વ પથોયોને ઘટાવવાની અપેક્ષાએ અને ઉદારલાવના વડે
વિશ્વરૂપિટ ધીલે એવી નયસાપેક્ષદિનિ વડે લખવામાં આંદ્યું છે
તેથી તરવ્યપદાથીના પ્રદૃપણમાં એકાન્તવાદ લાયુ પડતો નથી, પરંતુ
તેથી સ્વાક્ષરદર્શનની મહત્તમાં, વિશાળતામાં વૃદ્ધિ દર્શોવી છે.
સંપ્રતિ વિદ્યમાન જૈનધર્મના સ્થાપક શ્રી મહાવીર પલુની છે, તેથી
તેમની અકિતના મોગે તેમની શુંહલીએ વિશેષ પ્રમાણુમાં રચવામાં

(૨)

આવી છે. ખાલિકાઓને, આવિકાઓને તથા પુરુષોને રણ બંધ
એસતા થઈ પડે એવા પરિચિત જવાતા રાજોમાં શુંહલીઓએ રચ-
વામાં આવી છે. શુંહલીઓને શુણ્ણાનુરાગ દૃષ્ટિથી વાંચવામાં આ-
ખણે તો તેમાંથી ધણુ' અનુભવવા ચોંચ મળી શકશે. અન્ય ધર્મ-
વાળાઓને પણ શુંહલીઓમાંથી સમાજેન્તિ જાણે ધણી શુંહલીઓ
ઉપયોગી થઈ પડે તેમ છે. જેવી દૃષ્ટિ શુંહલીઓ વાંચવામાં
આવશે તેથું ક્રણ પ્રાપ્ત થશે. હસ્તયં ડાં અર્હજીબનિઃ ૩

સંવત ૧૯૭૬ ચોષ વર્ષ ૫ પંચમી.
અમદાવાદ, જવેરીવાડી, આંધ્રલીપોળનો
ઉપાશ્રય.

દ્વ. શુદ્ધિસાગરસૂરિ.

ગુંડલીએની વિધયાતુકમણ્ણિકા.

અંક**પૃષ્ઠ.**

૧	શ્રી રવિસાગરલુ મહારાજની શુંહલી.	૧
૨	શ્રીમદ્ સુખસાગરલુ મહારાજની શુંહલી.	૨
૩	શુરૂ દ્વારાયાન શુંહલી.	૨
૪	વીર પલુની શુંહલી.	૩
૫	જૈનલક્ષ્મણ શુંહલી.	૩
૬	શુરૂલક્ષ્મણ શુંહલી.	૪
૭	ચામાસું કરવા શુરૂ પથારે તેની શુંહલી.	૫
૮	ઓળણીની શુંહલી.	૫
૯	દિવાળીની શુંહલી.	૬
૧૦	જાનપદ્યમીની શુંહલી.	૭
૧૧	શુરૂ શુંહલી કરતી વખતે ગાવાનું ગીત.	૭
૧૨	વાસક્ષેપાકરતી વખતની શુંહલી.	૮
૧૩	મહાનીર જ-મ જયાતીની શુંહલી.	૯
૧૪	પ્રતિષ્ઠા મહોત્સવ પ્રભાત ગીત.	૯
૧૫	મહાનીર પ્રભુનો છેલ્લી ઘડીનો ઉપદેશ.	૧૦
૧૬	જિનાગમ શ્રવણ શુંહલી.	૧૧
૧૭	દ્વારાયાન નિવારક શુંહલી.	૧૨
૧૮	જળયાત્રા ગીત.	૧૩
૧૯	મહાનીર પ્રભુના આશ્રયની શુંહલી.	૧૩
૨૦	મહાનીરના લક્ષ્મેતાની શુંહલી.	૧૪
૨૧	દેવશુર લક્ષ્મિતાની શુંહલી.	૧૫
૨૨	અદ્યાત્મમવીરાતુલવ શુંહલી.	૧૬
૨૩	સ્વસુધારવા શુરૂવિસાર્થી શુંહલી.	૧૮

(૨)

૨૪	શ્રી આત્મારામલ મહારાજની શુંહલી.	૧૬
૨૫	શ્રી હૃડિયંત્રલુ મહારાજની શુંહલી.	૧૬
૨૬	હૃદ હાનિકારક રીવાળેનો નિષેખ શુંહલી.	૨૦
૨૭	આનિકાળોધ શુંહલી.	૨૧
૨૮	નિષ્ઠ્યાપક જૈનધર્મની શુંહલી.	૨૨
૨૯	પંચમીની શુંહલી.	૨૨
૩૦	વીર પ્રભુનો ઉપર્દેશ શુંહલી.	૨૩
૩૧	ગૌતમશુક્રની શુંહલી.	૨૩
૩૨	મૈન એકાદશીની શુંહલી.	૨૪
૩૩	ચાઈથની શુંહલી.	૨૪
૩૪	ગોમાસાની શુંહલી.	૨૫
૩૫	અષ્ટમીની શુંહલી.	૨૬
૩૬	શ્રી હીરવિલલાલલિની શુંહલી.	૨૬
૩૭	શ્રી હેમચંત્રસુરિની શુંહલી.	૨૭
૩૮	શ્રીમહ દેવચંત્રની શુંહલી.	૨૭
૩૯	શ્રી હરિસંહસુરિની શુંહલી.	૨૮
૪૦	શ્રી બાદ્રધારુ સ્વામિની શુંહલી.	૨૯
૪૧	અદ્યાચર્યની શુંહલી.	૨૯
૪૨	સુધારાની શુંહલી.	૩૦
૪૩	મહાવીર હૃદયમાં વસ્યાની શુંહલી	૩૧
૪૪	મહાવીર લન્યાથી પ્રગટતા શુણો.	૩૨
૪૫	સેવાની શુંહલી.	૩૩
૪૬	મહાવીર પ્રભુના વચનામૃતોની શુંહલી.	૩૪
૪૭	યતોદાની વીરપ્રભુને વિનંતિ.	૩૪
૪૮	શુક્ર વિહાર શુંહલી.	૩૮
૪૯	શ્રી મોહનલાલલુ મહારાજની શુંહલી.	૪૦
૫૦	શ્રી વિજય લક્ષ્મી સૂરિની શુંહલી.	૪૧
૫૧	શ્રી અલયદેવ સૂરિની શુંહલી.	૪૧

(३)

५२	श्रीमह आनंदधनल्लनी शुँडली.	४२
५३	श्री जिनहत सूरिनी शुँडली.	४२
५४	मंगलीं शुँडली.	४३
५५	श्रीमह मणिविजयल्लनी शुँडली.	४३
५६	श्री वीर देवानानी शुँडली.	४४
५७	महावीर मखुनो उपहेश.	४४
५८	महावीर मखु उपहेश.	४५
५९	सत्यप्रेम.	४८
६०	धरमां स्वर्ग.	४८
६१	महावीर मखुना पांच वधावा.	५०
६२	हितशिक्षानी शुँडली.	५३
६३	केनाने उपहेश.	५५
६४	सहगुडनो शिष्यने उपहेश.	५७
६५	सहगुडनो पुत्रोने उपहेश.	५९
६६	केन लक्षण.	६१
६७	पतिवताना शुणोनी शुँडली.	६२
६८	महावीर मखुनो यशोदाने उपहेश.	६४
६९	दीक्षा वर्खते नाहिर्वर्खननो वीर मखुने संग्रह.	६५
७०	यशोदानी महावीर प्रति विजयिता.	६७
७१	श्री वीरनो चंडैशिकने उपहेश.	६८
७२	श्री महावीरनां यशोदा हेवी सत्ये कंग.	७०
७३	श्री महावीर भाता पिताने आपेक्षा उपहेश.	७१
७४	ग्रबु महावीरनो गुहवास.	७३
७५	सापु दीक्षानी शुँडली.	७४
७६	महावीर मखुनो आश्रय.	७५
७७	श्री महावीर भक्ता लक्षण.	७७
७८	महावीर मखुनु सगपण.	७८
७९	श्री महावीर मखुनी भक्तिवावना.	८०

(૪)

૮૪ માતા પિતાના ભરણથી શોકાતર નંહિવર્ધનને વીરપ્રભુએ આપેલ ઉપદેશ.	૮૧
૮૫ શ્રી વીરપ્રભુને ઘરમાં રહેવા નંહિવર્ધનનો આશંક.	૮૨
૮૬ વીર પ્રભુની ગૃહસ્થ દશા.	૮૪
૮૭ શ્રી યશોદા હેઠળની ગૃહસ્થ દશા.	૮૫
૮૮ વીર પ્રભુની નંહિવર્ધનને શિખામણુ.	૮૭
૮૯ વીર પ્રભુની દીક્ષા વખતે યશોદાએ ગાંગેલી શુંહલી.	૮૮
૯૦ વીર પ્રભુના કાનોમાં જોવાણે ખીલા ડોકયા તે સમયની શુંદ્રાત્મ દશા.	૯૦
૯૧ યશોદાની મહાવીર પ્રભુને ઘેર પધારવા નિનતિ.	૯૧
૯૨ હેઠી યશોદાની વીર પ્રભુને વિનાતિ.	૯૨
૯૩ શ્રી મહાવીર પ્રભુનું નિશાળમાં ગમન.	૯૩
૯૪ મહાવીર પ્રભુની પુરીએ તેમના દીક્ષા પ્રસંગે કાઢેલ ઉદ્ઘાર.	૯૩
૯૫ શ્રી વીર કુમારનું હાલરડું.	૯૫
૯૬ શ્રી મહાવીર પ્રભુની ગરણી શુંહલી.	૯૭
૯૭ વૈનધર્મની શુંહલી.	૯૮
૯૮ મહાવીર પ્રભુની શુંહલી.	૧૦૦
૯૯ પતિમતા ઓનાં લક્ષણ ગરણી.	૧૦૧
૧૦૦ પ્રભુ મહાવીરની શુંહલી.	૧૦૨
૧૦૧ પતિગુણની ગરણી.	૧૦૩
૧૦૨ મહાવીર પ્રભુ પર પ્રેમ. શુંહલી.	૧૦૪
૧૦૩ મહાવીર પ્રભુની ગરણી શુંહલી.	૧૦૬
૧૦૪ વૈનોના શુંહલીની શુંહલી.	૧૦૭
૧૦૫ શ્રી અરિહંતની શુંહલી.	૧૦૮
૧૦૬ સિદ્ધપદની શુંહલી.	૧૦૬
૧૦૭ આચાર્યપદની શુંહલી.	૧૧૦
૧૦૮ ઉપાધ્યાય પદની શુંહલી.	૧૧૦
૧૦૯ સાધુપદની શુંહલી.	૧૧૧

(૪)

૧૧૦ દર્શાનપદની શુંહલી.	૧૧૨
૧૧૧ જ્ઞાનપદની શુંહલી.	૧૧૨
૧૧૨ આર્ત્ર પદની શુંહલી.	૧૧૨
૧૧૩ તપપદની શુંહલી.	૧૧૩
૧૧૪ શ્રી મહાવીર જ-મ જય-તી.	૧૧૪
૧૧૫ શ્રી મહાવીર પ્રભુજું પારણું હાલરકું.	૧૧૬

ગુંહલી સંગ્રહ ખીનો ભાગ.

આશ્વદિશ્યક પત્ર.

આશ્વદિશ.		આશ્વદિશ.
૪	શીથ	શીથ
૬ લિપી ૧૮	પ્રકાશિમા.	પ્રકાશિયાં.
૧૧—૧૪	પૂરણુ.	પૂરણુ.
૨૩—૮	ગંબ.	ગંબ.
૪૮—૧૬	કુલવટ.	કુલવટ.
૮૨—૨૨	કાય.	કાયા.
૯૩—૧૬	ન્યાયુ.	ન્યાયું.

योगनिष्ठ सुनि भावाराज श्री युद्धिसागरसूरि विरचितः

गाहुली संग्रह.

धीने भाग.

(१)

श्रीमह रविसागरल महाराजनी गाहुली.

अवि तम वहा ऐ सूरीथर गंधराय, ए राग.

अविज्ञन गाओ दे, रविसागर गुहराया,
रविपेदे भिन्मा दे निशहिन मणुमे पाया.

सोगर घेठे गुण्यगाथु हरिया, सुनिगण्यमां केशरिया,
अंद्रपरे शीतलता वरिया, लब्धवेाक उद्धरिया. अविज्ञन. १

जौतम गुडपेठे गुण्यवंता, समतावंत लहंता;
आहेय वयनी उपशमवंता, भेरुपेठे भहंता. अविज्ञन. २

अनुभवसानी निरलिभानी, भमता रही न कश्यानी;
अभूत सरणी भीठीवाणी, जान अलय गुणुदानी. अविज्ञन. ३

सर्व केममां के वभण्याया, अतिशयवंत सुहाया;
युद्धिसागर सद्गुर वंड, पडेलां हर्यन पाया. अविज्ञन. ४

(२)

(२)

શ્રીમહા સુખસાગરજી મહારાજની ગહૂંલી.

લવિ તમે વહો રે. એ રાગ.

શુહે સુખ સાગર રે, આતમ સુખના દરિયા,	
શમદમબંતા રે, સમતા શુષ્ણથી ભરિયા.	
વૈયાવચ્છી પર ઉપકારી, સરલ રવભાવી સનૂળા,	
પંચ મહાનત ધારી પૂરા, સેવાકરણુમાં થરા.	શુહે. ૧
ધર્મહિયા કરવામાં જેની, આવે નહો કોઈ તોલે;	
વર્તમાન સુનિગણુ શુષ્ણરાજી, ખરા હૃદયથી જોડે.	શુહે. ૨
શુક્રસેવામાં લુલન ગાળણું, કર્મધીજને બાળણું;	
શુદ્ધિસાગર ઘટ સુખ ભાળણું, જિનશાસન અજવાળણું.	શુહે. ૩

(૩)

ગુરૂદ્વયાપ્યાન ગહૂંલી.

ભૂલ્યો મન લામરા તું કયાં લામ્યો. એ રાગ.

શુહે વખતણુ કરે ભલો, સુષ્ણતાં હર્ષ આપાર;	
વીર પ્રભુલુચો લાભિયો, જૈનધર્મ છે જાર.	શુહે. ૧
જૈનધર્મ જગ જાગતો, ટાળે સહુ જન હુઃખ;	
જૈનધર્મ ધરી લુલતાં, મળતાં શાશ્વત સુખ.	શુહે. ૨
ફેવ શુરૂધર્મ સત્ય છે, ધરો તસ વિશ્વાસ;	
મિથ્યા વહેમ સહુ વારતાં, પામો સમકિત્વાસ.	શુહે. ૩
પૂરા હોય તે પારખે, શુરૂવચન પ્રમાણુ,	
જૂડા પડે જાલમાં, ભટકે ચોરાશી ખાણુ.	શુહે. ૪
અરિહંત મહારીન સત્ય છે, ધીજું આલપાલ;	
શુદ્ધિસાગર વીરણું, હાલે શરણું નિકાલ.	શુહે. ૫

(३)

(४)

શ્રી વીજપ્રકુની ગહુંલી.

જી રે પહુંદો બચાનો મહાવીરતથ્યા, એ રાગ.

જીરે જ્ઞાલા લાગે મહાવીર પ્રભુ, સહુદેવના દેવ મહાન્,		જીરે. ૧
હાડોહાડ હૃદયમાંહિ વ્યાચિના, અરિંદંતુ લિખુ લગવાન્.		જીરે. ૨
મોહું સત્ય મહાવીર દેવ છે, પ્રથમાસુત જગજયકાર;		જીરે. ૩
જૈનધર્મ ખરો ઉદ્ધારિયો, દેખ હેશના સત્ય ઉદાર.		જીરે. ૪
મહાવીર પ્રભુ નામ જાપથો, ટળે કર્મ સકળ નિધીર;		
કલિકાલમાં મહાવીર એક છે, સહુ જીવના તારણહાર.		
જૈનધર્મ સમેં નહીં ધર્મ છે, સહુ સેવો નર અને નાર;		
ઓળી આપે છે શુકુ દેશના, સુષુતાં હોય હર્ષ અયાર.		જીરે. ૫
મહાવીરપ્રભુ જિનહેવ છે, જૈનધર્મ સહા આધાર;		
અદ્ધિસાગર શુકુલની દેશના, સુષી પામો મંગલમાલ.		જીરે. ૬

(૫)

જૈન લક્ષ્મણ ગહુંલી.

સિદ્ધ જગત શિર શોસતા. એ રાગ.

સાચા જૈન રે વાણીઓ, મહાવીર દેવના દાસ,		સાચા. ૧
જૈના હિલમાં ન દીનપણું, જૈનાગમ વિશ્વાસ.		
જીતે મોહ વિકારને, થરા દ્રોધને લાવ;		
કરતા નહીં રે કાયરપણું, ખરતા સહણુણુ લાવ.		સાચા. ૨
જૈન ધર્મ આરાધતા, તન મન ધનથકી આસ;		
વીર પ્રકુની રે વાણીમાં, સાચા છે વિશ્વાસ.		સાચા. ૩
ધર્માર્થે જેહ જીવતા, સાંજી સત્યના જેહ;		
ઓરી જારી ન રે કરે, ધરે ઉપકારે હેહ.		સાચા. ૪
સહાય કરે રે પરસ્પરે, કરતા સુપ્રાને દાન;		
આણુ પડે ચણુ ધર્મને, કઢિ ત્યાગે ન જાણુ.		સાચા. ૫

(૪)

જૈનધર્મની સદહણું, જેના મન હાડોહાડ;		
હુર્ગુણ લુતે જ્ય જે કરે, મોદ્યું પાળે પ્રમાણુ.	સાચા.	૬
જડ વરતુના ન લોકિયા, રાગી કૈનોના જેહ;		
મહાવીર મહાવીર મન લજે, સાચા શુણુગણુ ગેહ.	સાચા.	૭
વીર ઘને શુલકાજમાં, આપે તન મન લોગ;		
આતમ પેઠ સહુ લવને, માને ધર્મનો યોગ,	સાચા.	૮
આત્માદ્વારક જે બની, કરતા વિશ્વ ઉદ્ધાર;		
અનુદ્ધિસાગર સહશુદ્ધ, અદ્ધા અદ્ધિત ઉદ્ધાર.	સાચા.	૯

(૫)

શુદ્ધશુદ્ધ ગહુલી.

શુદ્ધપતિ રામ હૃહયમાં રહેણે રે. એ રાગ.

શુરુ અદ્ધારા જાનદર્શન દરિયારે, સાંસાર સસુદ્રને તરિયા. શુરુ.		
શુરુ ભાતુ સમા છો પ્રતાપી રે, શુરુ આકાશ પેઠ છો વ્યાપી રે;	શુરુ.	૧
અત્યુત્તરમાં શીથ જવાણી;		
અમૃત સમ મધુરી વાણી રે, સાંભળી યુભ્યા અહુ પ્રાણી રે;	શુરુ.	૨
ખૂણ કરતા ધર્મ કમાણી,		
સાગર પેઠ ગંભીર છાણે રે, કહિ મૂકો ન નિઝ શુદ્ધ મારોરે;	શુરુ.	૩
પાળો સુનિશ્ચણુ રીત રીવાણે,		
ઉપર્સર્ગ પરિષહ સહેતારે, મહાવીરતુ શાસન વહેતા રે,	શુરુ.	૪
આત્મલાવમાં નિશદ્ધિન રહેતા		
ગામીણામ નગરપૂર ફરતા રે, મોટા સુનિવરને અનુસરતા રે;	શુરુ.	૫
રાગદ્રોષ હૂર પરિહરતા,		
આંગંમ અન્યો ઉપરેશો રે, નેથી જાય લુચોના કહેશો રે;	શુરુ.	૬
અનુદ્ધિસાગર શિવ સહેશો,		

(૫)

(૬)

ચોમાસું કરવા શુદ્ધ પદ્ધારે તે વખતે ગાવાની ગહુંથી.

સાંલાળે મુનિ સંયમરાગે. એ રાગ.

આજ નગરમાં શુદ્ધાં પદ્ધારી,	ચોમાસું શુભ કરવા દે;	આજ. ૧
ભન્ય જીવોનાં પાપયંક સહું, મેઘવૃષ્ટિ પદે હરવા દે.		આજ. ૧
ધરધર કુંકુમ સાથીએ ઢીધા, ધવલ મંગલ વર્તીયાં દે;		આજ. ૨
પુષ્યપનેતાં પગલાં દીઠાં, નરનારી હરખાયાં દે.		આજ. ૨
ગહુંથી કરતી ગોરીએ ગાવે, દૂંછણા કરતી લાવેદે;		આજ. ૩
મોતિ તંડુલ મૂઠી ભરીને, શુદ્ધને સંધ વધારે દે.		આજ. ૩
ચાંડલીએ પેઠે શુદ્ધ શોલે, ભાનુ પેઠે પ્રકાશે દે;		આજ. ૪
શૈધાખનિ ઉપદેશ ધ્વનિએ, ભન્ય ચકોર વિકાસે દે.		આજ. ૪
મહાવીર પ્રલુની પાટે એસી, જૈન ધર્મ સમજાવે દે;		આજ. ૫
જૈન જગત જયવંતુ કરતા, અભિત જ્ઞાન સ્કુરાવે દે.		આજ. ૫
આનંદ મંગલ શાન્તિ વર્તો, નવનવો યોધ સુણ્ણાવો દે;		આજ. ૬
અદ્વિતીસાગર સાચા સફશુરુ, મહાવીર તરવો ભણ્ણાવો દે.		આજ. ૬

(૮)

ઓળિની ગહુંથી.

સિદ્ધ જગત શિર શાલતાં. એ રાગ.

ઓળી કરીએ રે ભાવથી, વિધિપૂર્વક સાર;	ઓળી. ૧
મયણું શ્રીપાલની પદે, પામો સુખ આપાર.	ઓળી. ૧
સુહ સાતમથી પુનમ લગી, આસો વૈતર એ માસ;	ઓળી. ૨
આરાધન નવ પહેલણું, કરીએ ધરી વિશ્વાસ.	ઓળી. ૨
અરિહંત નવ પહ તણ્ણા, પ્રત્યેક દોષ હન્જર;	ઓળી. ૩
જાપીએ જાપ સુભાવથી, કાઉસગ જયકાર.	ઓળી. ૩
અરિહંતાદિક પૂજાએ, ભજુએ શુદ્ધ શુણ્ણવંત,	ઓળી. ૪
લક્ષ્મી લીલા જય પામીએ, આવે ફુઃખનો અંત.	ઓળી. ૪

(\$)

નેવી ભાવના જેહની, સિદ્ધિ તેહની થાય;
નવશવમાં જન શિવ લહે, કર્મ અનંત ખપાય. ઓળિ. ૫
ઓળિ તપ સમ તપ નહીં, મંત્રવિષે નવકાર,
અહાય કરે દેવહેવીએ, થાતી અણુધારી જ્હાર. ઓળિ. ૬
રોગ ટળે ખસુ જાતના, પદપદ મંગલ થાય;
પુત્ર મળે મનમાનતા, ધન્યા મેળા સુકાય. ઓળિ. ૭
કર્મ નિકાચિત ખાંધિયાં, તે પણ વિષુશરીરે જાય;
આ ભવમાં તપ ફળ મળે, શક્તા ખળ મહિમાય. ઓળિ. ૮
ઓળિ તપેને આરાધતાં, સુખિયાં નર અને નાર,
શુદ્ધિસાગર સદ્ગુરુ, આર્થીષથી નિરધાર. ઓળિ ૯

(૯)

દિવાળીની ગાહુણી.

મારો સુયષ્ટ સલુણો સાહેય લેછિયા. એ રાગ.

ફરી દિવાલી મહાવીર તણી, આખા ભારત દેશ મજાર;
મહાવીર નામતણું જાપથી, કેટિ શુણુ કુલ લહેં નરનાર. આન્દે. ૧
છેલ્લા તીર્થાંકર મહાવીર પ્રભુ, હેહ છેડી થયા વિલુસિદ્ધ;
ચાલે શાસન સ'પ્રતિ તેમતું, જેનું નામ છે વિશ્વપ્રસિદ્ધ. આન્દે. ૨
જેણું ભારત દેશ ઉભાળીએ, કીથે ઉભાવલ સ્વર્ગ સમાન;
સત્ય તરત્વ જગત્યાં પ્રકાશિમાં, લાવે લાલે વીર ભાગવાન. આન્દે. ૩
મહાવીર અરિન્ન અવણુ થકી, નિજ આતમ પાવન થાય;
ગરણ્ણું ગણીએ ગુરુગમ લહી, કીને તપ જપને સ્વાધ્યાય. આન્દે. ૪
વીર પાછળ વીર સમા બનો, એનો મહાવીરનો ઉપદેશ;
શુદ્ધિસાગર મનમાંહિ ધારીને, વતોં નર નારી હમેશા. આન્દે. ૫

(७)

(१०)

જ્ઞાનપંચમીની ગણુંણી.
ધ્રુવાક્રી.

જ્ઞાન પંચમી જ્યકાર, કરો તપ પંચમીતું નર નાર.	
જ્ઞાન પંચમી આરાધતાં રે, પ્રગટે જ્ઞાન અનન્તા;	
જ્ઞાન સકલ શુષ્ઠુ એઠ છે રે, બાખે વીર અહન્તા.	કરો. ૧
શુષ્ઠુ મંજરી વરદાર પરે રે, તપ આરાધે જોહ;	
જ્ઞાનાવરશુ નિવારીને રે, અનતો જ્ઞાની તેહ.	કરો. ૨
ભાગુણો જ્ઞાન ભળુણીએ રે, કરીએ તન ધન રહોય;	
જ્ઞાન સર્વત્ર ફેલાણીએ રે, પઠન આહિ ઉપાય.	કરો. ૩
જ્ઞાની જ્ઞાન આશાતના રે, કરીએ નહીં ધરી મેમ;	
જ્ઞાન ઘોરી બનો વિશ્વમાં રે; અનીચા તપ નેમ.	કરો. ૪
વીરપ્રભુના શાસને રે, જ્ઞાન તણો આધાર;	
ભુજ્ઝિસાગર સફશુરુ રે, સેવી લહો ચોહુ સાર.	કરો. ૫

(૧૧)

શુરુ ગણુંણી કરતી વખતે ગાવાતું ગીત.

એની રચિસાગર શુરુ વંદીએ. એ ૨૧૩.

ગાવો સખિયો શુરુ શુષ્ઠુ શુંહલી,	
એની અમૃતકૃપી વાણી રે;	
જેનાં લોચન રચિયરે અગહો,	
મહા તપસી શુષ્ઠુની ભાણી રે	ગાવો. ૧
જેતું આકાશથી હિત મોટકું,	
અંદ્ર પેઠે સુખકું જગકે રે;	
જગ મોકું ન મનસમ ડો હિસે,	
તપ તેણે ઢેહણી ચળકે રે.	ગાવો. ૨

(८)

જેના મનમાં વિષય વિષ નહિ રહ્યું,
અદ્ધા તેજસ્વી મહા ચોગી રે;
સર્વ તીર્થ સ્વરૂપી જે થૈ રહ્યા,
કૃત આરથ્ય કર્મના લોગી રે,

ગાયો. ૩

શુક્ર લુખતા અમુદ્ર વેલડી,
જેહ આત્મઅલુખનથી લુખાડે રે,
વાયુ પેઠે લુખન પ્રાણુ શોધતા,
સમતા રૂપ જલને પીવાડે રે.

ગાયો. ૪

અનીચ્છા રૂપ અભિન હૃદય જળો,
પૃથ્વીપરે સહુ સહનારા રે;
કર્મ ચોગી અડગ મેહ સારીખા,
બાનુ પેઠે લુખન હેનારા રે;

ગાયો. ૫

શોળ શૂંગાર ગુણુ ગણુના સળ,
સખ્યો શુલ શુરૂને વધાવો રે;
ઝુદ્ધિસાગર સહશુરૂ વાંદીને,
સુષ્ણી વ્યાપ્યાન દ્વો ગુણુ દહારો રે.

ગાયો. ૬

(૧૨)

આવકેને આવિકાએને તથા સાધુએને વાસકોય

કરતી વખતે ગાવાની ગહુલી.

થયા લક્તોરે નિભુવન લોક, શુરૂના યોલડીએ,
કરે કરે રે શુહ વાસએય, શુકન સ્વર ચો ધડીએ.
વાસએય ધનદે હિયો રે, તંડુલ લક્ષ્મીએ આપ્યા રે.
સૂરિમંત્ર જોતમ હિયો રે, શુરૂએ હાથ શિર થાપ્યા.

શુહ. ૧

આશીલોદ શુહા હિયે રે, મંગલમાલા થાને રે;
અવસાગર સહેને તરો રે, ધર્મ કમાણી કમાને.

શુહ. ૨

(६)

डेखल ज्ञानथी अगड्हेवै, परम महोदय पामोदै;
आतम लक्षभी अविचल पामी, पूर्ण प्रतिधा जामो। शुद्ध. ३
सर्व शक्ति वासक्षेपमांरे, संकल्पे स्थिर थारीरे.
भुजिसागर सहयुक्त भाये, वासे शक्ति हिक्षयामी। शुद्ध. ४

(७)

**चैत्र सुहि तेष्व महावीर स्वामीनी ७०-८
ज्यांतीनी गङ्गुली.**

आवो आवो यशोदाना कंत, ए साग।

निशलाना नंदन वीर, जग ज्यकरी दे;	नि.	१
जनन्या जगनो उद्घार, करवा भारी दे।		
भारतनां प्रगटयां लाभ, पाप पलायां दे;	नि.	२
प्रगटयो जगमां उद्योत, सुभद्रां छायां दे।		
हेव हेवीनो आनन्द, स्वर्गे छायो दे;	निशला.	३
धन्द्रोये करि अलिषेक, महावीर गायो दे।		
महावीरभय सहु निश्च, भाषे करवा दे;	निशला.	४
अवतरिया निभुवनहेव, कृष्ण छुरवा दे।		
आनन्द तो अंग न भाय, आजे त्रेमे दे;	निशला.	५
भुजिसागर महावीर, प्रभुनी रहेमे दे।		

(८)

प्रतिधा महोत्सवे प्रभातमां गावानुः गीत.

आवे आवे भौतिशा शोठ नवानुः जल लावे छ, ए साग।

प्रगटयुः सोनावर्णी प्रभात, प्रभुल महोत्सवे;		
हेवलोकमां हेवो हरभे के, प्रभु शुणु उज्वे.		१
२		

(१०)

जिनराज प्रभु हरभारमां, नवथङ्गने नोतड दीध;	प्रभु.
हश दिक् पाल प्रेमथी नोतयो, हेव हेवीओ योगियो सिंख. प्रभु.	२
घेर घेर कुंकुमनां छांटण्यां, इडा साथिया द्वारनी साख;	प्रभु.
शांतिस्त्रान लण्यावे श्रावडो, गावे गीत भाडी केवी द्राख.	प्रभु.
आरती शशी भानु उतारता, बहाला जिनवरहेवनी नित्य.	प्रभु.
करे मंगल हीवो गोरीओ, करे लुणु उतारणु रीत.	प्रभु.
द्रूष्यक्षालथी मंगल प्रगटियां, नरनारीच्चानन्द अपार;	प्रभु.
भुद्धिसागर भडावीर शासने, जैन संघनो हो जयकार.	प्रभु.
	४

(१५)

महावीर प्रभुनो छेदवी घटीनो उपहेश.

गंगातट तपोवनमां दे. ए. राण.

महावीर प्रभुलु दे, अवन छेद्वीवारे.	
पावापुरी नगरमां दे, उपहेश हे भाजे;	
भारी पाढण जैनो दे, प्रभादी न को थाशो.	
मन झुते ते जैनो दे, जगतमांडि कहेवाशो.	महावीर.

साख.

आसक्ति वण्यु कर्म ने, करने स्वाधिकार.	
सर्व शक्तियो भीलवी, करने परोपकार.	
मांडो मांडे जैनो दे, हणी मणी गुणु गाने;	
जैनने जिननेवारे, गण्डी सेवा अहाने.	महावीर.
जैना मनमां हुं वस्यो, करतो मारो जप,	
तेनाथी लेह ज करे, अंधाये महापाप;	
ओहुं जाण्युने जैनारे, परपर हिलमांडी,	
मुजने ज निहाणीरे, प्रवर्तो शिवांडी.	महावीर.
	३

(११)

વેષ કિયાદિક લેદથી, ગણ્ણા ન જૈનો બિજીન,
અક્ષીયાતમ મહાવીરમય, જૈનો સર્વ અલિમ.

સહુ જૈનોની સેવા રે, કરે જગ સુજ પેઠે;
હોષ દાખિન નિવારી રે, કરે ન જરા વેઠે.

મહાવીર. ૪

સુજ સમરે સહુ લોકમાં, જૈનપણું પ્રગટાય.
પ્રાંતે પરમાતમ ઘની, જ્યોતિ જ્યોત સુહાય.
મારી પાછળ સા'પી રે, સકલ સ'ંધ ચઠતી કરે
શુદ્ધિસાગર ઓધે રે, પ્રભુ શિખ ચિત ધરે.

શુહાવીર. ૫

(૧૨)

જિનાગમો અવણુ કરવાની ગરુંડી.

ભવિજન સુષુંગે રે ભગવતી સૂવની વાણી એ રાગ.

લાવિજન સુષુંગે, મહાવીર પ્રભુની વાણી;
હૃદયમાં ધરનેરે, પરમારથ દ્વિલ આણી.

લાવિજન

નયલાગી નિક્ષેપ પ્રમાણે, સાપેક્ષાચે સમાણી.
ઉત્સર્ગ અપવાહે પૂરણુ, અનેકાન્ત ઠરાણી.

લાવિજન. ૧

અંગ ઉપાંગ પદ્યના છેદને, મૂલસૂને જ ચુંથાણી;
જૈનધર્મ ઉપહેશયો સાચો, પ્રકાણુ અન્ય સમાની.

લાવિજન. ૨

રાગ દ્રેષ રહીન મહાવીર જિન, આચા ડેવલ જ્ઞાની,
આગમની તે માટે શ્રદ્ધા, કરતાં મળે શિવરાણી.

લાવિજન. ૩

મહાવીર ભાવિત તત્ત્વ હૃદયમાં, શાંકા ટાળી ધરીએ;
પ્રાણું પણ ધર્મ ન તજ્યો, નિક્ષેપ એવો કરીએ.

લાવિજન. ૪

કાલ અનાદિ જૈનધર્મ છે, આવે ન કો તસ તોલે;
જૈનધર્મ સેવનથી સુકિત, સર્વ જિનેક્ષર એલે.

લાવિ. ૫

સર્વ વેદનો પરમવેહ છે, મહાવીર પ્રભુની વાણી;
શુદ્ધસુખથી આગમ સાંભળતાં, સમજિત લે ભવિમાણી. ભવિ.

૬

(१२)

આગમજાની શુરૂની અક્તિલ, કરીએ ધર્મ કમાણી;
આગમભક્તિકલિયુગ મોટી, સુકિતપુરીની નિશાની. અવિ. ૭
આતમ તે પરમાત્મ પોતે, થાને શ્રદ્ધા ઠરાણી;
બુદ્ધિસાગર આત્મ સ્વભાવે, થાયે સહુગણુ આણી. અવિ. ૮

(૧૩)

વ્યસન નિવારક ગણુંલી.

અવિ તમે સુખુને રે અગ્નવતીસૂત્રની વાણી. એ રાંગ.

વીર ઉધેશો હૈ, અવિજન વ્યસન નિવારે;			
માનવલબ મળીયો હૈ, હર્મનિથી ડેમ હારે;			
પરનારી વ્યલિયાર પાયથી; ચોગ શોક હુઃખ ફરિયા,			
પર નારીનો સંગ કરીને; ડેઢ નહીં ઉગરિયા. વીર. ૧			
શાબદુ રગહોળાયો રણમાં, રાજ્ય ધર્મ સહુ હાર્યો;			
બુદ્ધિણણ સત્તા લક્ષ્મીનો, નાશ થતો અણુધાયો. વીર. ૨			
દાકુ સમ નહીં હુઃઠ જગતસાં, ધર્મ શરીર વિનાયો;			
દાડિયાનું મન નહીં વશમાં, રહે ન સહયુદ્ધ પાસે. વીર. ૩			
વેશ્યા સંગતમાં ને પડિયા, પામર તે લદથડિયા;			
શેતન મૂરી ચામડી સેવા, કરી ચામાર તે પડિયા. વીર. ૪			
કાયા માયામાં લપરાણા, વેશ્યા કર જકડાણા;			
પાશમાં પણુ પરે તે પડડાણા, મહાજન રાજન શાણા. વીર. ૫			
ચારી કરે તે પાણી પૂર્ણા, કરે નહીં એક ડામે;			
કાંદ્યા કુતરા પેઢે ફરતો, હર્ઝનિ હુઃખંડાં પામે. વીર. ૬			
માંસનું ભક્ષણુ કરનારામાં, હ્યા પ્રેમ નહીં ખિંડ;			
શિકારીને આટકી નિર્દ્ય, પામે હુઃખના સિન્ધુ. વીર. ૭			
કેર્ણી વસ્તુ ભાંગ ને ગાંને, અણીણુ વ્યસની હુઃખી;			
દેશોદ્ય કરવામાં પાછળ, કથારે ન થાતા સુઅની. વીર. ૮			

(१३)

જુગાચે રમવાતું છોડો, ત્યારે થાય તે મોટા;
અનુદ્ધિસાગર શિક્ષાપાળે, નાસે હુઃખના ગોટા.

વી. ૬

(૧૪)

જલ યાત્રા ગીત,

આવે આવે મોતીશા શાઠ. એ રાગ.

આવે હેવને હેવીઓ સર્વ, ઉત્સવપર આવે છે;

જલ યાત્રા ઉત્સવ મંગલ, સહુજન ગાવે છે. આવે. ૧

જલહેવને નોતકું હેઠ, લયો કુંલ પાણીઓ;

મોટું સ્નાત્ર લણું વણું હેત, મંત્રમય વાણીઓ. આવે. ૨

બાળ વાગ્યાં છનીશ જાતનાં, થયા નોખત પદ્ધત થોર; ઉત્સવ.

જલ કુંલભરી શુભનારીઓ, ગાવે ગીત ને કરતી શોર. ઉત્સવ. ૩

મહાવીર પ્રભુ જય મોલતો, સંધ ચાવે સક્લ ધરી શોલ. ઉત્સવ.

જિનશાસનની જય એલતો, શાંત થાઓ અસુરગણુ ડોપ. ઉત્સવ. ૪

થાઓ શાંતિ સઢા સહુ લોકમાં, ટળો રોગશોક હુઃખ કલેશ; ઉત્સવ.

પ્રભુ મહાવીરહેવની લક્ષ્ણથી, લહો શાંતિ પ્રભને નરેશ. ઉત્સવ. ૫

પ્રભુ મહાવીર હેવના શાસને, વહુ દિક્ષાકની હોય સહાય; ઉત્સવ.

અનુદ્ધિસાગર મંત્ર પ્રભાવથી, વધે પુષ્ય ને મંગલ થાય. ઉત્સવ. ૬

(૧૫)

મહાવીર પ્રભુના આશ્રયની ગુંહદી.

લક્ષ્ણ એવી રૈ લાધું એવી. એ રાગ.

મહાવીરસું નહીં ડોઈ, જેણો જગમાં જન સહુ જેઈ;

મહાવીરસમા નહીં ડેવા, જેની ઝનિયા કરતી સેવા. મહા. ૧

(१४)

મહાવીર છે ભક્તોના ઘેલી, ઠંડા કરતા ને ઠંડા છેદ્દી.
 સંકટમાં સમયો ઉગારે, હુઃખ સાગર પાર ઉતારે;
 મહાવીર પ્રખુ સુજ આંખો, નલ ઉડવા તેહ જ પાંખો. મહા. ૨
 રુને મહાવીર પર પ્રેમ લાગ્યો, મારા હિલમાં મહાવીર જાગ્યો;
 મારે મહાવીરથી છે સગાઈ, માતા પિતા મિત્ર ને બાઈ. મહા. ૩
 મારે મહાવીરનો આધારો, આંદ્યો શરણે હવે તો ઉગારો;
 મોહું સત્ય મહાવીર સ્વામી, રહ્યા અંતર આતમરામી. મહા. ૪
 હુઃખ કર્મો થયાં સહુ સહીશુ, સુએ મહાવીર મહાવીર કહીશુ;
 મારે સહુમાં મહાવીર નેવા, નામ દૃપના લેહો ઘેવા. મહા. ૫
 જેતું સર્વ વિશ્વપર રાજ, જેહ પલકમાં સારે કાજ;
 મહાવીર અરિહંત નામ, જપતું બીજું નહીં કામ. મહા. ૬
 ભૂત, ભૂતમાં મળી શમાશે, મારે આતમ મહાવીર થાશે;
 પાહિદ અંતર મહાવીર સ્વામી, રૂપા રૂપીને નામી અનામી. મહા. ૭
 કૈનધર્મતણ્ણા રખવાળ, સહુ વિશ્વતણ્ણા પ્રતિપાળ;
 મારી દૃષ્ટિ આગળ તરી આવે, પ્રેમ ભૂખ્યાની ભૂખ શમાવે. મહા. ૮
 અમે મહાવીરના ચેચાયા, વીર મારે મનવચકાયા;
 મરે હેહ અમર અમે થાઈયા, ચિહાનનદ મહાવીર લહિયા. મહા. ૯
 શુદ્ધ પ્રેમથી બ્યકત ને થાવે, જેહ મળતાં બીજું ન લાવે;
 ખુદ્દિસાગર મહાવીર મળિયા, મારા સર્વ મનોરથ દુષ્પિયા.

મહાવીર. ૧૦

(૨૦)

મહાવીરના ભક્તોની ગુંહળી.

ભક્તિ એવી રે ભાઇ જેવા. એ રાગ.

મહાવીરના લક્ષ્ણ તે જણ્ણા, જેની શક્તા પૂર્ણ પ્રમાણ્ણા,
 સર્વ કર્તાંય કાજને કરતા, નિર્દેશપણું હિલ ધરતા. મહાવીર. ૧

(१५)

स्वाधिकार न चूके क्यारे, काममोहूथी क्लेह न हारे,
 अतवा योग्य अन्ते सर्वे, ओवा जैनो रहे नहीं गर्वे. महावीर. २

पठे प्राणु सङ्कल नाश थावे, जैनधर्म न तजता रववावे,
 प्रभु महावीर अरिहंत ओड, यासोशासे स्मरणुनी ठेक. महा. ३

जैनने वीर जेवा गणुता, वीर विना न धीरु लाणुता,
 वीर चरितने सांखये ग्रेमे, लरियुं दिलसागर रुहेमे, महावीर. ४

क्लेह जड पूरक नदी थाना, ज्यां त्यां चेतन पूजा च्छाता,
 अध्यात्म महावीर हेमे, कर्म लावने हेमी हवेमे, म. ५

निर्वेष कमल जलमांही, तेम निर्वेष विषयोमांही,
 शरण्युं महावीरनुं धारे, ग्रेम महावीरमां सहुधारे. महावीर. ६

महावीरथी संभवं ध यांभी, शुद्धप्रेमथी अतिशय सांघी,
 वीरभय थध अवन धरता, दीनपाण्युं न क्यारे धरता. महावीर. ७

भृत्यु श्ववतुं अन्ने समान, पठे वीर विना नहीं तान,
 उत्सव सम हुःअनी चेला, माने वीर प्रभुना चेला. महावीर. ८

मन उपर कालूं अनधर्म न क्यारे चूके,
 क्लेह क्यारे न a. आत्म वीरानंद विलासी. महा. ९

हेमी जैनने धर्षित थावे, तेनी भक्ति करे धूष लावे.
 प्रभु लाक्षतमां लेह न धारे, थावे हुःअमां जैननी बहारे. महा. १०

करे स्वार्पण्यु जैनने भाटे, धरे धर्मने निज शीर साटे,
 औद्धिसागर भक्तो ओवा, जेना महावीर साचा हेवा. महावीर. ११

(२१)

हेवगुड भक्तिनी चुंहडी.

भक्ति एवीरे लाल एवी, तरस्यामे पाणु जेवो ए राग।

करो हेवगुडनी भक्ति, प्रगटे लेहथी सहु शक्ति,
 जेना धड पर शीर न छाय, याए भक्तितण्डु रस सोय. करो. १

(१६)

જેણે તન ધન નહાલ ઉતાર્યું, તેણે લક્ષિતનું દ્વાર ઉધાડયું,	
અવતો જે મણી વળી શુંયો, પાણો લક્ષિતને તે જન દીબો. કરો. ૨	
શુરુ દેવના પ્રેમે વેચાયો, લક્ષિતરસ અનુભવ તે પાયો.	
દેવગુરુમાં એકત્વ હેઠે, પ્રલુને તેહ પ્રેમે પેણે	કરો. ૩
જેના દિલમાં મહાવીર એક, પૂર્ણ પ્રેમે પરમ શુરુ ટેક,	
નાટ પૂતલી ચેણ્ટા પ્રમાણે, ગુરુવચને પ્રવતો તાને.	કરો. ૪
શુરુ દરિયામાં ઝૂંખી મારે, નિજમાં નામદાર ન ધારે,	
નાટ નાગર પેઢે પેલે, પૂર્ણાંનન્દ અવન રેલે.	કરો. ૫
સહુમાં મહાવીરને હેઠે, સહુમાં નિજ શુરુને પેણે,	
એક મહાવીરનો આધાર, ધરી ચલને સહુ પ્રયવહાર.	કરો. ૬
પડે લક્ષિત વિના નહીં ચેન, આવે મહાવીરનું મન ઘેંન,	
લક્ષિત અમૃત પી ને ઉઠે, તેને મોહમાયા નહીં દૂટે.	કરો. ૭
લક્ષિત ભાવમાં એ ચકચૂર, તેથી મોહ રહે છે દૂર,	
લક્ષિત આધીન છે ભગવાનું, જેના મનમાં ન લોક નિશાન. કરો.	૮
શુરુ પ્રેમથી લક્ષિત ભરેલી, કલિકલમાં સહુને પેલી,	
ભૂતી અંડન વાઈ વિવાહ, ભવિ લક્ષિત અમૃત રસ સ્વાહ. કરો. ૯	
કરે લક્ષિત તેહને ધન્ય ધન્ય, જેને વીરપ્રલુન તનમન,	
સર્વ શુંયાનાં ફુઃખ નિવારે, તેહ શુંયાંતી લક્ષિત ધારે.	કરો. ૧૦
પીધા જોળી સાગર સૂર ચંદ્ર, તેહ લક્ષિતસ્થા છે ધંદા,	
ખુદ્દિસાગર શુરુદેવ લક્ષિત, કરો સ્વાર્પણુથી સહુ શકિત.	કરો. ૧૧

(૨૨)

અદ્યાત્મ મહાવીર પ્રલુની અનુભવ શુંખલી.

લક્ષિત એવા રે ભાગ એવી, એ રાગ.

જુને નહાલા પ્રલુન મહાવીર, નિશલાનંદન વડધીર,

સર્વ શુંયો મહાવીર જખ્યાયા, અદ્ધા સર્તાચો સર્પા : સુહાયા.

જુને. ૧

(१७)

- જુને મહાવીર વણું નહીં ગમતું, મારું ચિત્ત ન ધીને રમતું;
અદ્યાત્મ મહાવીર જાણ્યા, શુદ્ધપ્રેમે હૃદયમાં આણ્યા. જુને. ૨
- સત્તાએ મહાવીર પોતે, જાળીને કોણું ધીને ગોતે;
મહાવીરમાં સર્વ સમાણું, સર્વ વિશ્વ મહાવીર છાણું. જુને. ૩
- અસ્તિત્વાસ્તિત સહસ્ર પોતે, મહાવીર સ્વયં શુણું શોતે;
દેખ ડેવીએ મહાવીરમાંહી, લેશ ધીણું રહ્યું નહીં કર્યાંહી. જુને. ૪
- મૈઘભાયાને હુર અસેડી, અદ્યે મહાવીરની શુણું મેડી;
પ્રાણરન્ધ્રમાં જગમગ જણોતે, મહયા મહાવીર અનુભવ જણોતે. જુને. ૫
- જેની જણોતિ છે અપરાપાર, બની વીર કે પામે પાર,
ઘટચક્રમાં ઉપશમ ધારે, પ્રલુબ મહાવીર પોતે પધારે. જુને. ૬
- જુલ્હાત્મ મહાવીર ડેવા, ડેહ વ્યાપી અનુભવી લેવા.
જેફ કાલ અનાહિ અનંતા, દ્રવ્યથી જ અનન્તા અનન્ત. જુને. ૭
- સર્વ લુચોનો સમુદ્ધાય, મહાવીર સમણિત કહ્યાય,
જેણું આત્મ મહાવીર જાણ્યો, સર્વ સાર હૃદય નિજ આપ્યો. જુને ૮
- પરતાત્ત્વ બને નહીં તેહ, જાણું મહાવીરને નિજ તેહ,
નબરસ એકરસદૃષ્ટ થાયે, પોતે પૂજક પૂલય સુહાયે. જુને. ૯
- જુને મહાવીર સ્વામી મળીયા, મારા સર્વ મનોરથ કળીયા,
મહાવીરમાં મનઙું રહેતું, પરમાનંદ રસને લેતું. જુને. ૧૦
- શર્ટથ શુદ્ધ તે વીર પમાડે, જૂઢા જગમાં કહિ ન લમાડે,
જૈનધર્મ ઘટોબટ રહીયો, આત્મલાચે રસિકજન લાંદ્યો. જુને. ૧૧
- જેફ મહાવીરને ઘટ જાણું, તેહ સુકિતપુરી સુખ માણું,
ભૂજિસાગર મહાવીર પાણ્યો, પોતે સાક્ષી બની સુખ જાણ્યો. જુને. ૧૨

(१८)

(२३)

પોતાને સુધારવા શુરૂને વિનાલિની શુંહલી.

આવો આવો યદોદાના કંત અમ ઘર આવો રે. એ રાગ.

મારા જ્હાલા શુરૂ લગવનું, અમને સુધારો રે; કરી કરૂણા પૂર્ણ કૃપાળ, ભવોહથિ તારો રે.	જ્હારા. ૧
આરી આત્મજાનનો છોધ, આત્મ જાણચોડ; ઝુને ચોઝ કરો શુલપાત્ર, માર્ગો ચઠાવો રે.	જ્હારા. ૨
જૈનધર્મ તું સાચું જ્ઞાન, લાવે આપો રે; અમકિત આરિન એ ધર્મ, મધ્યે સ્થાપો રે.	જ્હારા. ૩
આંગો શરણે તમારે ભક્ત, લેહ ન રાખો રે; મારા મનમાંથી મોહ હુર, કાઢી નાગો રે.	જ્હારા. ૪
મહાવીર પ્રભુ દર્શન, વેગે કરાવો રે; આચાર વિચારની શુદ્ધિ, પૂર્ણ પળાવો રે.	જ્હારા. ૫
તુમ આણુમાં સુજ શીર, પ્રેમથી આખુ' રે; શુદ્ધ પ્રેમ કરો તુમ સાથ, અંધા મન જ્યાખુ' રે.	જ્હારા. ૬
શુરૂ કથોને રૂહે જો મોહ, શુરૂ તે શાના રે; શિષ્ય થયોને રહે જો લોહ, શિષ્ય તે શાના રે.	જ્હારા. ૭
તમથી આત્મ કરો હુર, જયોતિમાં લાવો રે; વિષયાનન્હનો વિશ્વાસ, હુર હઠાવો રે.	જ્હારા. ૮
ઝુને આત્મજાનહંમાં મસ્ત, કરશો સ્વામી રે; યુદ્ધિસાગર શુરૂની કૃપા ૭, આત્મરામી રે.	જ્હારા. ૯

(१६)

(२४)

શ્રીમહ આત્મારામજી મહારાજની ગહુંલી.

આરતજ્ઞાન પ્રકાશક સુનિવર, વિજયાનનદ સવાયારે,	
આત્મારામ પ્રસિદ્ધ સૂરિવરણી, જૈનધર્મ પ્રસરાયા. સૂરિવર મોટા રે.	
વંદોવંદો શુરૂ શુષુપુંત, સૂરિવર મોટા રે. વંદો. ૧	
જૈન ધર્મ સાંઘાન્ય વધાર્યું, સેનાપતિ થથ શરારે,	
જૈનધર્મના મોટા ચોક્કા, વાહવિવાહમાં પૂરા. સૂરિવર વંદોરે, વંદો. ૨	
મહુલીર શાસન રક્ષણુ કરવા, અંથ રચ્યા શુષુ અરિયારે,	
શાહિંડક તાર્કિંક પડિત મોટા, સર્વ શુષુણા હરિયા. સૂરિ. ૩	
સુર્વ ખંડમાં ચાવા સૂરિવર, તપાગચ્છ સર્વેગી રે,	
જૈનધર્મ અલિમાની પૂરા, નિગશાસન શુષુરંગી. સૂરિ. ૪	
વીશની સહિમાં જૈન કોમમાં, આત્મારામ સવાયારે,	
શુદ્ધિસાગરસૂરિ શુષુરાગે, પાહરામાં રહી ગાયા. સૂરિ. ૫	

(૨૫)

શ્રી વૃદ્ધિચંદ્રજી સુનિરાજની ગહુંલી

શાંત હાંત સંયમ ગુણુ ધારી, વૃદ્ધિચંદ્ર સુનિરાયા રે,	
શુદ્ધિવિજયળ શિષ્યો માંહી, સમતા શુષુમાં સવાયા. સુનિવર વંદોરે.	
વંદો વંદો રે સુનિ મહારાજ.....સુનિવર વંદો રે. ૧	
સૌરકદેશ સુધારોં મોધે, ભાવનગર દીપાંદું રે;	
જેના શિષ્યો છે વિકાનો, શુકૃથી તેજ સવાયું. સુનિવર. ૨	
વેરાળી ત્યાળી સોભાળી, સુનિવર વંદો ભાવે રે;	
શુદ્ધિસાગર સૂરિ સહશુષીને; પ્રેમ ધરીને જાવે. સુનિવર. ૩	

(२०)

(२१)

હુષ હાનિકારક રીવાળેના નિષેધની ગહુંલી.

(ઓધવણ સંહેશો કહેણે શ્યામને, એ રાગ.)

ચઢતી ન થાતી હુષ રીવાળેથી કદિ,
સમજે મનમાં શાણું નરને નાર જો;
કન્યા વિડ્ય કરનાર હુઃઅ પામતા,
હેશ ડેમની પડતીના કરનાર જો. ચઢતી. ૧

સત્ય પ્રેમ વણું લગન નહીં નરનારીતું,
દેહ લગનથી ધર ધર હોળી થાય જો;
પતિત્રતાતું માન નહીં કે દેશમાં,
પાકે નહીંત્યાં ઉત્તમ જનસસુધાય જો. ચઢતી. ૨

વરનો વિડ્ય કરનારાની ડેમમાં,
અકત થુર નહિ પાકે નર ને નાર જો;
અધલા બાળાના શાપો જ્યાં ખહું પડે,
તન મન ધનની પડતી ત્યાં નિધોર જો. ચઢતી. ૩

ભાલ લગના હેમે હોમાતાં ધણ્ણાં,
ભારતમાંહિ બાળાચોને બાળનો;
ભારતની પડતી હૈ તેથી લઘુણ્ણી,
એડો જનસંખ્યા લક્ષ્મીપર કાલ જો. ચઢતી. ૪

વૃદ્ધોની સાથે બાળાના લગનથી,
વ્યલિચારતું વધતું નિશાહિન પાપ જો;
ભાલક હત્યા ભારતમાંહિ વધતી ધણ્ણી,
માબાચોને બાળાચો હે શાપ જો. ચઢતી. ૫

શુલામ સંતાનો પાકયાં નિર્બલ ધણ્ણાં,
માંલ શોળી ડેઢી ઈધ્યોર જો;
અકત દાનીજન થુર પાકે છે થોડલા,
પાકે પરના તાણે જેવાં ઠોર જો. ચઢતી. ૬

(२६)

हैशन हिंशियारीमां सपडाया धण्डा,
वेश्या परनारी लंपट नहि पार ज्ञे;
हेश कोम ने धर्मनी पडती तेहथी,
माटे जगी चेतो नर ने नार ज्ञे. अठती. ७

देवगुड ने धर्मनी सेवा सहु करै,
सर्व शक्तियो अीलयो नरने नार ज्ञे;
भुजिसागर कैनधर्मने सेवतां,
जैनोनी अठती थायो निधौर ज्ञे. अठती. ८

(२७)

आविकायोने योधनी गुंहली.

शुक्र गुण्डवंत योम उपहिशे, आविकायोने शुभलावेद;
अनो गंगासम रवच्छ दीलनी, अनो गंबीर मननी स्वलावेद. गु० १
कैन धर्म रगोरगमां धरै; पाणो सम्यक्त्व शुभ आचारै;
धर रवगंसमुं करै सहगुणु, करै आतमनो उद्धारै. गु० २
दृढधर्मवंती एक आविका, धर कुकुर्ख हेश सुधारेद;
जैनशास्त्र लघुली गणुली थे, निज संतानोने उद्धारै. गु० ३
हान हेये सुपाने लावथी, हेवगुड दर्शन करी आवेद;
पाणे आविका धर्म प्रेमथी, हेवलैकनां सुभडां पावेद. गु० ४
माटी उमर पुत्रने पुत्रिका, जैनविधिथडी परण्डावेद;
सहु सहन करै, हुःअ उपन्यां, महावीरने लजली लावेद. गु० ५
धरसूत्रने घलवे संपथी, सासु संसरानी करै सेवावेद;
करै संकाण अधिकार धर्मथी, चाँपे सहगुणु गणुना मेवारै. गु० ६
महावीर प्रखु हिलमां धरी, निर्देंप धनी करै काजरै;

भुजिसागर सहगुड योधथी, पामे आविका शिवराजरै. गु० ७

(२५)

(२६)

विश्वव्यापक कैन धर्मनी गुहली.

जग व्यापक धर्म कठे विलु, महावीर प्रभु उपकारीदे;
कैनधर्म सनातन भाष्यशो, ह्याधर्म भयो ज्यकारीदे. जग. १

आत्मशुष्टो ते कैनधर्म छ, जान दर्शन चारित्र भाष्यारे;
नात जत वेष लोह नहि लहां, सहायार शुष्टो भन आश्वारे. जग. २

विश्वमित्र अनी शुद्ध प्रेमथी, टाणो ल्लवोना सहु डोषारे,
आत्मसावथी शुण्गाणु गोपथी, विश्वल्लवोने धहु पोषारे. जग. ३

बैरी उपर बैर न राखीचे, द्वेषी उपर पछु नहीं देषरे;
डोषी धर्मनी निन्दा न कीलचे, उपशमीचे सधारा क्लेशारे. जग. ४

कहि जूङ न योलीचे भाष्यथी, कहि केणी न करीचे चारीदे;
अद्वायर्थ चथायेऽन्य धारीचे, नहीं करवी कहा शिरन्लेन्दीदे. जग. ५

कथो कर्म अमाणु आणीचे, सुण हुःअने जयां त्यां घासेदे;
माटे पाप कर्म नहीं कीलचे, धरी धर्मने ठरने ठासेदे. जग. ६

सहु धर्म रहा के जगविषे, कैनधर्मविषे ते समायदे;
अुद्दिसागर व्यापक धर्म छे, तेथी रागदेष द्वर जयदे. जग. ७

(२७)

पंचमीनी गुहली.

आवे पंचमी तप करीचे लालु, जान भंगनो जभीचे नापदे;
जानावरणी कर्म टणे धालु, जान अगटे फिल अमापदे. आवे. १

सर्व इच्छाचेनो शैव ने, तप कडीचे ते जग साचुँदे;
जान अणुवु अणुवु प्रेमथी, तप तपवामां नित्य राचुँदे. आवे. २

(३४)

જાની જ્યાસોચ્છૈસમાં બેગથી, કરે સર્વ કર્મ વિનાશારે;
 જાન જાનીની કરીએ સેવના, જાન આતમરૂપ છે ખાસરે. ભાવે. ૩
 જાને માપ્તિના જે ઉપાય છે, તે કરવામાં તપ જણોને;
 અનુદ્ધિસાગર પંચમી તપ ભલું, નર નારી ચિત્તમાં આળોને. ભાવે. ૪

(૩૦)

અહીંવીરપ્રભુનો ઉપહેરા. ચુંઠલી.

(વાળાં વાખ્યાં રે વાળાં વાગ્યાં. એ રાગ.)

મહાવીરની વાણી સાંભળો, ખરો ચિત્તમાં નરને નાર-પ્રભુ ગુણુસેવીએ.
 આવે શાતા, ગવ ન કોળુએ, હુઃખ આવે ન શોક લગાર. પ્રભુ. ૧
 ધન્દ થાતાં ગર્વ ન કોળુએ, થાતાં ગરોણ ન કરીએ શોક. પ્રભુ. ૨
 પુષ્ય પાપનું ઇલ સુખ હુઃખ છે, આત્મરૂપથી જિન્હ તે છોક. પ્રભુ. ૩
 કર્યાં કર્મ ઉદ્ઘયમાંછિ આવતાં, નહીં છોક ધન્દને રંક. પ્રભુ. ૪
 સમબાવે જે કર્મને લોગવે, તેહ જાની મહા અવટંક. પ્રભુ. ૫
 રાગદ્વિષ વિના નહીં બંધ છે, રાગદ્વિષ વિના કરો કાજ. પ્રભુ. ૬
 કોઈ ઉચ્ચય નીચ નહીં આતમા, સરખો આતમ સાઓન્ય. પ્રભુ. ૭
 મહાવીર પ્રભુ નિત્ય સેવીએ, સર્વ વિશ્વનો છે એ આધાર. પ્રભુ. ૮
 અનુદ્ધિસાગર ગુરુગમ ખોધથી, થાવે આનંદ અપરંપાર. પ્રભુ. ૯

(૩૧)

શ્રીગોતમગુરુની ચુંઠલી.

(વાળાં વાખ્યાં રે વાળાં વાગ્યાં. એ રાગ.)

શુહેરોતમ સમ ગુરુ કો નહીં, જેનું નામ છે મંગળ રૂપ.
 પ્રથમ ગુરુ વંદીએ.
 મહાવીર પટોધર પાઠવી, ઠંડાલા વીરપ્રભુ છે અનુપ. પ્રથમ ૧

(२४)

શુરૂ જોતમનો મહિમા ધર્ષો, સહુ લભિતથ્યા લંડાર. પ્રથમ૦
નેહ જોતમ શુરૂ ગાવશો, તેહ સુધી થશો નરનાર. પ્રથમ૦ ર
બૈન ધર્મ જગતુ હેલાવીશો, કરી મહાવીર પાસે વાસ. પ્રથમ૦
ખુદ્દિસાગર જોતમ સફશુરૂ, પ્રથમો નરનારી ઉલ્લાસ. પ્રથમ૦ ઉ

(૩૨)

મૈન એકાદશીની શુંહલી.

(એની રવિસાગર શુરૂ વાંદીએ. એ રાગ.)

મૈન એકાદશીને આરાધીએ, એમ સફશુરૂ હે ઉપદેશ,
ઉપવાસ ને મૈનપણું ધરો, નેથી નાસે ભવ લય કલેશ, મૈન૦ ૧
નેમિનાથ પ્રભુ ઉપદેશથી, શ્રીકૃષ્ણ આરાધી એહ;
તેમ આરાધો વિધિયોગથી, પામો સ્વર્ગ સિદ્ધિ શુભ હેહ. મૈન૦ ૨
હેહ વાણી મન મમતા તજે, ધર્ષા દૈધ્ય તપ કહેવાય;
ભૂતકાળનાં કર્મ ધર્ષાં ખરે, નિરાસજિતએ કર્મ કરાય. મૈન૦ ૩
યથા શક્તિ તપ જ્ય કીણુંએ, નેથી તન મન શુદ્ધિ થાય;
ખુદ્દિસાગર આતમ નિર્મલો, શુદ્ધ પરમાત્મ પહ પાય. મૈન૦ ૪

(૩૩)

ચૈદશાની શુંહલી.

અવિ તથે વહોરે સૂર્યિંદર ગંધરવાયા એ રાગ.

અઉદ્ઘો કરનેરે મત ચૈપથ પદ્યખાણ,
તપ શુદ્ધ વરશોરે શિરધરી શુહની આણ;
અઉદ્ઘો વીર આગમ સાંભળીએ, પરિહરિને સહુ કામ,
આરિન શુદ્ધ આરાધન કરીએ, દહેએ વીરતું નામ. અઉદ્ઘો. ૧

(२५)

હ્યા દાનને હમ આઈરીએ, પશ્ચાત્તાપ ન કરીએ;
 થથા શક્તિ શુભ ધર્મને કરીએ, આત્મને ઉદ્ધરિએ. ચઉદ્દશો. ૨
 શોહમાયામાં જે મકલાયા, વિષય વાસના વાયા;
 જૈનધર્મ સમજ્યા નહીં પામર, જન્મ જન્મ હૃદ્ય પાયા. ચાં. ૩
 સર્વ ગ્રમાહો હૂર કરીને, સાંભળો સફુરુર વાણી;
 સુષુપ્તાં ધર્મ હૃદ્યમાં પ્રગટે, નિશ્ચય એથો જાણી. ચઉદ્દશો. ૪
 ધર્મ કરે તે પરબ્રહ્મ સુખિયાં, જગમાં નર ને નારી;
 શુદ્ધિસાગર ધર્મ જનની, નિત્ય જાડ અલિહારી. ચઉદ્દશો. ૫

(૩૪)

ચોમાસાની શુદ્ધલી.

એની રવિસાગર શુરૂ વંદીએ. એ રાગ.

પુષ્યકારી ચોમાસુ' એસીથુ', તમે ધર્મ કરો નરનાર,
 એક ડેકાણુ રહે ત્યારીએ, કાઢે તપ જપ કરતાં કાળ. પુષ્ય. ૧
 શુરૂ સુખથી સુણો આગમ લલાં, કરો સાંત સમાગમ આસ,
 આવશ્યક સામાચિક તપ કરો, ધરો ધર્મ ઉપર વિશ્વાસ. પુષ્ય. ૨
 પાળો ધર્માચારને ભાવથી, શુરૂ પાસે રહી કરો શાન;
 દાન સુપાત્રે દો ભાવથી, લને ભાવે વીર બગવાન. પુષ્ય. ૩
 કરો વત નિયમ ભાડુ ભાવથી, જેથી થાવે હૃદ્યની શુદ્ધિ;
 શુદ્ધ હૃદ્ય થવાથી સા'પજે, અદ્યાતમ સાલિંક શુદ્ધિ પુષ્ય. ૪
 પુષ્ય પવો ચોમાસામાં ધલ્યાં, યથાશક્તિ આરાધો ભંધ;
 શુદ્ધિસાગર જીવદ્યા કરો, ધરો ધર્મિજન કર્તાંધ. પુષ્ય. ૫

(२६)

(३५)

અષ્ટસીની ગુંહલી.

ભવિ તમે સુષુણે રે ભગવતી સૂત્રની વાણી.

આડચે આડે મહને વારો, માનવ લવ નહીં ધારો,

આડ અકારે આતમ સમજુ, અષ્ટસી ગતિને ધારે

ભવિ તમે સુષુણેરે, સાચો શુદ્ધનો ઉપરેશ.

ભવિ. ૧

આડ પ્રલાષ્ટકના શુણુ ધારો, પાળો ધર્માચારો,

દર્શન જ્ઞાન ચરણુ શુણુ સેવો, સર્વ પ્રમાણો વારો.

ભવિ. ૨

આડમ જૈવી અષ્ટ સિદ્ધિને, પામો નર ને નારી,

ખુદ્ધિસાગર જૈનધર્મની, નિત્ય જીવ અલિહારી.

ભવિ. ૩

(૩૬)

જગદૃગુરુ હીરવિજયસૂરિની ગુંહલી.

રધુપતિ રામ હૃદયમાં રહેણે રે. એ રાગ.

જગદૃગુરુ હીરલાસુનિ રાયા રે, હીરવિજયસૂરિ શુક્રરાયા, જગદ.

જૈનધર્મ જગતમાં હૈલાયોરે, જૈનધર્મ માં રંગરૈલાયોરે.

જાન સાથમાં લયલાગો.

જગદ. ૧

ખાદ્યશાહ અકંધર પ્રતિભાધ્યોરે, જીવહિસા કરતાં દોધ્યોરે,

હિલમાં પરમાત્મા શોધ્યો.

જગદ. ૨

વેરોગી ત્યારો સવાયારે, તપસી પુષ્યવત સુહાયારે,

ભાવે સેવે સુનિ સસુદાયા.

જગદ. ૩

દેવદેવી કરે જસ સહાયરે, જેને મળિયા પ્રભુ હિલમાંદ્યારે,

દુરી કદમ્પ વૃક્ષની છાંય.

જગદ. ૪

એજા જગદૃગુરુ શુણુ ગાવોરે, જેનો દેવપણુ છે પ્રલાયોરે.

ખુદ્ધિસાગર સફશુદ્ધ ધ્યાયો.

જગદ. ૫

(२७)

(३७)

શ્રી હેમચંદ્રસૂરિની ગુંહલી.

અધિ. તમે સુષુપ્તે રે કાગવતી સુત્રની વાણી. એ રાગ.

અવિ. તમે વન્દો રે, હેમચંદ્રસૂરિશાયા;
યશોશુણું મહિમારે, નષ્ટય જુવનમાં સુહાયા.

કલિકાલમાહિ કેવલી સરખા, સર્વ જ ણિડુદે પાયા;
કુમારપાલ રાજ કરી. આવક, રાજ્યશુરુ કહેવાયા, અવિ. ૧

નેહિક ઘણાચારી મહાયોગી, ચુગ પ્રધાન સવાયા;
નૈનધર્મ ડ્વોત કથો બહુ, સુરનર સુનિવર ગાયા, અવિ. ૨

લારતહેશ શોકાંયો જેણે, હ્યા સર્વત્ર હેલાવી;
નૈનધર્મનો સ્તાંભ જે મેટો, ધર્મની હાથમાં ચારી અવિ. ૩

સિદ્ધિહેમ ન્યાકરણ શુભ રચિયું, ન્યાય સિદ્ધાન્તનાં અન્યા;
લારતમાં કવિતરન પ્રથમ જે, સમજનાંયો શિવપન્થ. અવિ. ૪

મહુવીર પ્રભુના લક્ષ્મા સાધુમાં, અથણી શાની સુહાયા;
શુદ્ધિસાગર ધર્મ પ્રલાવક, પ્રેમ પ્રથમસું પાયા. અવિ. ૫

(૩૮)

શ્રીમહા હેવચંદ્રની ગુંહલી.

બહુતા યુરરાજ ઉપહેશ એપાપ. એ રાગ.

શુરુ હેવચંદ્રણુ પહુંઢો, લાયોલવનાં પાપ નિકંઢો. શુરુ.

રચ્યા અંથ ધણ્યા શુણુકારી, નયચક આગમસાર લારી;
ધીન અંથ ધણ્યા સુખકારી— શુરુ. ૧

જેહ અધ્યાતમ ઉપયોગી, જેહ આતમશુણુગણ લોગી,
તરવજાની સહજશુણુ ઘોગી— શુરુ. ૨

(२८)

- निज शुद्धातम हिंस च्याहे, मोहभावने मान्यो न्याही;
जेना घटमां जान अपारो— शुड. ३
जैनशासननी करी सेवा, पाभ्या आतमसुखना मेवा;
अबु लक्ष्मिनी साची हेवा— शुड. ४
जैनकोमामां जेह प्रसिद्ध, जेना अंथ हिंसे सुख अद्वितीय;
भुद्धिसागर लहोवा लीध— शुड. ५

(२९)

श्री हरिभद्रसूरिनी गुणली.

भवी तमे सुखुलेरे अगवती सूननी वाणी ऐ ए राग।

- अवि तमे वहो ऐ, हरिभद्रसूरिराया,
शुषुगण वुहो ऐ, प्रेमे प्रणुमो पाया.
महावीर प्रखुत शासन लेण्हु, लारतमां झेलायुः;
अउहशो अंथ रची निज शक्ते, जानयोगी पठ पाखुः. अवि. १
पूरवधर जिनशासन धोरी, भहु क्षुत हाथमां होरी;
सर्व गीतारथ शोभर धोगी, बाव मध्यस्थ अद्योरी. अवि. २
अक्षजयोत मूर्ति तेजेभय, सर्व सिद्धांतनो हरियो;
महावीर पट्टधर लारतलानु, अनंत शुशु गणु अरियो. अवि. ३
सुरगंगा सम लेहनी वाणी, मन पांकज सम लेनुः;
आतम तेज लर्हु अथेमां, मनन करयो तेनुः. अवि. ४
जगी तपी जानी अबु ध्यानी, मुनिगणुना शिरहार;
भुद्धिसागर परम प्रेमथी, वंह वारंवार. अवि. ५

(३०)

श्री भद्रभाङ्गुस्वामीनी गुणली.

राग उपरनो.

- अवि तमे वहो ऐ, भद्रभाङ्गु शुडराया;
अउहश पूर्वी ऐ, प्रेमे प्रणुमो पाया.

(२४)

- जैनधर्मना धोरी गुनिवर, ध्यान समाधि पाया;
अप्रभात इशा शुण्डीयोऽपि, जस सुरनर शुण्डगाया। लवि. १
- चंद्रसमा समताथी शोषे, आत्मलानुथी ओषे;
आत्महृपमां भस्त अनीने, अशुद्धि परिष्णुति देषे। लवि. २
- जिनशासन धोरी थया ओवा, सहशुणु तेमना लेवा;
शुद्धिसागर आत्म उलगर, शानिनी करवी सेवा। लवि. ३

(४१)

अक्षयर्थनी चुंडली.

लवि तमे वाहा रे सरोथर गच्छराया। ए राग।

- वीर उपहेशे रे, सांखणे नरनारी;
अक्षयर्थने पाणे रे, आत्म शुणु हितकारी।
अक्षयर्थ शुड्कुण आश्रमथी, बाणकने डेणवीओ;
अक्षयर्थना शुणु समजवी, शक्तिये मेणवीओ। वीर. १
- पञ्चीश वर्ष लगे पुढ़ने, वीश वरस लगे नारी;
अक्षयर्थ धारण शुणुकारी, लम पठी जयकारी। वीर. २
- आलवण भैयुनथी संतति, निर्णल रोग भरेली;
जगमांही शुवना नहीं लायक, शक्त न होय सुधरेली। वीर. ३
- हस्तकर्मथी निर्णल रोणी, आलक पुढ़यो थावे,
लगने लायक नहीं तेवा जन, पडती ठेली पावे। वीर. ४
- ब्यजियार करनारा लोडे, आत्म शक्ति विनासे;
चांही परमो विरहोटक क्षय, तुर्त मरणु होय पासे। वीर. ५
- वीर्य विना नहीं शुवन जगमां, लोडे शुलामो सरभाः;
हेह वीर्य वष्ट आत्म वीर्य न, वाहण वष्ट नहीं वर्षी। वीर. ६
- मतिनिश भैयुनने करनारां, लोडे शुलाम जिचारां;
वंश पर'पर पडती पामे, हुश्चारिन नडारां। वीर. ७

(३०)

वंश राखवा माटे गुहीजन, पाई उभरे सुरेणा;
 कामोदय निवारणु माटे, वर्ष लग्न करे शुण्यमेणा। वीर. ८
 हेहीर्यं गुंडे रक्षणु करतां, पुष्य अनंतु थावे;
 वीर्यं ना रक्षणु सम नहि तत डै, सागर सम ए कहावे. वीर. ९
 अक्षयर्यं नी किं भत नहीं जयां, त्यां नहीं धर्मं तुं नाम;
 आत्यकालथी अक्षयर्यं थी, निरोजी गुण्याम। वीर. १०
 त्यां धरयारी सहु समजे, मन लुतो मोहमारी;
 देशोदय धर्मोदय माटे, अक्षयर्यं जयकारी। वीर. ११
 द्रव्यलावथी अक्षयारी जे, ते जन सुकित पाया;
 शुद्धिसागर अक्षयारीना, प्रशुसु निशादिन पाया। वीर. १२

(४१)

सुधारानी गुंडली, श्री महावीर मलुनो उपहेश
 अवितमे वंहा रे. ए राग.

वीर उपहेशे रे, सांलग्ने नरनारी;
 करने सुधारो रे, समग्ने सुखारी.
 माझं शासन जग फैलावो, आतम आप सुधारी;
 परभातम पह वरवा प्रेमे, हुर्णेणु वा संहारी। वीर. १
 मात पिता ने वृद्धज्ञोनी, सेवा करवी सारी;
 अक्षयर्यं धरतुं अधिकारे, हेश सेवा हिल ज्यारी। वीर. २
 सात्त्विक आबुं सात्त्विक भीवुं, दाढ़ मांस निवाचे;
 हयाभ्य निज चित्त करीने, हुर्णुद्धि द्वर टाणे। वीर. ३
 प्रभाणिक रहेकुं सहु वाते, जूङुं न वहीचे कथारे;
 ज्ञेनधर्मं ने पाणे, प्रोते, आप तरे ते तारे। वीर. ४
 हानिकारक हुष्ट रिवाने, तनधनना क्षयकारी;
 तलुओ तेने तत्क्षण शाने, पापकर्म तल लारी। वीर. ५

(३१)

निज आत्मनत् सहु ल्लोगे, मानी सहा शुभ करीओ;	
काम केंद्र माया मह वारी, लघुताच्छे संचरीओ.	वीर. ६
सर्व ल्लोपर प्रेम धरीने, पठतां हुःअ निवाचो;	
सातक्षेत्रने चोये प्रेमे, तेथी धर्म अपारा.	वीर. ७
हेशकेम नातिनिमां, सरणा सहुने मानो;	
विद्या साची जग इलावो, भोग न धरवो कशानो.	वीर. ८
कीधां केमी लोगवामां, समलावे नित्य रहीओ;	
परतंत्रता सहुनी हरीओ; संकट पडियां सहीओ.	वीर. ९
आत्मना सहयुगुने पामो, पंचाचारने पाली;	
गुहीत्यागीनां नव आराधो, सहयुद्धि करी न्हाली.	वीर. १०
मारी शिक्षा आराधे ने, भवसागर ते तरशे;	
मारा लक्तो हुर्गति त्याणी, सहगति सहेने वरशे.	वीर. ११
महावीर प्रभुनी शिक्षा एनी, विश्वल्लोगोना माटे;	
गुद्धिसागर समल अविज्ञ, वणजे वीरनी वाटे.	वीर. १२

(४३)

जेना हृदयमां महावीर वस्या, तेना गुणोनी गुणदी.

आयो आयो धरोहाना कंत, ए राणा.

जेना हितमां महावीर वास, तस ए निशानीदे.	
थाय विषयोमां न आसक्त, नहि अलिमानीदे.	जेना. १
प्रभु महावीर श्वासोन्धौस, अजपाजपेदे;	
अध्यात्म यनी महावीर, विश्वमां द्यापेदे.	जेना. २
सर्व ल्लोगी सारे सेव, द्वेष न धारेदे;	
जडने पूज्यक नहीं थाय, चित्त शुद्धारेदे.	जेना. ३
जैनधर्म ते आत्ममांहि, शुद्ध पूजनीदे;	
करे उपकारनां सहु कर्म, ममता वारीदे.	जेना. ४

(३२)

नाम इपनो नहि अध्यास, अकित रसीलो।
कर्मयोगी सदा शुरवीर, नहि ने दीलो। जेना. ५
जैनसंघ उपर दठ प्रेम, धरे शिर साटो।
सर्व लुबोने कड़खु ग्रेमनी, वाणे वाटो। जेना. ६
साचा महावीर प्रखुना लक्त, थया शुखु अगियारे;
शुद्धिसागर अकित हजूर, प्रखुवीर भणीयारे। जेना. ७

(४४)

प्रखु महावीर लज्जार्थी अगटता गुणो।

आवो आवो यशोदाना कंत अभ वेर आवोरे, ए राग।
महावीर लज्जार्थी मोक्ष, विश्वनो थावोरे;
लज्जे महावीर अज्ञानाप, द्रूयने लावोरे। महावीर. १
आप असंज्यप्रहेशी स्वरूप, पिंडमां व्याप्यारे;
वैराटे सहु ध्वांड, समष्टिये छाप्यारे। महावीर. २
उहने न्हाला तमे लगवान, सहु पर्योरो;
उहारा हुडामां आप हजूर, विराजे सवाईरे। महावीर. ३
श्वासोश्वासे तमारो जप, पापने टाणे रे;
भूद्याने भार्ग भतावी, तुम पढ वाणोरे। महावीर. ४
आप रक्षणु करता ढेव, छो प्रतिपाणोरे;
लक्तोना हिलमां वास, छो रभवाणोरे। महावीर. ५
दीर समयों पाप अनन्त, क्षणुमां ज्वेरे;
उहने आशरो ताहरो झेक, अन्य न जावे रे। महावीर. ६
करे हरिहर ताहरी सेव, ढेव ने ढेवी रे;
आतां पीतां हरतां थाह, आवे छे सेवारे। महावीर. ७
उहारी राखो महावीर लाज, काज सुधारोरे;
धू अडेमां तुं झेक, प्रगटयो ख्यारोरे। महावीर. ८

(३३)

- जयां त्यां क्षयालुं त्याहि तुंहि तुंहि, सहमें सुहतोरे;
करी हर्षन तहारां हेव, सुध बहु पातोरे. महावीर. ५
- वीर नाम समें नहीं जप, जगमां हीठोरे;
अहने लागे छे दिलमांही, सर्व थी भीठोरे. महावीर. १०
- अरिहंत प्रभु महावीर, लय तव लाभीरे;
महारी कायामां रहेनार, थथो हुं सैलाभीरे. महावीर. ११
- ओक इपे भणी अगवान्, तुजमां समायोरे;
भुद्धिसागर महावीर हेव, आत्म सुहायोरे. महावीर. १२

(४४)

सेवानी गुंडवी.

अवि तमे सुखजेरे अगवती सूनती वाणी. ए राग.

- अवि तमे करजेरे, वीर प्रभुनी सेवा;
वीर गुणु वरशोरे, पामें अमृत भेवा—
पशु पाणी नरनारी सर्वे, सहुमां महावीर धारी;
संश्वेषनय सत्ता सापेक्षा, आत्मवीर निधीरी. अवी. १
- साधुसन्तनी सेवा करीजे, संघ सकलनी प्रेमे;
सर्व लुचोना हुण्ठु उरीजे, दोजो हरीजे रहेमे. अवी. २
- सेवा करवा नात जातो, धर्मनो लेह न गाणीजे;
जैनधर्म सेवा इपी छे, दया धर्म दिल लाणीजे. अवी. ३
- हुँगी जननां हुँगो हरवां, भूष्यांने अवरवेचो;
परमारथमां तन धन घर्यो, दान करीने आवो. अवी. ४
- लय ऐहने देव त्यजे ते, सेवा करे जग साची;
इर्ज गाणीने सेवा करतां, थांजो नहीं जन पालु. अवी. ५
- तन धन मन सहु सेवा माटे, भणीयुं निश्चय जाण्हु;
वापरयो विवेक धरीने, वेते नहीं ते झाण्हु. अवी. ६
- ५

(३४)

सार्वजनिक कामो शुल करतां, करो न पाषी पानी;
 अहंकृ सेवा करीने वीरनी, सुखुने आगम वाणी. लवी. ७
 हर्ज न चूडो धर्म न भूडो, आतम शुणु प्रकटायो;
 काया मन उपयोगी साधन, परोपकारे लावो. लवी. ८
 हेव शुद्धनां प्रतिहिन दर्शन, करीये वत शुल धरीये;
 सहशुद्धनी सेवा शुल लावे, सर्व समर्पी करीये. लवी. ९
 अनी प्रभाषिक धंधो करवो, परनो आणु न हथुवो;
 कडेष्ठी करतां रहेष्ठी निर्भल, धरवी निश्चय लाष्ठुवो. लवी. ११
 कुट्ठं राति हेश कैमनी, हेश राजय शुल माटे,
 घुळिसागर सेवा करने, जैनधर्म शिर साटे. लवी. १२

(४५)

महावीर ग्रन्थानां वचनामृतोनी शुङ्खली.
 आवेद्यादो यशोदाना कृत व्यम घेर आवेदे. ए राग.
 महावीर कडे सुषेण लोक, शिखामधु मारीदे,
 वर्ते सुख पासे तेह, नर अने नारीदे. महावीर. १
 महारा भक्तो न पासे नाश, हुक्य सुख धारीदे;
 घुळिकरतां श्रद्धा अष्ट, हिंद अवधारीदे. महावीर. २
 करे हुनियापर साम्राज्य, शक्ति वधारी दे;
 शुते शक्तिये जग सर्व, गर्व निरारीदे. महावीर. ३
 गृहाङ्क द्यान धरीने लेह, कर्म करता दे;
 शुते तेवा जैनो विश्व, भायी न भरतारी. महावीर. ४
 भरा भावथी मारी भक्तिमां, जे भगिया दे;
 तेवा जैनो भक्ती पेड, थावे भगिया दे. महावीर. ५
 लेह स'पहमां नहीं हर्ष, धरता कथारे दे;
 दीन थाय न हुःअ पठंत, झुने न विसारे दे. महावीर. ६

(३५)

हुःअ सुखने शुद्धिसम जेह, शिक्षाचे जाणू दे;	
निज कर्म न चूके कोई, हृदय सुख आणू दे.	महावीर. ७
जैन धर्मने पाणे पूर्ण, ज्यां लगी टेके दे;	
त्यांसुधी कणाचे पूर्ण, वधता विवेके दे.	महावीर. ८
गाणू मानव जाति न तुच्छ, मांडा मांडे दे;	
ओकात्मा अनी रहा सर्व, कर्तव्य धांडे दे.	महावीर. ९
धरे हेह उपर नहीं भेड, निर्बाय थावो दे;	
भीकवता रहा सहु शक्ति, मैत्री भावो दे.	महावीर. १०
आतममां रही सहु शक्ति, पडहा निवारो दे;	
चोते कर्ता छो सुख हुःअना, भन धारो दे.	महावीर. ११
सत्ताचे सहु लुव वीर, कोई न हीन दे;	
भन लुतीने सहु लेइ, घनशो जैन दे.	महावीर. १२
भन लुते ते छे वीर, ओहवी वाणी दे;	
युद्धिसागर धरीने विता, करशो कमाणी दे.	महावीर. १३

(४७)

यशोदानी वीरप्रभुने विनाति.

आवो आवो यशोदाना कंत अग वेर आवो दे. ए दागा.

कडे पत्नी यशोदा, वीरने ओम वचनो दे.	
सांलगतां प्रगटे प्रेम, सुखुने सुजनो दे.	कडे. १
भारा आणुक्षर महावीर, द्वामी दृपाणा दे;	
गहने शिखयो सात्विक प्रेम, कामणुगारा दे.	कडे. २
धातोधाते असंख्य प्रदेश, तमथी रंगाई दे;	
गहने उपशम क्षायिक लावनी, छे वधाई दे.	कडे. ३
शुद्ध प्रेम आकृष्यो द्वामी, थांचो न न्यारा दे;	
गहने भणिया भेटा पुण्य, शुद्ध अवतारा दे.	कडे. ४

(३६)

प्राण्य पठतां न जुही थाउ, धर्मजु' न धीन्तु' दे;	
सुभ हःअ प्रसंगे देव, हेणी रीञ्जु' दे	कडे. ५
स्वामी साथे आत्मसावधी, रहे लावे दे;	
तेह पत्नी कहावे सत्य, प्रेमने ढावे दे.	कडे. ६
आँधोया कमले रविधी प्रेम, अगटे विक्से दे;	
चायणी थंद्रोहय हेखीने, तन उलसे दे.	कडे. ७
तमे अनन्द धनो तो प्रेम, अकोरी सुहालु' दे;	
तमे सागर तो हुं तरंग, साथ रहालु' दे.	कडे. ८
तमो पुण्य धनो तो सुगंध, हुण्य चीकाशा दे;	
तमे आत्म तो हुं चेतना, गुणवासरे.	कडे. ९
तमे परमेश्वर हुं शक्ति, शुद्ध रवभावे दे;	
प्रथु कालमां जिज्ञ न थाउ', अनुशन ढावे दे.	कडे. १०
परथक्ष ने आनन्द रूप, ऐनी जेडी दे;	
आधार आधीय स्वदृप, करे डो न हेडी दे.	कडे. ११
तवलीला अपर-पार, स्वामी लक्ष्मणा दे;	
अनुशन्या प्रदेशो प्रदेश, रहा नहीं उछुरे.	कडे. १२
शुद्ध प्रेमथी स्वामीनी साथ, रंगे रंगाती दे;	
तेह देवी कहावे पत्नी, निर्मला छाती दे.	कडे. १३
जेह शुद्ध प्रेमथी पत्नीने, डिलधारे दे;	
तेह स्वामी कहातो देव, गुण संभारे दे.	कडे. १४
शुद्धप्रेमथी हंपती ज्ञेड, आनन्द ज्ञेणी दे;	
जयां पुद्दलनो नहीं प्रेम, अन्तर योगी दे.	कडे. १५
जडसुखनी स्वार्थ, हंपतीनुं ज्ञेडुं दे;	
सत्य सुण भगो नहीं लेश, थाय क्लेडुं दे.	कडे. १६
जडसुखनां लूहयां जेह, हंपती क्यांथी दे;	
हेहदृपने लोग विनाश, पक्षात्तापी दे.	कडे. १७

(३७)

મહારા આતમ સહુણા વીર, આતમ લાવે રે;	
હું તો રહી હું તમારી સાથ, હ'પતી દાવે રે.	કહે. ૧૮
શુદ્ધ પ્રેમ રસીલા વીર, વીર હું જ'પતી રે;	
થયો દ્રોધ લાવથી મેળ, પ્રેમમાં રમતી રે.	કહે. ૧૯
મહારા સત્યપતિ મહાવીર, મનના રાજ રે;	
ત્રષ્ટ બુવનના રખવાળ, ધરો નિજ માળ રે.	કહે. ૨૦
સત્તાએ અનાહિ અનાંત, સાંખ્ય છાજે રે;	
મળે આતમને નિજ આતમ, ગુણગણ રાજે રે.	કહે. ૨૧
દેહને વળી દેહાતીત, સર્વ પ્રસંગે રે;	
પ્રલે!!! રહીશું તમારી સાથ, અતુલવ રંગે રે.	કહે. ૨૨
મારો તુમથી નિત્ય સાંખ્ય, દોડયો ન છૂટે રે;	
કોટિ કોટિ કરે ઉપાય, તોડયો ન તૂટે રે.	કહે. ૨૩
દેહ કામના જેહ સાંખ્ય, ક્ષણુમાં વિનાશી રે;	
આતમ આતમના જેહ સાંખ્ય, તે અવિનાશી રે.	કહે. ૨૪
અધ્યાત્મ પ્રલુબ મહાવીર, જાક અમણા રે;	
ચોય જ્ઞાન સાંખ્ય આતમની, કરો લીલા રે.	કહે. ૨૫
લીલા દ્વારી પ્રલે!!! તુમ નાર, કુદ્રત માયા રે;	
ખાલી જડ હુનિયાની મંહી, પડે નહી ધાયા રે.	કહે. ૨૬
એવી રત્ન નચીની લક્ષ્મી, હું કહેવાઈ રે;	
પ્રલુબ પત્નીની આતમ શુદ્ધ, સત્ય સગાઈ રે.	કહે. ૨૭
પ્રલુબ સાકારી નિરાકાર, દૃપ તમારું રે;	
ત્યાં પ્રેમથી થઈ તલ્લીન, તમને ભાગું રે.	કહે. ૨૮
તવ જ્ઞાનમાં વિશ્વ અનાંત, સ્વર્ગ સમાયાં રે;	
જ્ઞાન સર્વિમાં લય સર્ગ, સમયે સુહાયાં રે.	કહે. ૨૯
મહારા દેહ હેવલની માંહિ, જ્હાલા બિરાને રે;	
જ્ઞાન તેજ અનાંત અપાર, જયોતે છાને રે.	કહે. ૩૦

(३६)

- મળે ભક્તિ પ્રતાપે હેવ, વિશ્વા જાયો રે;
ફૈનો મહિમા સહુ જગમાંહિ, શક્તિએ છાયોરે. કહે. ૩૧
- કરે' અનુભવ મંગલ તીપ, આરતી રજો રે;
મહેશો મહેશ અનન્ત, શુણુની સંગે રે. કહે.. ૩૨
- તુમવથું નહીં ધીને કોઈ, અદ્રેત જેવું રે;
થયું લક્ષ્મિ જ્ઞાન પ્રતાપ, જેવા જેવું રે. કહે. ૩૩
- સ્વામી એકજ મહાવીર, ધીનાન દીકા રે;
ચૈમ રેમે મહેશો મહેશ, લાગ્યા મીકા રે. કહે. ૩૪
- કર્તા હત્તા મહાવીર, સદસહ હૃથી રે;
પરમેખર જગદાધ્યાર, નાઠી અરૂપીરે. કહે. ૩૫
- પ્રેમ વીર પ્રભુનો જાપ, અન્તર કરનો રે;
અવો પત્ની થશોદ્ધ પ્રેમ, અન્તર વરનો રે. કહે. ૩૬
- રૂપારૂપ પહસ્યને પિંડ, ધ્યાનના યોગે રે;
પગટે અન્તર મહાવીર, સ્વાર્પણુ લોગે રે. કહે. ૩૭
- લક્ષ્મિ આપીન લગ્નવાન, વિશ્વા જાયારે;
મળે અનુભવ દર્શન યોગે, વિશ્વના રાયારે. કહે. ૩૮
- અધ્યાત્મ પલુ મહાવીર, પ્રેમ મળીયારે,
યુદ્ધિસાગર હજરા હળુર, ધર્મિષ્ઠ દ્રગ્યાં રે. કહે. ૩૯

(૪૮)

શુરુ વિહાર શુંહદી.

સ્વામી શાતામાં રહેશો. એ રાગ.

- નહેલાં નહેલાં દર્શન દેશો, પરમ શુરુ થાતામાં રહેશો,
અવોલવ ઉપકારી શુરુ મહારા, ધન્ય ધન્ય શુરુણ અવતાર;
પ્રાણુથકી બહુ ધ્યારા.....પરમ. ૧
દીલ અમારાં ધારું પ્રતિગોદ્ધ્યાં, આરત દૃષ્ટિ બહુ શોધ્યા,
આવતા હુર્યુણ રોધ્યા.....પરમ. ૨

(३८)

ઉપકારો અમપર બહુ કીધા, પોતાના ગણ્ણી ઉપહેશ દીધા.	
કાજ અમારાં સિદ્ધયાં.....	પરમ. ३
મહિમાવંત અતિશય ધારી, વત્ધારી શુકૃ સત્ય આચારી;	
જિન શાસન જયકારી.....	પરમ. ४
અદ્ધાર્ય સત્ય ગુણગણુ હરિયા, ઉપશમ સંવેગ શમહમ ભરિયા; આતમ અતુલવ વરિયા.....	પરમ. ५
પથર જેવાં નર અને નારી, પ્રતિણિધ્યાં ઉપહેશે ભારી; તવ વાણીની બળિહારી.....	પરમ. ૬
તવ ગુણ ગણુટાં પાર ન આવે, સુરશુકૃ જેવા થાડી જાવે; વિરહે ન લોજન લાવે.....	પરમ. ૭
વાખુ પેઠે વિચરંતા સુહાવો, મનમાં પ્રતિષ્ઠા લેશ ન લાવો; અમપર કર્ણાંન લાવો.....	પરમ. ૮
અમને તુમવણુ લેશ ન ગમતું, મનડુ અમારું તુમમાંહિભમતું; તુમ શુણુ રહે મન રમતું.....	પરમ. ૯
શારી લીધું મનડું અમારું, સુજ આતમના સત્ય છે તારું; ક્ષણુ ક્ષણુ મનમાં સંભારું.....	પરમ. ૧૦
આવને પાછા પ્રેમ ધરાને, લક્ષોની પ્રભુ લક્ષિત સમરીને; કર્ણાંન ઘૂળ કરીને.....	પરમ. ૧૧
તુમ વિરહે અમ ચિત્ત ચિરાતું, શુકૃ જાણો અમ મન જે થાતું; હઃખ હુંએ ન સહાતું.....	પરમ. ૧૨
નયણુ વહે છે આંસુની ધાર, વિનતિ કરે છે નર ને નાર; દર્શન હેશો કૃપાળ.....	પરમ. ૧૩
તુમ લક્ષિત સાચી શુકૃરાયા, એક તમારી સાચી માયા; ધન્ય પિતા તવ જાય.....	પરમ. ૧૪
શ્રી શુકૃ ભગવન् આશિષ હેશો, યુદ્ધિસાગર શુકૃ શાતામાં રહેશો; સંહેશા શુલ કહેશો....	પરમ. ૧૫

(४०)

(४५)

શ્રીમોહનલાલજી મહારાજની શુંહલી.

અદીસાહેલી જગમતીરથ જેવા ઉલ્લી રહેણે.

મહાન્નતધારી મોહનલાલજી મુનિવર જગ જયકારી.

સમતા સાગર ગંભીર ત્યાગી વૈરાગી શુણુકારી.

વાણી સાકર સમ ખડુ ચીઠી, કરી સંગત અનુભવથી દીઠી;
શીતલ અમૃત શુણુની વૃદ્ધિ.....મહાનત. ૧

નેહની વાણીમાં રહી સિદ્ધિ, સેવા આપે ખહુલી ઝાંદિ;
નેણું અલઘ હેકીરાધ લીધી.....મહાનત. ૨

ભારતમાં કીર્તિ હેલાધ, સુભાઈમાં જ્યાતિ પાધ;
મર્ગધર શુર્જન શોભા છાધ.....મહાનત. ૩

જિનશાસનની સેવા સારી, પ્રતિષેધયાં ભારત નરનારી;
નિઃસ્વાર્થી થયા ખડુ ઉપકારી.....મહાનત. ૪

નહીં ગચ્છ કદાચહને ભમતા, હર્જન શત્રુ પર ખડુ સમતા;
લયદીન ધની આતમ રમતા.....મહાનત. ૫

થયા મુનિ સવાઈ કેશરીયા, સમતાલાદે સંયમ વરિયા;
જે ખહુલા જન તારી તરિયા.....મહાનત. ૬

એવા મુનિ વ હો ખડુ લાવે, મુનિશુણ રમતાં સંયમ આવે;
ઝુદ્ધિસાગરસૂર શુણ ગાવે.....મહાનત. ૭

(४९)

(५०)

શ્રી વિજયલક્ષ્મી સૂર્યિની ગુંહલી.

ભવી તમે વંદોરે લગવતી. એ રાગ.

અવિજન ભાવેરે વિજ્યલક્ષ્મી સૂર્યિનો,
ભાવે વંદીરે, કર્મ અનંત નિકંદો.

ઉપદેશપ્રાસાદિક રચી અન્થો, નામ અમર નિજ કીધું;
વીશસ્થાનકની પૂજા રચીને, અનુભવ અમૃત પીધું. ભવિ. ૧

લેનાગમજાતા શુષ્ણ રહિયા, એગણીશ શતકે થઈયા;
શુર્જર હેશમાં ગિરુવા ગંભીર, શુષ્ણ ગર્વતા રહિયા. ભવિ. ૨

દીપચંદ કવિ લેના રાઠી, અન શાસન સોઢાયા;
ખુદ્ધિસાગર સૂર્યિપદ વંદો, પ્રેમે પ્રથુમો પાયા. ભવિ. ૩

(૫૧)

શ્રી અભયદેવસૂર્યિની ગુંહલી.

ભવિ તમે વંદોરે. એ રાગ.

અવિજન ભાવેરે, અભયદેવસૂરિ વંદો.

આગમ જાનીરે, સુનિ વાચકસૂરિ ઈંદો,
નવ અંગોની વૃત્તિ કરીને, જગ આગમ પ્રસરાયાં;
લેની ટીકાઓ વાંચીને, સુનિગણ મન હરખાયાં. ભવિ. ૧

શૈતયલાસી શ્રીદ્રાણુાચાર્ય, શોધી ટીકાઓ ભાવે;
મહાબીર પાટે મોટા ભકોનો, લક્ષ્મિતરાગના દાવે. ભવિ. ૨

વર્તમાનમાં અભયદેવસૂરિ, ટીકાની શુલ રહાય;
ખુદ્ધિસાગર સકલ સંધને, ઉપકારી સૂર્યિરાય. ભવિ. ૩

(४२)

(५२)

શ્રીમહ આનંદધનજીની શુંહલી.

અલીસાહેલી જગત તીરથ જોવા ઉલ્લી રહેને એ દાબ.

- આતમજ્ઞાની આનંદધન જોગી, વંદો નરનારી,
પ્રખ્યાત થયા, સહુ દર્શનમાં, ખાપી અતિથયધારી.
જેના મન નહીં ઝડીઝું ત્હારું, સાચું તે માન્યું મન સારું,
આતમ સંયમમાં મન ધાર્યું..... આતમ. ૧
નહીં કંઠે જગતમાં વસિયા; શુદ્ધાતમના થધ્યા રસિયા,
જે ધ્યાન સમાધિ ઉલ્લભસિયા..... આતમ. ૨
સિદ્ધિયો પ્રગટી રહી સામી, પણ સિદ્ધિના નહીં જે કામી;
નિશદિન રહેતા આતમરામી..... આતમ. ૩
પહોડો શુદ્ધમાં બહુ રહીઆ, શુદ્ધાતમ દર્શન જે લહીયા;
અદ્યાત્મમાર્ગનિષે વહિયા..... આતમ. ૪
વાચકળે સ્તવના કીધી, પાચ્યા સંગત સમતા સિદ્ધિ;
ચીલીશી પહ આતમકંડિ..... આતમ. ૫
અવધૂત અલઘ મુનિ અવતારી, ઇકીરાઈ જેની સુખકયારી;
ઝુદ્ધિસાગર ગુરુ જ્યકારી..... આતમ. ૬

(૫૩)

શ્રીજિનદત્ત સુરિની શુંહલી.

અલી સાહેલી એ રાગ.

- જિનહતસૂરિ, જૈનધર્મ વૃદ્ધિ, કરનારા થધ ગયા,
શાસન શોભાકારક જૈને, નવા કરી શોભા લદ્યા;
જિનહતસૂરિ જગમાં દાઢા, કહેવાયા શુષુગશુધિ સાઢા,
ધન્યધન્ય પિતાળ ને માતા..... જિનહત. ૧

(४३)

- જગમાં જિનશાસન અજવાણું, ધર્મિલુવન સંબળું ગાણ્યું,
ધર્મભાં પરમાત્મ પદ ભાજ્યું..... જિનદા. ૨
- અરૂપરચણે ખાહુ પંકાયા, હાદી ભારત સધણે છાયા;
ઝુદ્ધિસાગરશુણી શુણુ ગાયા..... જિનદા. ૩

(૪૪)

મંગલીક શુંહલી.

ચાલો સહિયરો મંગલ ગાઠએ, એ રાજ

- વીર પ્રભુલુ મંગલકારી, ઈચ્છિતના હેનારા રે;
શુંહલી તેહની કરીએ ભાવે, હુઃઅ રોગ હરનારા રે. મહાવીર. ૧
- વીરમણુના શિષ્ય સનૂરા, લઘિધના લંડાર રે;
જેના નામે મંગલ પ્રગટે, જિદ્વા શુરૂ શુણુકારદે. મહાવીર. ૨
- સુખમીસ્વામી સુખકારી, જેની સંતતિ આને રે;
નિધમાન શાસન શોભાચે, ભારતમાંહિ છાને રે. મહાવીર. ૩
- ભર્ણાહુ વજસ્વામી, સુનિવર ઉમાસ્વાતિ રે;
શ્વામાચાર્ય હરિભરણુ, નિર્મણ જેની છાતી રે. મહાવીર. ૪
- અરિહંત ને સિદ્ધાચાર્ય, વાયક સુનિ ઉપકારી રે;
ઝુદ્ધિસાગર મંગલ કરને, ગાવે નરને નારી રે. મહાવીર. ૫

(૪૫)

બીમહ મણ્િવિજયલુની શુંહલી

ચાલો સહિયરો મંગલ ગાઠએ, એ રાજ

- મણ્િવિજયલુ તપસી ડાઢા, શાંત હાંત અનગારીરે;
સ્વેચ્છા શિરદાર પ્રભાવક, આનન્દમય અવતારી રે. મણ્િ. ૧

(४४)

દેહ છતાં પણ નેહ વિદેહી, મણિચંદ્રજી જેવા હે;
 ખુટેરાવળ જેની યાએ, સેવા સારે હેવા હે. મણિ. ૨
 પરિવાર જેનો ભારતમાં, કૈનધર્મ હીપાવે હે;
 વહેં ગાવો ભાવો ધ્યાવે, કર્મ કથો હુર જાવે હે. મણિ. ૩
 સરલસ્વલાવી નિષ્પૃહ પ્રગટયા, તપાગચ્છમાં ઘોરી હે;
 ખુદ્દિસાગર શુરૂ કરમાં છે, જિનશાસનની ડોરી હે. મણિ. ૪

(૪૬)

શ્રી વીરહેશના ગુંડલી.

શાનદર્શનને ચારિત્રમાં, સર્વચોગ સમાવેશ થાય. સુણો. વીરહેશના:
 જ્ઞાનચોગને અક્ષિત ઉપાસના, એક ફળવાળાં સમજાય. સુણો. ૧
 ભૂત વર્તમાન ભાવિ ધર્મ સહુ, એક આતમના પચ્ચાય. સુણો.
 જિનદર્શન સાગરમાં સહુ, અન્યદર્શન સચિતા સમાય. સુણો. ૨
 કૈનધર્મ સમેં નહીં ધર્મ છે, સર્વ વેદાન્તતું વેદાન્ત. સુણો.
 અનેકાન્તનથે જે જાણુતો, તેહ થાતો હુદ્દયમાં શાન્ત. સુણો. ૩
 કૈનધર્મમાં વેહેં સહુ રહ્યા, સર્વ રૂ કથ્યા સિદ્ધાન્ત. સુણો.
 કૈનધર્મ પરમ સત્ય આતમા, જાણુ આવે કર્મનો અંત. સુણો. ૪
 મનથી પર પરમેક્ષર પ્રખુ, શુદ્ધાત્મ સાચ્ચા લંઘ. સુણો.
 ખુદ્દિસાગર આત્મસ્વલાવમાં, જાતાં સર્વ સમાઈ કર્તાંય. સુણો. ૫

(૪૭)

મહાવીર પ્રભુનો ઉપહેશ.

બાધુલીલદ મુનિવરમાંહિ શિરદાર જો, એ રાગ.

મહાવીર પ્રભુનો સુષુંજે જન ઉપહેશ જો,
 જેથી નારો જન્મ મરણુના કલેશ જો;
 જન માયો વણ સંકિત ડોઇની નહીં થતી જો. ૧

(४६)

- આતમજ્ઞાન સમ કોઈ ન મોહું જ્ઞાન ને,
આતમજ્ઞાનના દાન સસું નહીં દાન ને;
આતમજ્ઞાનથી જગમાં શાંતિ સાંપને હૈ. ૨
- આતમજ્ઞાન છે નિત્ય લુલન સુખકાર ને,
આજ્ઞાનાસક્રિત ભૂત્યુ હઃપકારને;
લય તે ભૂત્યુ નિર્બિદ્ધ લુલન જાણું ને. ૩
- વીર્યંહીન નહિ આતમતત્ત્વને પામે ને,
આત્માર્પણ વણુ ઠરે ન કોઈ ઠામે ને;
અકિતજ્ઞાનને યોગથકી શિવ સાંપને ને. ૪
- એક એક થોડે આતમ અનન્ત ને,
અનન્ત સુખઠાં પાર્યા થૈ અગવાંત ને;
દેશકાલ મળોડા છે નહીં ધર્મને ને. ૫
- આતમ ધર્મવિષે સહું ધર્મ સમાચ ને,
આતમમાંહિ અનંતરસ પ્રગટાય ને;
આતમરસિયાને વિષયારસ નહીં ગમે ને. ૬
- આતમ સાથે મન રમતું છે સ્વર્ગ ને,
મોહની સાથે મન રમતું છે નર્ક ને;
નિર્દેખી મન જલપંકજવતું જાણું ને. ૭
- સુજમાં મન રાખીને નરને નાર ને,
કર્મ કરતાં વર્તે સ્વાધિકાર ને;
પ્રાંતે પામે સુજપને શુણુ ગણુ વરી ને. ૮
- પરમાર્થ જેની વધરાતી શક્તિ ને,
તે છે ગહાડો જગમાં સાચો લક્ષ્ય ને;
લય જેદને કલેશ વિના કર્મો કરો ને. ૯
- અફનેમાં પણુ કોટિ સુજને જાણુ ને,
કેટિમાંથી સેંકડો મનમાં આણુ ને;
આણીને પણુ પડે ન પાછા વિરલા ને. ૧૦

(४६)

આતમ સત્તાએ પરમાત્મ હેવ ને,
આત્મમાં મન રાખી કરને સેવ ને;
સહુને શક્તિ સરળી સિંહ થવાતથી ને. ૧૧

કષાયવાસી મનદું છે સંસાર ને,
કષાયનાશથી મન મુક્તિ અવધાર ને;
સાક્ષીભાવે હેઠે જાણું સુનિવશ ને. ૧૨

સુજ પર શ્રદ્ધાધારી ધરને ધર્મ ને,
તેથી નરનારી અટ પામો શર્મ ને;
યુદ્ધિસ્થાર મહાવીર પ્રભુ વચનો અરાં ને. ૧૩

(૪૮)

મહાવીર અલુનો ઉપહેશઃ

શ્રીસ્થુલલદ સુનિવરમાંહુ શિરદાર ને. એ રાગ.

મહાવીર ભાએ સુણો જગતના લોક ને,
જડમાં સુખડાં માની કરો ન શોક ને;
પાપપુણ્ય અતુસારે સુખ હુઃઅ સંપન્ન ને. ૧

આપ કરે ને લોગને આતમ આપ ને,
શુલાશુલની સંસ્કારે છે છાપ ને;
કરશો સ્વયં વિચારો તેવા થયો તમે ને. ૨

આ લવ કીધું પરલવ સાથે આવે ને,
કાલ અનાહિ કર્મ સંખધ સ્વભાવે ને;
આત્મશાન અગટથાથી કર્મો સહુ ટળો ને. ૩

જડની વાંચા વણું નહીં લાગે કર્મ ને,
આત્મ જાનથી આત્મવિષે છે શર્મ ને;
અનાત્મ સુખનો સાગર આત્મ ધારને ને. ૪

(४७)

- विश्वेन्नलितुं कारण आतम ज्ञान ने,
हनियानी पडतीतुं कारण मान ने;
राग द्रेषना क्षयथी सुक्षित संपदे ने. ५
- सत्केमो करने जगमां नर नारने,
पकवज्ञान प्रगटे तेथी निधोर ने;
निवृधभीने निवृति सुख नहीं मणे ने. ६
- निक्षय जेनो कर्यो ठगे संसार ने,
तेने लुऱ्यानो नहीं जग अधिकार ने;
म्हारी श्रद्धा राखी कमो शुभ करो ने. ७
- मुजपद लेवा लुचे जे नर नार ने,
मुजने मन सोंपी वर्ते संसार ने;
तेवा लक्तोनो, ऐली निक्षय धरो ने. ८
- मुजलक्तोना लक्तोनो रभवण ने,
जेओतुं मारापर बहुलुं ठाकाल ने;
तेवा लक्तो भुज शुष्णुने ०हेला वरे ने. ९
- सहु ल्येना मननो हेखणु हार ने,
जगमां छुपुं कंध नहीं तवलार ने;
मुज शिक्षा अनुसारे वर्ते शिव लडो ने. १०
- मारा लक्तो संकटमां घूण याके ने,
संकट हुःऐमांडि लेश न थाके ने;
उत्सव सरभां हुःअडां वेठी भडने वरे ने. ११
- भारा जेनो अने नहीं नामहीं ने,
सुधी रडेता सही कर्मनां इद्द ने;
मुज लक्तोना दासोना दासो अने ने. १२
- वीर ग्रहुनो सुष्णी ऐवा उपदेश ने,
राग द्रेषाडिक टाणो सहु क्लेश ने;
भुद्धिसागर शिवपुर सुखमां भळालशो ने. १३

(४८)

(५९)

सत्यप्रेम.

ऐनी रविसागर शुद्ध वंशीये.

जानी भक्त शुद्ध कडे प्रेमतुं, सत्यदृष्टि सुखो नरनार,
देशाकाल विषय खंधन नहीं, नहीं रवार्थने। छांटा लगार,
सत्य प्रेमतुं लक्षण सांख्यो।

१

देह इपनी लोगेच्छा नहीं, नाम डीर्तिनी वांछा न देश;
स्थूल सूक्ष्म प्रकृति साम्यमां, रागविषमताए क्लेश। सत्यप्रेम.

२

मन वाणीने काय चोगमां, नरनारीने साम्य संबन्ध;
शुद्ध प्रेम नहीं त्यां जाण्याये, माने प्रेम त्यां भूढने अनंग। सत्य.

३

परस्पर घडाचेल कायहा, वधुवरना विचाराचार;
तोह नष्ट थतां विषुवो अहो, ये तो क्षणिकप्रेम प्रकार। सत्य.

४

युवावस्थामां नरनारीने, कामासक्तितुं खडु ज्ञेर;
ओह कामनो उलारो जाणुवो, जलपरयोटा सम तोर। सत्य.

५

जड धन्दियेना शुलाभमां, सत्यप्रेम नहीं प्रगटाय;
मननी चेली पारे प्रेम ने, आत्मप्रेम ते सत्य गण्याय। सत्य.

६

सत्यप्रेममां प्रतिभद्रो नहीं, दीधो दीधो ये प्रेम न होय;
कधी आंध्यो ये प्रेम न जाणुवो, मन अनुसारे ने ज्ञेय। सत्य.

७

साठे साठानी ज्यां वांछना, मनभोजतुं साधन मात्र;
ज्यां सहेजे न कर्त्तव्यो थतां, त्यां प्रेमतुं को नहीं पात्र। सत्य.

८

आद्यधर्म लोह ओह क्लेशथी, हुःझी वर्ते नर ने नार;
शुद्ध आत्मस्वदृष्टि न ओणाये, सत्य प्रेम न त्यां निधीर। सत्य.

९

ज्यां आतम आतम ओणाये, सहेजे आतम आतम रुद्धाय;
उच्च नीचेना लोह न स्वधनमां, सहेजे थाती परस्पर रुद्धाय। सत्य. १०

(४६)

જડપુજકમાં નહીં પ્રેમ છે, પ્રેમની થૈતન્યપુજક થાય;
 જડકંદુ લીખારીઓની આપડા, પ્રેમનું સત્યદેશન પાય. સત્ય. ૧૧
 જડરાજયતણા ચક્રવર્તીઓ, સત્ય પ્રેમ નિના હુઃખાં પાય;
 આત્મરાજયના ભોગી જાનીઓ, સત્યપ્રેમી અની સુખી થાય. સત્ય. ૧૨
 પરમાર્થ કર્યોમાં પ્રેમ છે, દેવશુદ્ધની લક્ષિતમાં પ્રેમ;
 આત્મવત્ત સહુ એવો જાળીને, પ્રેમ કરવામાં છે રહેમ. સત્ય. ૧૩
 પિંડ અદ્ધાંડ એકચ અતુલાયે, આત્મવર્તનમાં છે પ્રેમ;
 સત્ય વર્તનમાં મોહનાશથી, પ્રગટે છે પ્રેમનો નેમ. સત્ય. ૧૪
 સત્ય પ્રેમને આત્મ જાનીઓ, પામે આત્મ શુદ્ધિથી બેશ;
 મુદ્દિસાગર સહશુર પ્રેમીઓ, પામે નિત્યાનંદ હુમેશ. સત્ય. ૧૫

(૬૦)

ધરમાં સ્વર્ગા.

આવો આવો જયોતાના કંત. એ રાગ.

કહે સહશુર ઉત્તમ શીખ, હિંદુ અવધારો રે;	
નિજ ધર કુદુંગનો પ્રેમ, નિશ્ચય ધારો રે.	કહે. ૧
પતિ પત્નીનું શુલ્ક એકચ, થાય ન ગર્વ રે;	
સ્વાશ્રય સંપને ઉદ્ઘોગ, ધર તે સ્વર્ગ રે.	કહે. ૨
માત પિતાને વૃદ્ધતું માન, વિનયથી સેવા રે;	
જેના ધરમાં વિવેક ને પ્રેમ, વસે તિહાં હેવા રે.	કહે. ૩
નહાનો મોટો વૃદ્ધ ને ખાળ, હળીમળી ચાલે રે,	
કહે સહુ જન નિજનિજ કાર્ય, સહાયને આલે રે.	કહે. ૪
એવા ધરમાં લક્ષમીનો વાસ, શક્તિનો વાસ રે;	
અરૂપી જાય પરસ્પર ભૂત, નહીં ઉદાસ રે.	કહે. ૫

(५०)

धर कुटुंबना प्रतिपालनी, शीघ्र माने रे;	
नहीं व्यसन अने व्यक्तिचार, ते सुख भाष्ये रे.	कडे. ६
हानिकारक रीत रीवाज, ज्यां नहीं एके रे,	
सेवा धरनी यक्ती थाय, वर्ते टैके रे.	कडे. ७
ठहि धरमां नहीं कंकास, संतोष साचा रे;	
शिक्षाखु नीति ने शुभ रीति, स्नेह न काचा रे,	कडे. ८
धरमां की वर्गतुं मान, आण संलाभ रे;	
आय अनुसारे होय अर्थ, सुखी नर नार रे.	कडे. ९
कुटकाट न धरमां थाय, प्रभाणिक सर्वे रे;	
सत्ता लक्ष्मीथी जन कोइ, रहे नहीं गर्वे रे.	कडे. १०
महावीर प्रजुनी लक्षि, धरमां सदाय रे;	
थाय साधु संतनी सेव, मन निमोय रे.	कडे. ११
हेश कुटुंब राज्य समाज, सर्व सुधारा रे;	
जाणु धरमां सर्वे येश, शुद्ध आचारा रे.	कडे. १२
नहीं चारितुं धर नाम, वयनो भीडां रे;	
तेवां धर छे स्वर्ग समान, विरला हीडां रे.	कडे. १३
अतिथिने आहरमान, शुद्धने मान रे;	
नहीं स्वार्थनी ताण्याताणु, धर छे विभान रे.	कडे. १४
शुद्धप्रेम भरेलां लोइ, रहे त्यां शान्ति रे;	
भुद्धिसागर लक्ष्मी हेड, आनंद कान्ति रे.	कडे. १५

(११)

श्री महावीर प्रजुना संक्षेपमां पांच वधावा.

पहेला वधावो—श्रावण वरसे रे सुजनी. ए दाग.

महावीर प्रजुनो रे वधावो, पहेला संघ लक्षण भणी गावो;
वीजे भवेवे असिंहत, कर्म निकाल्युं तम शुश्रवंत । ३०.१

(५१)

हरोमा रवर्गीयी दे अविद्या, निश्चलाना उद्दरे अवतरित्याः;
भारत हेशो दे सोडे, क्षनिकुङ्ड सहुनां मंन मोडे. ८० २

अजिक स्वप्नो दे हेप्पे, निश्चला माता हर्ष विशेषे;
स्वप्नां पतिने दे सुष्णावे, पुत्र हेशी एम पति समलवे. ८० ३

नेशी स्वप्नोनां इल भापे, तीर्थंकर वा चक्री थापे;
निश्चला आनन्दे उभरायी, भुद्धिसागर हर्ष लरायी. ८० ४

(५२)

बीजें वधावे। भक्तावीर जन्मः

आवशु वरसे दे सुजनी. ए राग.

भारत हेशो दे स्वामी, भक्तावीर जन्मया शुणु विश्रामी;
प्रथु लुवनना दे हेवा, अजिसक धन्दो सुर करे सेवा. भारत. १

अनुपम लीलाए गात्रे, वैत्र सुहि तेरसनी रात्रे;
सुरपति उत्सव दे करता, गेहूपर जिनवरने धरता. भारत. २

स्नान करावे दे प्रेमे, भक्तिए निज कृप्यने नेमे;
पग अंगुठे दे हण्डावी, कंपावी मेहू समलावी. भारत. ३

धन्द्र संशयने भाव्यो, अनांत शक्ति भडिमा जग्यो;
माता पासे दे लावे, प्रभु अभावी रवर्गे जावे. भारत. ४

उत्सव भडोत्सव दे थावे, वर्धमान प्रभु नामने कावे;
अनुकम भोटा दे थावे, योवनवय यशोदा परशुवे. भारत. ५

बोांगो लोगवतां असेागी, जल पंकजवत् निर्मल योगी;
भुद्धिसागर दे शीक्षा, लेनानी मनमां थक्क धक्का. भारत. ६

(५२)

(५३)

दीक्षा कल्याणुक त्रिलो वधावे।

मातृषु गुणी लाभ युहुयस गजरे। ए राग।

- थथा महावीर हेव वेराणी, विरति परिष्णामे त्याणी;
शुद्धभावना धटमां जाणी, थथा. १
- मागशर वह हथभीचे दीक्षा, दीधी मोहमायाने शिक्षा;
करपात्रे प्रजु ले लीक्षा. थथा. २
- निज आतममां लयलीन, आद्य आवमां मानी न दीन;
शुद्ध चिंतवता दृप जिन. थथा. ३
- परिष्ठ क सहिया हुःभद्रायी. पथ प्रखल रहा आक्षाहः
धर्म शुक्लमां लय लानी. थथा. ४
- शुभाशुभी रहु नहीं चिच, सत्य समता योगे पवित्र;
युद्धसागर वीरचरित्र. थथा. ५

(५४)

चाया, केवल कल्याणुक वधावे।

बहित तमे धंहा ऐ सूरीयर गच्छराया। ए राग।

- वैशाख सुहि हथभी महावीरलुन, केवल सानने पास्या,
शुक्ल ध्याने धातिकर्मनो, नाश करी हुःभू वाग्या;
बहिजन धडोहे वीरजिनेथर हेवा, १
जग धरमेथर दे, सुर नरपशु करे सेवा.
समवसरणु देवे रथियुं शुल, त्यां महावीर विराजे;
जैनधर्मनी देशना हेवे, मेधपेहे धनि गाने. बहि. २
- चानीश अतिशये छाने अहंन्, वाणी शुणु पांनीशो;
होष अठार रहित वीतराणी, सत्यतत्त्व उपहेशो. बहि. ३

(५३)

संघ चतुर्विंश तीर्थने स्थाप्य, भारत हेश उद्घर्तियो;
 ज्ञानीशमा तीर्थकर छेल्ला, अनांत गुणुनो दरियो. लिं. ४
 अकाहश गण्डधर निष्पाटे, जैतम आहि थाप्या;
 अुद्धिसागर महावीर प्रभुल, प्रथय भवनमां व्याप्या. लिं. ५

(५४)

पांचमो, निर्वाणु कृद्याणुक वधावो.

ज्ञानि तमे वंडा रे भगवती सूत्रनी वाणी, ए २४।

आसो अभावास्या राने, प्रभुल मुक्तित सधाया,
 हीपाणीनु पर्यं त्यारथी, सुरपति करे नर राया;
 प्रभु वीर हेवा रे, हिंदूथी हो नहीं न्यारा,
 अंतमरामी रे, निक्षय छो मन ख्यारा. १

वीर वीर अिंतवतां जैतम, कैवल शानने पाया.

वीर प्रभुनो संबत प्रगटयो, उत्सव मेहेत्सव थाया. प्रभु
 ज्ञेनधर्म जगमां हैलावी, महावीर मुक्तित सधाव्या;

धन्य धन्य वीर प्रभुनु लुवन, लक्तोना मन भाऊया. प्रभु
 अति संक्षेपे पांच वधावा, महावीर प्रभुना गाया;

लुद्धिसागर महावीर गातां, जन्म संक्ल समजाया. प्रभु ४

(५५)

हितशिक्षानी युहली.

ज्ञनी आर्द्धि भारी. ए २५।

ज्ञने सुषुले रे ग्रेम, शुद्धनी हेत शिखामणु नेमे;
 सभी धरमां रे रहीओ, कैने कडवां बेषु न कहीओ. ज्ञने. १
 धरनां कामा रे करीओ, अचिक्षांत अंतरमां रमरीओ
 कल्पामा कंकासा न करीओ, सागरवत् गंभीर थई करीओ. ज्ञने. २

(५४)

કરીએ શુરૂજનતું માન, સત્પાતે હથીએ નિત્યદાન;	એનો. ૩
ખેંચવિચારેને ત્યલુએ, પતિવતાના શુષુને સળુએ.	એનો. ૪
દેવશુરને રે થળુએ, મનવાણીથી મહાજનની રીતિ.	એનો. ૫
ધર્મીએ ધર્મની નીતિ, આચદીએ મહાજનની રીતિ.	એનો. ૬
ત્યલુએ કુલટાની થારી, તણુએ હૈશનની દ્વિશિયારી;	એનો. ૭
સંગત સારાની કરવી, ફર્જનની સંગત પરિહરવી.	એનો. ૮
મનમાં લધુતા રે રાખો, આણુ પડે પણ સાચું ભાખો;	એનો. ૯
કૃપે રંગેદ ન મહેશો, વ્યલિયારથી અંતે શાશો.	એનો. ૧૦
હુઃખ પડતારે સહીએ, અંતે માન સકલતું લહીએ;	એનો. ૧૧
સહુના સારામાં લાગ, ધરીએ મનમાંહિ શુષુરાગ.	એનો. ૧૨
શુર્સેા પ્રકટયોરે સમાચો, હુષ્ટ વિચારો દ્વર હઠાચો;	એનો. ૧૩
નદીએ ભધુરી રે વાણી, વીરપ્રભુને મનમાં આણી.	એનો. ૧૪
કાચરકુચરરે ન ખાલું, કારણવણું પરદેર ન જાલું;	
કરીએ શુરૂનીરે લંકિત, સત ધરીએ જેવી મનશકિત.	
કરણી પુણ્યની કોઈ, સંતોની શુલ આશી લીજે;	
ઓપ્લો તેલું રે પાણો, કરો ન નિજ આતમને કાણો.	
દોષી હુઃખીની સહાય, કરીએ સેવા ધર્મ સહાય;	
ખૂગાક કેળવણીએ ભાવે, નિજ વર્તન ખાળકમાં આવે.	
વાણી વહીએ રે ન ખાલી, કહિ ન કરીએ ગાળાગાળી;	
ખર્ચ નકામાંરે ન કરવાં, હુઃખાચી વ્યસનો પરિહરવાં. એનો. ૧૨	
મનની ઉપર રે કાણુ, મૂડો મોટાં થથ જ્યમ આણુ;	
નિર્મલ ગાળાનાં જેવાં, થધીએ આતમ સહશુષુ લેવા.	
સાત્વિક પ્રેરીક બનીએ, કૈનતત્ત્વને પ્રેમે લખીએ;	
બુદ્ધિસાગરરે ધર્મ, ધરીએ કરીએ સારાં કર્મ.	

५५)

(१ : ६ ,

जैनोंने उपहेशा.

अथावत्कु सहेशा कहेशा श्यामने.

परमेश्वर महावीर प्रलु जिनराज्ञ,
जैनोंने उपहेशा साच्चा धर्म ले;
भण प्रगटाये सर्व विषयमां आवधी,
भन वय कायाथी करने शुल कर्म ले.

परमेश्वर. १

विद्या भण सत्तानी शक्तियोवडे,
जगमां जैनो जय करनारा थाय ले;
निर्भव जैनो जगमां लुनी नहीं शाके,
उते ते जगमांही जैन गण्याय ले.

परमेश्वर. २

शांज मजा विषयोना दासो ले भने,
जैनोंने आपे नहीं अणानी सहाय ले;
तेवा जैनो जगमां लुवांता नहीं,
पछां जैनोनी घडती जग थाय ले.

परमेश्वर. ३

आलबगनथी जैनोनी पडती थती,
वृक्ष लगनथी जगमां थाय अधर्म ले;
झट पापीने कन्या नहीं परण्यावली,
परण्यावली अनन्त पापानां कर्म ले.

परमेश्वर. ४

जैन भंत वणु लगनाडि करवां नहीं,
समक्ति लीधा वणु नहीं जैन गण्याय ले;
झुज उपहेश्या व्यवहारे वत्योथडी,
जैनो अगिया निश्चय जगमां थाय ले.

परमेश्वर. ५

प्राणु पडे पणु जैन धर्म छाडे नहीं,
अन्य हेवनी करे नहीं भन आश ले;

(५६)

મારી શર્દા પૂરણુ જેના મન વસી,
તેવા જૈનો ખને ન કયારે હાસ જો. પરમેશ્વર. ૬

સર્વ જાતનું જ્ઞાન કરે ખણુ ભાવથી,
બાળક ભાવિકાને આપે જ્ઞાન જો;
સુજ લક્તોમાં સુજને હેઠે ભાવથી,
તેવા જૈનો પામે જગમાં માન જો. પરમેશ્વર. ૭

આચાર્યો સાધુને સુજ સરખા ગણુ,
હેશકાલ પ્રગતિનો જેહ ઉપાય જો;
આદરનારા જૈનોની ચડતી થતી,
જૈનો માટે લુચે કરતા સહાય જો. પરમેશ્વર. ૮

જૈનો માટે જૈનો લુચે જયકરા,
સર્વ સમર્પણુ કરનારા શુણુ ધાર જો;
સંઘની સેવા જ્ઞાની સેવા જાણુવી,
નાણુ તે સુજ જૈનો છે નિર્ધાર જો. પરમેશ્વર. ૯

સુજ શર્દાનું જૈનો શિવપદ પામતા,
સુજ લક્તો જગમાં સુખિયા નરનાર જો;
શર્દા શર્દ ધરંતા હારે નહીં કહિ,
કલિકાલ શક્તિને આદરનાર જો. પરમેશ્વર. ૧૦

સુજને લજનારાએ સુજ શર્દણુ રહ્યા,
ચંડાલો પણ સુજ પદોને વરનાર જો;
ખુદિસાગર વીર પ્રલુની વાણીએ,
જૈનો તારે ને નિશ્ચય તરનાર જો. પરમેશ્વર. ૧૧

(५७)

(५८)

સહશુરુનો શિષ્યને ઉપહેઠા.

એવાખલુ સહેઠા. એ રણ.

શ્રી સહશુરુલુ શિષ્યને સમજવતા,
ગુણુ કર્મો શિષ્યોનાં ભાગે બેશને.
શુરુની આજા માને તે શિષ્યો અરા,
પ્રેમ શુરુની સેવા કરે હક્મેશ ને.

શ્રી. ૧

શુરુની ધર્છા નાણી તેને અતુસરે,
શુરુના કર્તાંયોમાં લેતા લાગ ને;
તનથન લક્ષ્મી પ્રાણુ સમર્પણુને કરી,
શુરુ પર ધારે દિન દિન અધિકો રણ ને.

શ્રી. ૨

વિનય કરે સત્કારે રાણે નહીં મણા,
શુરુ માટે ધર્છાનો આપે લોગને.
શુરુથી છાતું રાણે નહીં મનમાં જરા,
શુરુ આજાએ સાથે સર્વે ચોગ ને.

શ્રી. ૩

શુરું દિલડું છાયા થઈ પાસે રહે,
માન પૂજા નહીં શુરુથી ધર્છે બિજને;
સહશુરુમાં નિજ નામ રૂપના પ્રેમને,
પૂર્ણ સમાવી થાતો શુરુમાં લીન ને.

શ્રી. ૪

છાકરવાદી સ્વચ્છાદી થઈ નહીં રહે,
ધર્છે નહીં શુરુપ્રેમ કૃપા વણુ અન્ય ને.
શુરુની કડવી શિક્ષાઓ અમૃત સરી,
માની નિત્યે શુરુથી રહે અન્ય ને.

શ્રી. ૫

જ્હાલી શુરુની શ્રદ્ધા લક્ષ્મિ ક્ષણે,
શુરુનાં કાજ કરીને મન હરભાય ને;
હતુમાનની પેડે સેવક થઈ રહે,
શુરુનો મહિમા જ્યાં ત્યાં જગમાં ગાય ને.

શ્રી. ૬

(૫૮)

પાખડીના લરમાંયાથી નહીં ભાગે,
શુરુની આગળ પોલે હિલતું સર્વ જો;
શુરુની ધાની વાતો થાકે ના કહે,
જોદ્વાર પામી કરે ન કચારે ગર્વ જો.

શ્રી. ૭

શુરુ કહે તે સારા માટે માનતો,
અનુદ્ધ કરતાં અદ્ધ બહુ ધરનાર જો;
શુરુને આનંદ આપે વિનયે વર્તતીની,
ધન્ય ધન્ય એવા શિષ્યો નરનાર જો.

શ્રી. ૮

નિષ્કામી થે શુરુકુળમાં વાસો વસે,
શુરૂખીન મનહું તેને છે ધન્ય જો;
એવા શિષ્યોને સિદ્ધિયો સાંપડે,
અમર બને મરળ્યા થઈ હૃતપુષ્ય જો.

શ્રી. ૯

હુઃઅ કરેડો સહીને શુરુ પાસે રહે,
સહૃદ્યુકૃવરને કરે નહીં નારાજ જો;
ઘટની ચેકે હુઃએ સહી ઉત્તમ બને,
રામે આતમ કુલવટ કીર્તિ લાજનો.

શ્રી. ૧૦

શુરુસલાહો લઇને સુહુ કાચો કરે,
શુરુદ્રોહીનો કરે નહીં વિશ્વાસ જો;
શુરુને ગમે નહીં તેમાં તે નહીં પડે,
વીરમલુ પદ પૂજયાની મન આશાનો.

શ્રી. ૧૧

શુરુ કૃપાએ સર્વ શક્તિયો પામીને,
કર્મ ચોળીએ જાની શિષ્યો થાય જો,
શિષ્યપણું કીધા વણુ શુરુ કો નહીં બને,
કુદરતને જગમાં છે જાચ્યા ન્યાય જો.

શ્રી. ૧૨

શિષ્ય થિયું કરણીએ એ નહીં રહેલ છે,
પાત્ર બને પહેલા જગમાં નરનાર જો;
અનુદ્ધિસાગર સંસ્કારી સમજે ખર્દ,
શુશુકરોને પ્રેમથકી ધરનાર જો.

શ્રી. ૧૩

(५८)

(५९)

સદગુરુનો પુત્રોને ઉપહેશ.

આધ્યાત્મ સંદેશો કહેજે શ્વામનો, એ રાગ.

માત પિતાના પુત્રો સારા પાકલો,
કરશો કુદુંબ ધરનો જટ ઉદ્ધાર જો;
માત પિતા ગુરજનને પાચે લાગલો,
મન વાળી કાયા કેળવનો સાર જો, માત. ૧

ખ્રિસ્યાર્થને પાણો શુરુકુળમાં વચી,
પ્રચ્છીસ વા વીશવર્ધની અવધિ ખાસ જો;
દેહવીર્યની રક્ષા વણુ નિર્ભળ અને
શક્તિહીન રોગી અનશો જગહાસ જો. માત. ૨

વિદ્યાકલે બાલકજનને નહિ કરે,
સર્વ જાતના રોગોનું જે ધામનો;
ધાર્મિક ધ્યયવહારિક કેળવણી અંતથી,
સારી પેઠે અહી અને શુણુકામ જો. માત. ૩

રખચુંદી ઉદ્ઘત અનશો નહીં બાયલા,
જન-મભૂતિનો ધરશો સાચો રાગ જો;
વિદ્યા લક્ષ્મી સત્તા મેળવશો સદ્ગ,
કરશો હુર્યુણુ કુટેવેનો ત્યાગ જો. માત. ૪

વિદ્યા ગુરુના વિનયે વિદ્યા શીખનો,
કસરતની કેળવણી લેજે ભન્ય જો;
મનપર કાયુ મૂકી સંયમ સેવશો,
કરશો કરો જગમાં શુલ કર્તવ્ય જો. માત. ૫

હૈશનની હિંશિયારીમાં હૈશશો નહીં,
દેશ ધર્મના તજવા નહીં આચાર જો;
માતપિતાની આરાને ચ્રકો નહીં,
પાતાનો રાણો સારો ધ્યયવહારનો. માત. ૬

(६०)

सत्यने वण्णी रहेने साचा लावथी,
प्राणु पडे पशु करो नहीं व्यजियारने;
वीर ग्रन्थुने द्वितमां राणी सहु करो,
भूरी आसकित त्यज्वी निर्धारने.

मात. ७

हाह पान करो नहीं बनीने छाकटा,
आंस केही वस्तुथी रहेने द्वरने,
जैनधर्मने आणु पडे नहीं मूळो,
लंकत हानीने थाने जगमां शूरने.

मात. ८

विद्यार्थी छवन एये नहीं गाणने,
जाणी थेणी थाने युद्धना हासने;
बेह ऐह छियां लीतिने परिहरी,
धरने देवथुडनो भन विश्वासने.

मात. ९

मातपिताने स्वार्थ करी जे सेवता,
स्वार्थी पुत्रो पशु छवन धरनारने;
मातपिताना भनने जे नहीं हुःण्वे,
मानवपुत्रोना सारा अवतारने.

मात. १०

मातपिताना भनने जे नहीं हुःण्वे,
हुःण पडे पशु कहि न करता त्यागने;
हेवपुत्र ते साचा जगमां जाणुवा,
मातपितापर भक्षु साम धरवो राणने.

मात. ११

हेश केम ने नात जातनी उन्नति,
करता पुत्रो धर्म धरीने एशने;
मातपितानी रहासु एवे नहीं कदा,
करे न स्वार्थी माता पितारी क्षेशने.
आत्मथुण्डा भक्टाचो साचा प्रेमथी,
भरणुवा थै करने सारां कर्मने;
भुजिसागर मातपिता उपकारने,
याह करीने धरने अंगे धर्मने.

मात. १२

मात. १३

(६२)

(७०)

जैन लक्षण.

आदेश सहियरो मंगला गाहन्त्रे. ए. २१८.

जैन जगतमां जाणु तेने, हुण्ठोने के अते दे;	
जैनोमां किनडेव जुवेने, आदे कुलवट रीते दे.	जैन. १
मन वाणी कायाने सभलां, केणवणीथी करतो दे;	
हुण्ठ वासनायोने ताणे, करी जगत संचरतो दे.	जैन. २
हेषा कालने जाणी वर्ते, जैनधर्म इलाने दे;	
विद्या सत्ता लक्ष्मी वृद्धि, करतो नीति दावे दे.	जैन. ३
जैन विचारो ने आचारो, पाणे श्रद्धा प्रेमे दे;	
शिरने साटे धर्म न चूके, हिलमां रहेतो रहेमे दे.	जैन. ४
सर्व कणाओ युक्ति प्रयुक्ति, जाणी नहीं वंचातो दे;	
शुल कर्मोने करवा भाटे, भयथी नहीं अंचातो दे.	जैन. ५
महानीर भलुने पूजे प्रेम, धर्म युद्ध हिल धारे दे,	
जैनोमांडि लोह न धारे, व्यसनो हँर निवारे दे.	जैन. ६
संध सकलनी सेवा सारे, सात क्षेत्रने पाए दे;	
कुण्ठं रक्षा वृद्धि करतो, रहे न खाली रोषे दे.	जैन. ७
हेशोहय सामाजिक हितमां, आपे आतम लोगारे;	
अन्योयोने हँर निवारे, धरतो सर्व चेगारे.	जैन. ८
जैनधर्म नां तरयो जाणु, श्रद्धा पूरणु राखेदे;	
स्वाधिकारे कर्मो करतो, जूडां चेंणु न लाए दे.	जैन. ९
यथाशक्ति लीधां वत पाणे, भिथ्या ठहम निवारेदे;	
जैनोने घूम स्फुर्य करीने, चढतीओ संलागेदे.	जैन. १०
संघ साचये जैनोमांडि, जैनो भाटे अवेदे;	
अलक्ष्यनु लक्षणु नहि करतो, दाढ़ने नहीं भीवेदे.	जैन. ११

(१२)

દેવશુક્રની સહે ન નિનંદા, ધર્મયુક્તાયો ધારેરે;
કહેણી જેવી રહેણી રાખે, નિજ કુળને અજવાયેરે. જૈન. ૧૨

દ્વાનશીયલ તપ લાવને ધારે, આતમતત્ત્વ વિચારેરે;
જૈન શુદ્ધકુળ કામો ઠાકે, સધળે ધર્મ વધારેરે. જૈન. ૧૪

જગમ સ્થાવર યાત્રા કરતો, સંઘ જમાડે લાવેરે;
સ્પર્ધામાંહિ પઢે ન પાણો, સર્વશક્તિ પ્રગટાવેરે. જૈન. ૧૪

મહાવીર મહાવીર જપ જપતો, કરતો નિશદ્ધિન કામોરે,
બુદ્ધિસાગર જૈનો એવા, પાણે જ્ય સુખ ઠાકોરે. જૈન. ૧૫

(૭૧)

પતિબતાના શુષ્ણોની ચુંઠલી.

સનેહી સંત એ ગિરિ સેવો, એ રાગ.

આવિકા શુભ લક્ષણુવંતી, પત્નીવત પાણે શુણુવંતી.

જગમાં સોહે જ્યવંતી, પતિબતા નારીની અલિહારી;

જડ શોભા નર્હી કરનારી પતિ. ૧

શીલનાં કંકણ ધરનારી, પ્રેમહાર હૃદય વરનારી;

સેવા જાંઝર પગમાંહિ ધારી..... પતિ. ૨

પતિબદ્ધિની મોહનમાળા, સંયમ કટિભૂષણ પ્રયારાં;

હ્યા વેઠ વંતી છે રૂપાળાં પતિ. ૩

કૃડા હુસ્ત શોલે હાતાર, કરે હણે ધણુ ઉપકાર;

વાણી મીઠી અમૃતસાર પતિ. ૪

સાડી સમતાતણી અંગ સોહે, હેણી સજજનનાં મન મોહે;

ચિત રાખે ન કયારે દ્રોહે પતિ. ૫

શુણુરાગનો કાંટો નાકે, બડ્ધિગોરવથી નર્હી છાકે;

શુભ કમો કરે નહિ થાકે..... પતિ. ૬

(६३)

- सत्य सम्यक्त्वनी धरी शेणी, पीती अतुलव रसने गोणी;
भोडे मुंजे नहीं भनी लोणी.... पति. ७
- शुद्ध चारित्र चांदलो आवे, वेणी विवेकनी शिर वाणे;
ओक पतिवत चूडलो धारे.... पति. ८
- सत्य श्रवणुनां कुंडल काने, जूँहुं समलु पडे न तोकाने;
सत्य समझे सदा जे साने.... पति. ९
- वीर जपनां तंणोल चावे, न्यायवृत्तिनां लोजन आवे;
समझावे धरने चलावे पति. १०
- इपरंगथडी न सुंजाती, अक्षयर्थी शोले छाती;
धारे दिलमां न कपटनी काती पति. ११
- चेटमां सहु सागर माय, आंधमां शशि सूर्य सुहाय;
तेना चेटे प्रखु जन्माय पति. १२
- महीपेठे क्षमा शुणु धारे, सान अजिन हृदये प्रबाणे;
समता जल चिस पणाये.... पति. १३
- वायु चेटे सदा छे पवित्र, भोटी आडाश चेठे नित्य;
जेह चंद्रनी चेठे शान्त पति. १४
- निष्कामपणे संचरंती, सहु कर्तृ०य कर्म करंती;
सहु विश्वने तारी तरटी पति. १५
- जेनो जैन धर्म छे प्राणु, आत्मदृष्ट वीर लगवान;
जेणीतुं मन लक्त प्रमाणु.... पति. १६
- अवी श्राविका सहगुरु पासे, आवे लक्षितसाव डल्लासे;
करी वंहन आत्म प्रकाशे.... पति. १७
- आत्मपति क्योतिए जेती, राग द्रेषना पंडने धाती,
ज्ञाल यावे अरे शुणु भोटी पति. १८
- अवी माताओ देवीओ सारी, प्रगटो जगमां सुखकारी;
भुद्धिसागर जग हितकारी.... पति. १९

(६४)

(७२)

ગ્રલુ મહાવીરનો ગૃહવાસમાં યશોદાને ઉપહેશ.

શ્રી સ્થૂલિલદ મુનિવરમાં શિરદાર જો. એ રાગ.

પતની શુષ્ણુવંતી હેવી યશોદા નારનો,	
હિતશિક્ષા ચાંબળને ધરી મન આર જો;	૧
જલપંકજવતુ લોગોમાં રહેતું ધટે જો.	
કાયાનાં લગ્નો છે કર્માધીન જો,	
આતમાનાં લગ્નો છે ધર્માધીન જો;	
આત્મિક રસ વણું હેઠ લગ્ન સુખ નહિ હિયે જો. ૨	
આતમ આતમને રહ્યાઓ બહુ માન જો,	
હેઠરૂપમાં મોહ ન સાચું જાન જો;	
આત્મરવરૂપે પતિ પતની દર્શન લલાં જો. ૩	
સાકર મધુતા સાકરથી નહીં લિનનો,	
પતિપતની સાત્ત્વિક એકયે લયલીન જો;	
અદૈાકિક સેવા ભડિત ચેળા લલાં જો. ૪	
આતમ આતમનો થાય પરસપર મેળનો,	
સ્વાર્થવૃત્તિનો રવાનામાં નહીં કેળનો;	
કાયા ધાયા પેડે સાથી સર્વ દા જો. ૫	
જરા ન જૂદું જલથી ચીન સુહાય જો,	
આત્મરંગમાં જડનો મોહ વિલાય જો;	
આત્મિકલાયે વિશ્વ એક્ય અનુભવો સહા જો. ૬	
કર્મયોગિની નારીનો અવતાર જો,	
મહાસતી ઉપકારિણી જયકાર જો;	
આત્મદેષિથી વહેશો ધરનાં સૂત્રને જો.	૭
હેઠ ચિત્તથી ન્યાદો આત્મરામ જો,	
અનુભવી રહેને તેમાં સુખ ધામ જો;	
સર્વ તમારા અધિકારોને આદરો જો. ૮	

(६५)

- જેનધર્મનો કરવો વિશ્વોક્તાર જો,
જેથી વિશ્વોક્તાર બને સુખવાસ જો;
તીર્થ્યાંકર અવતારી પ્રભુ સંગી રહે જો. ૬
- પત્નીના શુષ્ણ કેમો પાણ્યાં સર્વ જો,
કદિન ન કરતાં બાધ્ય વસ્તુનો ગર્વ જો;
ધન્ય તમારા સાભ્યચોગને મહાસતી જો. ૧૦
- મારી પાછળ આવો સુક્રિત પંથ જો,
રાગદ્રોષની છોડી નાણી અંથિ જો;
યુદ્ધિસાગર વીરવચનને ધન્ય છે જો. ૧૧

(૭૩)

શ્રી નાનદિબધ્યાંન બંધુનો દીક્ષા વખતનો વીરપ્રભુને સંઘોધ
સનેહીસંત એ જિરી સેવા, એ રાગ.

- પ્રભુ મહાવીર બંધુ હમારા, મારા આત્મથડી પણ પ્યારા;
ધરી સંયમ રહેણ સુખકારા. પ્રભુ. ૧
- ધરી ધ્યાન આત્મ લયલાવી, શુક્લ આવે ડેવલ પ્રગટાવી;
પ્રભુ લેણે સુક્રિત મનાવી. પ્રભુ. ૨
- પ્રભુ તવવણુ લેશ ન ગમયો, અહિશમાં વિચઢું અમયો;
કોની સાથે આત્મ સુજ રમયો. પ્રભુ. ૩
- ધર રમશાન જેઠુજ લાગે, ચિત્ત જીરીગયા પ્રભુરાગે;
તેથ વળીયાછો વેરાગ્યો. પ્રભુ. ૪
- માઝ હેડું અરચર ચીરાતું, ફઃખ વિચોગતું ન સહાતું;
રહેને લુણું હેવે ન લુણાતું. પ્રભુ. ૫
- તુમ સંગે પ્રભુ જ્ઞાન પામ્યો, સમક્રિત શક્તાંચે જાગ્યો;
રહેને હતો તવ વિશ્રામો. પ્રભુ. ૬

(६६)

- तुम संगत वथु सुहु आङ्; जडमां कोऽध लागे न घाङ्;
आँयुं उद्यमां कर्म नकाङ्. प्रख. ७
- तुम वयनामृत घूण धीङुं, तेथी कार्य अरे मुज सिद्धुं;
हवे झूरपल्लुं केम दीङु. प्रख. ८
- विक्षोद्धारने माटे त्याणी, थया अंतरथी वैराणी;
तमने आतममां लय लाणी. प्रख. ९
- वीर !!! वीर !!! ओ. न्हाला अँधु, जग पालक करुणाचिंधु.
आँयुं काज अरे केम धीङु. प्रख. १०
- नंहिवर्धन तमारो लाई, साचवशो प्रेमे सगाई;
संभारशो याही लाई. प्रख. ११
- थधु केवली अर्ही संचरशो, उपकृत तव खांधुने करशो;
तमने कोऽध विक्ष न नकशो. प्रख. १२
- महावीर प्रखु वर्धमान, हुतो गाईश तव शुणु गान;
महावीर प्रखु लगवान्. प्रख. १३
- छेद्वला तीर्थंकर महावीर, सर्व हेवोतथा पति धीर;
शुणुसागर छो. गंलीर. प्रख. १४
- बनी सर्वज्ञ आवशो घेरे, परमानन्द पदनी ठेहेरे;
पूर्णीनन्द सुभन्ना ठेहेरे. प्रख. १५
- वीरवणीया वननी वाटे, नंहिवर्धन धरनी वाटे;
ज्ञान भणतुं ज्ञानिना हाटे. प्रख. १६
- वीरकाउसऱ्ग धयाने रहंता, नंहिवर्धन याह करंता;
भुद्धिसागर वीर भणंता. प्रख. १७

(६७)

(७४)

पत्नी यशोदानी प्रभु महावीर प्रति विज्ञप्ति.

आधिवल संहेदो कुहेजे श्यामने, ए २३।

धन्य धन्य महावीर प्रभु परमेश्वरा,
विश्वस्थापी महिमा तत्र अपराह्न ले;
आत्मस्वदृपी जैनधर्म शिखन्ये लेया,
शुद्ध प्रेमना उपदेशक ज्यकार ले.

धन्य. १

परमात्म तीर्थं कर जग उद्धारवा,
निश्चय छेद्या यावीशमो अवतार ले;
मारा मनमां शुद्धात्म तु ऐक छे,
जगलुवन अन्तर्यामी आधार ले.

धन्य. २

शुद्धावासमां परमादर्थं प्रभु सहा,
डीयो मारा आत्मनो उद्धार ले;
मनवाणी कायाथी तुज प्रेमी धनी,
भयोलवमांडि पति प्रभु निधोर ले.

धन्य. ३

अनेक छिंसायज्ञो थाता वारता,
उत्तम यारित्री डीधां नर नार ले;
हया तर्तने भारतमां हैलाववा,
उपहेदो दीधा त्तें जगमां सार ले.

धन्य. ४

हीक्षा लेइने आत्म शुद्धु प्रकटाववा,
डेहाईयास तज्ज्यो अंतर अलिमान ले;
हेवक्षणानी थधुने जगमां विचरो,
सुरनर सेवा करे अतिशय भान ले.

धन्य. ५

मारी विज्ञप्ति परमात्म सांखणो,
कुपा करीने तारो सुज्जने नाथ ले;
द्रव्यबावथी पति प्रभु छो भाव्यारा,
हेते तारो अलीने सुज छाथ ले.

धन्य. ६

(૬૮)

પલીને પતિવણું નહીં ધીને આશરો,
પ્રભુ તમારી સેવા અક્ષિત ધ્યાન ને;
વીર વીરમય તુજુ પ્રેમે સહુ જગ ધન્યું,
શુદ્ધ પ્રેમમાં લાસે તું લગવાન્ન ને. ધન્ય. ૭

દેહ પતિતો અનંત ભવમાં થઈ ગયા,
આત્મપતિ શ્રી વીર વિલુ જગ એક ને;
મારા રોમે રોમે તું વ્યાપક ધન્યો,
તુજુને લગવા જપવાની છે ટેક ને. ધન્ય. ૮

હનિયામાંહી તુજુસમ કોઈ પ્રભુ નહીં,
કાટિ માનવ તાચો હઈ ઉપરેશ ને;
સ્વર્ગસમું આ લારતને શુદ્ધથી કર્શું:
મનવાણી કાયાના ટાજ્યા કલેશ ને. ધન્ય. ૯

ભવ સુદીતમાં સમભાવે મનડું થયું,
પ્રેમ પરિણામી તુજુમાં શુદ્ધધામ ને,
તુમવણું પ્રેમ ન કોઈ વાતે ઉપને,
સ્વાર્પણું તુજુને કરી બની સુખ ઠામ ને. ધન્ય. ૧૦

સુજ સ્વરૂપી લારયો તું શુદ્ધાતમા,
તું તું કરતાં થઈ તમારા ઝ્યપ ને;
અદ્ધિસાગર સતી યશોદા વીનતિ,
કરતાં અક્ષિતથી થઈ એક સ્વરૂપ ને. ધન્ય. ૧૧

(६८)

(७५)

अलु महावीरनो चांडकौशिक संपर्ने उपहेशा.

वैदसर्वी वनमां वणवले. एते दाग.

भुज !!! भुज ! चांड कौशिया, वीरभलुल हे ज्ञाध;	
कोधे थगो चांडकौशियो, हवे त्यांगी हे कोध.	भुज. १
कोटि वर्ष तप ने कयुँ, थाय कोधे ते ह्याक;	
सुजने उसे शा कारणु, कोध अगटयो रे रोक.	भुज. २
कोध समुँ विष को नहीं, कोधे कर्मना अनध;	
अवतार उरीना सांपडे, कोधी हेखतो अनध.	भुज. ३
मन वाणी कायामां उरनी, कोधे प्रकटेह जवाल;	
भिनोने शानु करे, कर !!! कौशिया घ्याल.	भुज. ४
पूर्वलवे तुं सुनि होतो, साधु गण्डु चिरहार;	
कोप करी भरी हुर्गति, पाम्यो अहि अवतार.	भुज. ५
उर असर करे नहीं भने, जेने अत्यक्ष हेह;	
कृष्ण आवे तुज उपरे, घर समताने रनेह.	भुज. ६
कृष्ण शरीर कर्म थयुँ, तुं तो हेहथी लिज;	
हेहाध्यासने त्यागीने, था तुं आतम लीन.	भुज. ७
कर्मवशी सहु ज्वडा, लाख चौराशीमांडि;	
बटके हुःअडा पामता, सुख पामे न कयांडि.	भुज. ८
कर्म वधार न कौशिया, लाख समता लाव;	
समताए कर्म टणे धयुँ, हलु हाथमां हाव.	भुज ९
सुज सम आतम ताळारो, इकत कर्म छे लेह;	
आत्मापयोगी थया थकी, रहे लवना न घेह.	भुज १०
मन वाणी कायाथकी, पाप कर्मने रोध;	
शरीर विषुसे तोय तुं, निज आतम शोध.	भुज ११

(૭૦)

મહાવીર વચને ખુઝીયો, અંડ ડેશિયો નાગ;
વીર શરષ્ટ અંગીકર્યું, છંડ્યો હેઠને રાગ—
વીર વચનથી ખુઝીયો. ૧૨

અષ્ટુસષ્ટ કીધું વીરની, સાણે સમતાએ એશ;
ઉપસગો સહિયા આવિયા, ટાજ્યા મનના કલેશ. વીર. ૧૩
વીર સમક્ષ નિઝાતમા, ભાવી લાવના એશ;
સૃત્યુ પાની થયો હેવતા, સુખ પાન્યો હુમેશ. વીર. ૧૪
હેવલોકથી આવિયો, પ્રભુ વંદવા કાજ;
પ્રભુ ભક્તિ કરી હેવતે, પામ્યો સુખ સાંઘાન્ય. વીર. ૧૫
ધન્ય ધન્ય મહાવીરને, ધન્ય ડેશિયો નાગ;
શુદ્ધિસાગર એધથી, સાચ્યો પ્રકટે છે ત્યાગ. વીર. ૧૬

(૭૧)

પ્રભુ મહાવીરનાં યશોદાહેવી સાથે લગ્ન.

એની દવિસાગર ગુરુ વંદીએ. એ રાગ.

પરણુ જગળુવન વીર જીન, હેવી યશોદા સાથે લગ્ન;
નેડી એની ન જોતાં જગળડે, હેખી વિચ્છ બનણું છે મગન. પરણુ. ૧
એની કાયા સુવર્ણ જેવી શોકલી, પ્રભુપત્નીનાં ચિત્ત છે એક;
શુદ્ધુકર્મ બન્નેનાં સારીખાં, પ્રગટ્યો બન્નેમાં વિવેક. પરણુ. ૨
ત્રણુ જાની મહાવીર જગપતિ, લોગાવલિયાં કર્મના ચોગ;
ગૃહાશ્રમને માંડે વિવેકથી, છૂટે પ્રાર્થના નહીં લેગ. પરણુ. ૩
બન્ને પક્ષમાં ગોરીયો ગાવતી, પ્રભુ મહાવીરનાં કરે ગાન;
સતી યશોદા મનમાં હરખતી; મજ્યા પુષ્ટ ચોગે લગવાન. પરણુ. ૪
કાયલગન ને આતમ લગની, ચોરીમાંહિ મંત્ર ભણ્યાય;
આનુ ડેટિ તેને પ્રભુ જળહળે, ગાય વેદો નેનો મહિમાય. પરણુ. ૫

(७१)

हेवडेलीमो लग्नमां आवीयां, आव्या नवथेहो दिक्पाल;
वरवधुनां लेतां लूळधुंगा, गांगे प्रेमथी मंगलमाल. परछु. ६

हेवताई वाजा' नक्ष गडगडे, वाजे छत्रीश जातनां वाघ;
आव्या नरपति भारत राजवी, प्रगटचा खडु मंगल नाह. परछु. ७

हुस्तगेलाप घन्नेना थया, प्रगटचा आनन्द कद्देलाल;
थयां अनेक जातिनां लेटधुंगा, जेनां जगमां थातां न तोल. परछु. ८

लोडातर अनुत्तर सोडे हंपती, पूर्णु विशुद्ध घन्नेना प्रेम;
थोऱ्य वये लग्न थमां धर्मीनां, जेना भनमां अनंती रहेम. परछु. ९

झान याचक लोडने आपियां, घन्ने पक्षमां जमण्हु थाय;
भणे घन्ने आतम हृष्टथी, घन्ने अन्तरू आतम सुहाय. परछु. १०

ज्ञानहर्षन आरितमय ग्रन्थ, यशोहा गुणु जलके जयेत;
थया आतम तनमय योगथी, थयो विश्वमां सधगे उवोत. परछु. ११

वीरमांडि यशोहा समाइने, यशोहा हिलमां वीरडेव;
परछुयो अवतारी जगधण्ही, जेनी सारे सुरपतिसेव. परछु. १२

ग्रन्थ वीरसमो नहीं को पति, पत्नी यशोहा जेवी न नार;
भुद्धिसागर द्रूयने लावथी, धन्य हंपतीना अवतार. परछु. १३

(७२)

ग्रन्थ महावीरे भाता पिताने आपेक्षा ७५देश.

आवो आवो यशोहाना कंत. ए २१८.

कुछो पिता सिद्धार्थ नरिंह, निश्वला भातारे;
जूही भायानी जंआण, भणे नहीं शातारे. कुछु. १

संसारे सारे उ धर्म, आतम रायारे;
अंचण पुहगलनी भाल, रहे नहीं कायारे. कुछु. २

(७२)

जैन धर्मने साधो नित्य, द्रव्यने लावे दे.	
जेथी नासे अनंतां कर्म, सुकृतता थावे दे.	सुष्णा. ३
तमे सहगुणीने हातार, शीयलवांतां दे;	
अतन पूजक निर्वोल, सत्य वहंतां दे.	सुष्णा. ४
धर्यां आवकनां मत आर, जग उपकारी दे;	
धरो शुद्धातम उपयोग, वैराग्य धारी दे.	सुष्णा. ५
आधुसंतनी कीधी सेव, हीधां हानो दे;	
अरिहंतनां पूजक घेश, अप न कशानो दे	सुष्णा. ६
अरिहंत किनेखर हेव, जपने जपवा दे;	
करवां कामो निष्काम, आवने अहोवा दे.	सुष्णा. ७
तुम आठण संयम लेइ, विश्वेष्टार दे;	
करवाने तीर्थ प्रकाश-छे अवतार दे.	सुष्णा. ८
तमे ज्ञावेछा त्यां सुधी, दीक्षा न लेशुं दे;	
पछी आरिन लेइ धर्म, उपहेश हेशुं दे.	सुष्णा. ९
वस्त्र चेठे हेह छे ओह, साथे न आवे दे;	
ज्ञावे भायामां लरमाई, हःअडां पावे दे.	सुष्णा. १०
आया मनथी आतम लिन, चिनानन्ह धामो दे;	
शुद्ध शुणु पर्यायार, आतमरामो दे.	सुष्णा. ११
रामो आतममांडि दण्ठि, धर्म स्वभावे दे;	
पुष्य पापथी लिन्न छे आत्म, नित्य सुहाने दे.	सुष्णा. १२
महावीर प्रभुनां वेण्य, सुष्णि हरभायां दे;	
सिद्धार्थने निश्वलामात, आवना लाभ्यां दे.	सुष्णा. १३
आतममांडि लैनधर्म, शुणुपर्याये दे;	
निक्षयथी वाणी दण्ठि, उपयोग लावे दे.	सुष्णा. १४
महावीर प्रभु लगवान्, निक्षय जाइया दे;	
शुद्धिसागर नय व्यवहार, योगे प्रमाणया दे.	सुष्णा. १५

(७३)

(७४)

ગ્રલુ મહાવીરનો ગૃહવાસ.

આવો આવો યથોહાના કંત. એ ૧૦૨.

મહાવીર ગૃહસ્થાવાસ, શુણુથી કરેલો રે;	મહાવીર. ૧
ત્રણયજાની આતમસાય, સમતા ઠરેલો રે.	
હ્યા હાન સહનતા શીલ, વૈરાગ્ય પૂરો રે;	મહાવીર. ૨
નેનો નિક્ષય પૂરણું ત્યાગ, તપ શુણું શૂરો રે.	
માત પિતાનો વિનય અપાર, હર્ષ અપાર રે;	મહાવીર. ૩
બાઇ સાચે જાનની ગોક્ષી, શુલ આચાર રે.	
હુઃખી યાચકળનને હાન, નિત્ય અપાતું રે;	મહાવીર. ૪
નેની શુલ વાતોમાં સ્વર્ગ, ઇંડું સુહાતું રે.	
કુદુંઘમાં સાંપને સુખ, મૈત્રી ભાવ રે;	મહાવીર. ૫
હાન શીયલ તપને ભાવ, સમતા દ્વાર રે.	
અન્યું કુદુંઘ સ્વર્ગ સમાન, હુઃખ ન કલેશ રે;	મહાવીર. ૬
વિદ્ધા સત્તાને ધનમાન, દૃઢ વેપ રે.	
સેવે ભારત રાજ પુત્ર, વીર ગ્રલુને રે;	મહાવીર. ૭
નહીં હુર્યુણું હુષ્ટ કથાય, વીર વિભુને રે.	
ઉત્તમ વૈરાગ્યને પ્રેમ, શક્તિ અનંતી રે;	મહાવીર. ૮
શરીર સૂરજ કરતા આરતી, શુણુંવંતી રે.	
કરે માત પિતાની સેવ, નિષ્કામ યોગી રે;	મહાવીર. ૯
ખાદ્યથી સોગવતા લોગ, પણ નહીં લોગી રે.	
ટાળે હિંસા યર્જા ખૂબ, ભારત થાતા રે;	મહાવીર. ૧૦
ઇન્દ્રાહિક મહાવીર હેવ-ના શુણું ગતા રે.	
પાસે આવેલાં ભંયલોકને, શીખ આપે રે;	મહાવીર. ૧૧
શૈળીના ટાળે રોગ, હુઃખને કાપે રે.	
૧૦	

(७४)

કરે મિત્રાને શુણુધામ, પૂરા ન્યાયી રે;	
નિજ લક્ષોના લગ્નાનું, પૂર્ણ સહાયી રે.	મહાવીર. ૧૨
જૈનધર્મનો પૂર્ણ પ્રકાશ, વિશ્વમાં કરવા રે;	
અશાનને મોહવિકાર, હુઃખદાં હરવા રે.	મહાવીર. ૧૩
પ્રગટયો પૂરણ અવતાર, વીરનો સાચ્ચા રે;	
ગૃહાવાસ બન્યો શુણુકાર, પ્રભુ શુણુ રાચ્ચા રે.	મહાવીર. ૧૪
જલ્દ્યાં કર પેઠે લોગ-માં, વીર ચોળી રે;	
યુદ્ધિસાગર શ્રી મહાવીર, લાવ જીયોળી રે.	મહાવીર. ૧૫

(૭૫)

સાધુ દીક્ષાની ગુંહદી.

અદી સાહેલી. એ રાગ.

એ સુનિવરણ સંજમ દીક્ષા લઈને શિવપુર રહાલ ને,	
સિંહ કેશરીયા થઈને મોહ વિદારી આતમ તાર ને;	
શુરૂઆણુમાં રહી સંચરણો, ચંચળ મનડું વશમાં કર ને,	એ સુનિવરણ.
સમતા રાખી હુઃખદાં હરને.	૧
વિષયો સહુ અરેસમા ગણુને, પ્રકટંતો કામ અરિ હણુને;	
શુરૂ વિનયે આગમ સૈં ભાણુને.	એ સુનિવરણ. ૨
સંજમ છે જગમાં સુખકારી, ધરી પંચમહાત્મત શુણુકારી;	
તણ હુઃખદારી હનિયાદારી.	એ સુનિવરણ. ૩
ઉપસર્ગ પરિષહ સહુ સહેને, આતમ શુણુમાં રમતા રહેને;	
જાણી થઈ સિદ્ધાંતો કહેને.	એ સુનિવરણ. ૪
ઉપકારી યે કૂળ અજવાળી, આતમ શુણુમાં મનડુંવાળી.	
પ્રખ્યાત થને જગ શુણુશાળી.	એ સુનિવરણ. ૫
શુરૂધર્મ દીપાનો વૈરાળી, મહાવીર પ્રભુ પેઠે ત્યાળી;	
અને જીતમ પેઠે સૌલાળી.	એ સુનિવરણ. ૬

(७५)

तमै हेश नगरकूण अज्वाहयुँ, गाणीने संज्ञम मनमां वहालुँ;
तमै अनले अवसागर ताढ़े. ओ मुनिवरल. ७

अनश्चाथननी सेवा करन्ने, अहु लभ्य लुबेने उद्धरन्ने;
अवसागरने बेगे तरन्ने. ओ मुनिवरल. ८

सहु संघ कडे उत्तम थान्ने, पगले पगले मंगल पान्ने;
गंलीर थध धरन्ने शुभ माजो. ओ मुनिवरल. ९

युद्ध आशीवाहो शुभ इलन्ने, हिन हिन सारी बेळा वणन्ने;
सत्संगी भेळा अहु मणन्ने. ओ मुनिवरल. १०

युद्धकृपवासी थध शुभ आशी, युद्धनी लेन्ने थध विश्वासी,
युद्धसागर युद्धपवासी. ओ मुनिवरल. ११

(१०)

महावीर प्रभुनो आश्रय.

मन मांहिरे आवोरे, कहु एक वातली। ओ राग।

मन मांहिर वसियारे, महावीर जयकारी。
वर्धमान जिनेश्वरे, सहा मुज उपकारी। मन. १

सर्वकर्त्तन शोध्यारे, अन्यो जग अहु ठामे;
महावीर मणतारे, ठरी घेठा हामे। मन. २

हृषकेलीओ। हीठारे, नहीं केइ वीर तोले;
मनमस्त अन्येष्टरे, प्रभुअमृत योले। मन. ३

हुनियानी न परवारे, नथी वपुनी ममता;
महावीरना शरण्यारे, हृष्य प्रगटी समता। मन. ४

अहारा मनमां तनमांरे, महावीर जिनलिया;
आहा आनन्द ज्येतोरे, महावीर छो। हरिया। मन. ५

(૭૬)

જગળખન સ્વામીરે, મળયા એક વિશ્વામી; ઇચ્છાં પ્રીચ્છાં ન ધીજું રે, અનંતા છો નામી.	મન. ૬
હાથબાંદ્યો તમારારે, વર્યા મેં નિર્ધારી; તથધર્મ સ્વીકાર્યોરે, નિશ્ચય નિર્ધારી.	મન. ૭
ધાતોધાત રંગાણીરે; મહાવીર તુજપ્રેમે; દેહભાન ન રહેતું રે, રહ્યો એક તુજ નેમે.	મન. ૮
નહીં પુગફલ ધન્યારે, હૃદય તુજ તુ વસિયો; પૂર્ણ શુદ્ધોપચોગીરે, કે નિરધી ઉત્તસિયો.	મન. ૯
હવે રહ્યો ન લેદ્યે, અલેદે રહ્યો પ્રેમે; ભવસુકિતમાં જીમતારે, સહા આતમ ક્ષેમે.	મન. ૧૦
તમવષુ નહીં ધીજું રે, દિશિથી હેખાતું; પરખ્યા પરાતમરે, પ્રભુરૂપ પરખાતું	મન. ૧૧
હવે ડ્વાડું બાલુરે, રહ્યું નહીં કો છાતું; પૂર્ણપ્રેમથી પરખ્યારે, પડયું તુજથી પાતું.	મન. ૧૨
વીરવીર જ્યાતારે, રહ્યો તુજ શુણુ ગાતો; માગવાતું ન રહીયું રે, સગો તુજથી નાતો.	મન. ૧૩
મન દેહના ફેરારે, નથી તુજમાં લગતાં; નથી લયને આસક્તિ રે, મહાવીરથી મળતાં	મન. ૧૪
એક અનેક રૂપેરે; ચિહ્નાનંદ છો જ્યારા, ઘુંજિસાગર ખળિયારે, આનન્દ આધારા.	મન. ૧૫

(४७)

(१)

મલુ મહાવીર ભક્તા લક્ષણ.

શાપાઠી.

મહાવીર જિનેશ્વર ભક્તા, હોય ન સા'સારે આસક્તા; મનળુંને ઘનતો નૈન, હુઃખ પડતાં ધરે ન હૈન્ય.	૧
શાસોચછાસે વીરતું નામ, જપતો કરતો સર્વે કામ; મનમાં વીરપલુ વિશ્વાસ, ધીલુ મનમાં ધરે ન આશ.	૨
પરપ્રક્ષા પરમાત્મ હેવ, વીર પલુની નિત્યે સેવ; જગમાં વીર પલુ મહિમાય, હેણીને લાવે ગુણુગાય.	૩
જુદે વીર પલુને હેત, પ્રાપ્તિ વીરપલુ સંકેત; મન વાણી કાયામાં વીર, ધારી રાપે હુઃખે ધીર.	૪
મરવામાં નહીં લીતિ થાય, જીવનમાં નહીં હર્ષ જાણ્યાય; આતમ લાવે જીવન એશ, ધરતો ટાળે મનના કલેશ.	૫
સર્વ જીવોને આત્મસમાન, હેણી જાણી કરે ન હાન; વીરપલુના ભક્તો જેહ, હેહ છતાં છે તે નિહેહ.	૬
વીર જપતા કરતા કામ, અન્તરૂમાં રહેતા નિષ્કામ; નૈનોની કરતા બહુ હહાર, શિરધન સહુ હેવા તૈથાર.	૭
વીરપલુના ભક્તોતાણી, સેવા સ્વાર્પણુ લાવે ધણી; ઓવી રહેણીના ધરનાર, નૈનો તે જાણો નરનાર.	૮
વીરભક્તો માટે જે મરે, સ્વર્ગ સા'પદ નિશ્ચય વરે; વીરભક્તો પર જેનો રાગ, અન્તરૂમાં તેને છે ત્યાગ.	૯
વીરભક્તો માટે જે ભક્તા, સર્વ કરે પણુ નહીં આસક્તા; કૈનો માટે સધળાં કર્મ, કરતાં વીરજોને ધર્મ.	૧૦
વીર જાપ કે પ્રેમી કરે, તેની સેવાએ થિર ધરે; વીર ભક્તોનાં દર્શન કરે; ગોહત્યાદિક પાપો ટળે.	૧૧

(७८)

नाम इपनो नहीं अद्यास, वीरतष्णु। ते साच्चा दास;
मायामांही नहि सुंजाय, वीर लक्त साच्चा ते थाय. १२
वीर प्रखुना लक्तो वीर, थाता निश्चय राखी धीर;
भुद्धिसागर महावीर लक्त, वीर वीरजपे छे रक्त. १३

(८२)

महावीर प्रखुनुं सगपथ्.

चालो सर्पी सिद्धाचण जधने, ए राग.

सगपथ् महावीरनुं साच्युं, आडी जगत्मां सहु काच्युं. सगपथ्.
प्रखु महावीर धर्षी मारा, मनवाणी काचाची निधोयो. सगपथ्. १
जैनधर्म महागांग प्रगटावी, हुनियाने शाने समजवी. सगपथ्.
हुनियामां वीर प्रखु हीठा, झुने लाज्या हुद्यमां बहु भीठा.
सगपथ्. २

प्रखु महावीर छो मारी आंगो, त्रिशत्वानंहन मारी पांगो.
सगपथ्.
मारा आत्मतथा छो वनमाली, ग्रीत धांधी न छोटा गुणशाली.
सगपथ्. ३

तन धन मन सहु तुजपर वार्युं, त्वाढ़ तेज हुद्यमां झें लाल्युं.
सगपथ्.

सहु वाते सहायक छो हेवा, झुने ठाली तमारी गुण सेवा.
सगपथ्. ४

ठारी ठार करोछो अणुधारी, जाउ पूर्ण तमारी अलिठारी.
सगपथ्.

हुं तो मार्युं न भागणुनी घेड, हुं तो रीञ्जुं न खुद्गलनी घेड.
सगपथ्. ५

(७६)

जेह मागे ते आत्म न कहेवातो, मागे भागचु लेहपछु^१ पातो.
सगपचु.

तव ज्येष्ठामां प्रेमथकी भणीयो, हुं तो हेते ज्येष्ठाते अणहिणियो.
सगपचु. ६

वीर वीर जपातां जग तरतुं, मन चिंतांचुं कारज सहु सरतुं.
सगपचु.

वीर विना नहीं जगमां केहि, जेचु^२ आत्म अनुबन्धी जेह.
सगपचु. ७

मनमां नहीं वीर विना धीनु^३, महावीर जपथी अहु रीचु.
सगपचु.

मुज प्रवृत्ति तव पूज थाशो, मुज चिंतन सेवा सोहाशो.
सगपचु. ८

कहुं चिंतहु ने के जे याहुं, वीर सेवा आत्मथी तेहुं.
सगपचु.

थधुं थाय छे ने के जे थाशो, हितमाटे समजयुं ने समजशो.
सगपचु. ९

वयो वीर प्रभु साचा झाले, जेह लिन्न थता नहीं को काले.
हितमां अणहण ज्येष्ठे झडाले. ज्येष्ठि ज्येष्ठे भणी जग अन्वाणे. १०
नात जात रहें तुज माटे त्याणी, थयो स्वार्पणु करी तडारा राणी.
सगपचु.

थुद्धिसागर घट आत्मरामी, परमेश्वर विकु अन्तर्योमी.
सगपचु. ११

(८०)

(८१)

શ્રી મહાવીર પ્રભુની ભક્તિલભાવના.

સગપણ હરિવરણ સાચું એ રાગ.

- મહયા વીરપ્રભુજી બેરાળી, મારી ચેતના અંતરમાં જાગી;
દૈમર્યાંએ થયો વીરનો રાળી. મહયા. ૧
- કૃષું સર્વજ મહાવીરણ શરણું, શોકલીતિ નહીં આવે મરણું;
દ્વિલભમાં અગરણું અમૃત અરણું. મહયા. ૨
- જૈનધર્મ પ્રકાશયો મન લાંઘો, મોહમાયાનો જેરો નહિ ક્ષાંઘો;
વીર જાપથી આનંદ ઉલ્લદસાયો. મહયા. ૩
- વંચાઉ નહીં મિથ્યા ઠેમે, ધાર્ણી પરમેશ્વર કીધા નેમે;
વીર કૃપાએ રહીશું ક્ષેમે. મહયા. ૪
- હેહ નાત જાતની નહીં પરવા, નહાલા વીરપ્રભુ ક્ષણું ક્ષણું સ્મરવા;
મળી નોકા લવસાગર તરવા. મહયા. ૫
- વીર !!! તુજ રાગે હું વેચાયો, તુજ સહામો ભક્તિથી ગેચાયો;
પાર્યો વીરપ્રભુ સત્ય દરમાયો. મહયા. ૬
- અધમાધમ પાપીને તાયો, જગણ્યોને તહેં ઉદ્ધાયો;
તહેં કાજ ધણ્યા જનનાં સાર્યાં. મહયા. ૭
- તુજ પ્રેમથી સહુ ચોગો પ્રકટે, કામ કોધાદિક હોયો વિઘટે.
મહયો છાડું ન સાહિબ શીર સટે. મહયા. ૮
- નહાલા આતમનીરનો ઉપગોળી, સહુ ચોગથકી થઈયો ચોળી;
ચિહાનનદીમૃત લોજન લોળી. મહયા. ૯
- વીર પ્રેમથકી વીરજન મળતા, વીરલક્ષેત્રો નહીં પાછા પડતા,
સહુ જાતિયાં મંગલ વરતા. મહયા. ૧૦
- પળપળ ચાહી વીર !!! તુજ થાતી, વીરલાવે ભરાણી છે છાતી;
પ્રભુજણ નહીં ધચ્છું ધન ખ્યાતિ. મહયા. ૧૧

(८२)

धन्य त्रिशता माताना जाया, हाडेहाडे लाणी तुज माया;
साकार निराकार समजनया. महया. १२
जैनधर्म प्रचारो जग धीरा; थाचो लक्तोनी ठहारे वीरा;
भुद्धिसागर आतम गंभीरा. महया. १३

(८४)

भातपिताना भरण्यथी शोङ्कातुर खनेल नहिवधन वर्गेरेने
श्री महावीर ग्रलुच्छे आपेक्ष उपहेश.

लवी तमे वाहारे भूरीथर गच्छराया, ए राग।

भति श्रुत अवधिसानी महावीर, निजलाधने समजनये;
नहिवधन शोङ्क त्यणु हो, गयां न पाणां आवे;
अमरे छे आतमरे काया भगटे ने विषुसे. १

भात पितालु स्वर्गने पार्थ्यां, शिवपुर अंते ज्ञेयो;
डेनो शोङ्क करो मुज आधव, सत्य विवेके छे चासे. अमर. २

भनवाणी कायाथी जूहो; आतम नित्य सदाय;
आतम हेह धरेने भूडै, कर्मवडे भवमांहा. अमर. ३

काया साथ रहे नहीं क्यारे, तेनो शोङ्क यो ? करवो;
आतम हेवपछो जध उपज्ञेयो, अंतर निश्चय धरवो. अमर. ४

नहिवधन लाध समजे, ग्राहयकी न सु जाशो;
अनंत लुवो साथे सगपथ, रोये पार न पाशो. अमर. ५

आतमभुद्धि आतममां करीने, हेह भुद्धि अम छ'ओ;
मनथी वर्दु ने अवतरलु, आतममां रठ म'ओ. अमर. ६

मनताणे रहिया ते मनिया, आतम भावे लग्या;
पुहगल वस्तुमां निवींथी, जानीजन भरलुवा. अमर. ७
पुहगलने पुहगलनु' भणलु, पुहगल भमता माया;
आतममां आतमतु' रहेलु, जानी भर्ने पाया. अमर. ८

(४२)

મનને વશ સહુ હુનિયા લૂધી, આત્મવશ સહુ સુધી;
 આત્મ દ્રવિથી સહુને શાંતિ, જડમમતાથી હુઃખી. અમર. ૬
 માટે બાંધુ શોક ત્યજ હો, રહેશો આત્મભાવે;
 દેહને જડભાવે સમજ લયો, આત્મ આત્મ સ્વભાવે. અમર. ૧૦
 વીરપ્રભુ વચને પ્રતિયુદ્ધા, નંહિવર્ધન ભાઈ;
 કુદુંભમાંહી શોક રહ્યો નહીં, સાનતાણી એ વડાઈ. અમર. ૧૧
 વીરપ્રભુ જેના છે ભાઈ, તેને જાણી સગાઈ;
 ખુદ્દિસાગર અત્ય જ્ઞાનથી, મોહ ટળો હુઃપદાઈ. અમર. ૧૨

(૪૩)

મહાવીર પ્રભુને માત પિતાના મરણ પછી એ વર્ષ સુધી
 ઘરમાં રહેવા નંહિવર્ધનનો આગ્રહ-સંવાહ.

આ સ્થૂલિભદ્ર મુનિવર ગણુભાં શિરહાર જો. એ રાગ.

નંહિવર્ધન કહેતા સાંલળ વીર જો,
 સુજાતામ છે તુજ સહાયે ધીરજો;
 માતા પિતા મૃત્યુનું હુઃખ ન સહું જતું જો. ૧

માત પિતાનો કર્મ થયો વિચોગ જો,
 તો પણ સુખિયો તુજ પામી સંયોગ જો;
 હાલ ન દીક્ષા દેવી માનો સુજ કથ્યું જો. ૨

વીર પ્રભુનું જોવે સાંલળ ભાઈ જો,
 હુનિયામાં મનમાની જૂડું સગાઈ જો;
 દેહ વિનાશી સહુનાં અંતે જાણુનયો જો. ૩

આખું ખૂટે દેવા પરલવ સાથ જો,
 કાય ચંચલ રહે ન ડેને હાથ જો;
 માટે દીક્ષા દેવા અતુમતિ આપશો જો. ૪

(८३)

- नंहिवर्धन योले सांभाळ वीर जे,
भाता पिता भरषु नहि रहेती धीर जे;
हाज्रया उपर डाम समुँ लागे कथ्युँ जे. ५
- तुज वषु धरमां सुजथी नहीं रहेवाय जे,
मोटाहुँ योहसुँ भानो लधु राय जे;
एक पलक पषु तुजवषु चेन नहीं पडे जे. ६
- वीर कहे जग ज्ञानो उद्धार जे,
करवा भारो तीर्थकर अवतार जे;
भाटे त्याणी थाहुं सुजने जट घटे जे. ७
- प्रथम करो भारो प्रभुजु उद्धार जे,
तुम संगत वषु सूनां छे धरणार जे;
भारा आथहुक्तीज वर्ष ये घरे रहो जे. ८
- धर रहुँ पषु त्याणी ऐडे रहेशुँ जे,
अचित लोजनपान प्रसंगे लेशुँ जे;
तम हाक्षिषुये धरमां रहुँ छुं जाणुले जे. ९
- आत्मज्ञानथी हुनियानो उद्धार जे,
करवाने तीर्थकरनो अधिकार जे;
जैनधर्म इवाचो करवा अवतर्यो जे. १०
- अहंन् तीर्थकर जगनो उद्धार जे.
करता धीजनो नहि त्यां अधिकार जे;
केवलशानी थधने जगने योधवुँ जे. ११
- नंहिवर्धन सुखी प्रभुनां वयन जे,
अंतर आत्ममांही थया प्रसन्न जे;
धन्य धन्य महावीर प्रभु तुजने सहा जे. १२
- विश्व धाँधु महावीर प्रभुनो संग जे,
पाभी नंहिवर्धन थया अकांग जे;
भुजिसागर वीर प्रभु धाँधु लालानो. १३

(४)

(५)

શ્રી વીરપ્રભુની ગૃહસ્થદશા.

સનેહીસંત એ જિરિ સેવા એ રાગ.

- પ્રભુ મહાવીર જિન ધરણારી, થયા કર્મ પરમ ઉપકારી;
નિર્બેંપપણે અવતારી, મહાવીર હેવની ગતિ ન્યારી. ૧
- રાગ દેવ ન વિષયોમાંહી, પ્રતિભાદ્યપણું નહીં કયાંહી;
રથા આતમમાં લય લાઈ. મહાવીર. ૨
- લોકને જ્ઞાનચોગ શિખાવે, અક્ષિતલાવનો મોધ સુણાવે;
મોહમાયાનાં હુઃખ હડાવે. મહાવીર. ૩
- આપે કુદુંબને સત્યજ્ઞાન, જેથી નાસે મિથ્યા અભિમાન;
આપે અતિથિને સત્યજ્ઞાન. મહાવીર. ૪
- સ્વાધિકારે કર્મ કરંતા, હુઃખી લોકનાં હુઃખ હરંતા;
ભક્ત લોકોમાં અક્ષિત લરંતા. મહાવીર. ૫
- દ્વારા હાનનો હે ઉપહેઠ, ટાળે લોકોના રૂગને દેવ;
ટાળે મિત્રોના સહુ કલેશ. મહાવીર. ૬
- લોકને શિખવે સત્ય ત્યાગ, શિખવે ધર્મિપર રાગ;
શિખવે ઉત્તમ વૈરાગ્ય. મહાવીર. ૭
- ટાળે દોગી જનોના રોગ, ટાળે હુણુંદિ હુઃખ લોગ;
સમજાવે ઉત્તમ ચોગ. મહાવીર. ૮
- શાળ ર'કમાં આતમ સરખા, સમજાવે અનુભાવે પરખયા;
સમજી લોકો બહુ હરખયા. મહાવીર. ૯
- સેવા ધર્મ કરે ને કરાવે, જગને આદર્શ શિખાવે;
શુંત જ્ઞાનના ચોગ લાણુંબે. મહાવીર. ૧૦
- વીર બાણીમાં વેહ સમાય, સર્વ વેહોએ વીરને ગાયા;
ધન્ય વીરપ્રભુ મન કાયા. મહાવીર. ૧૧.

(८५)

- કરે ધર્મયે પ્રવૃત્તિ સુહાવે, સત્ય તરખને પ્રેમે સુષ્પુંવે;
હથા લાવીને જગ સમજાવે. મહાવીર. ૧૨
- હથા સંખમને ઉપકાર, સત્યજ્ઞાન જણુંવે સાર;
ધર્મ વીરઅભુ અત્તાર. મહાવીર. ૧૩
- દ્વારબાં લાસતના મહુ ભાગ્ય, વીર સમજાવે છે ત્યાગ;
અનુદ્ધિનાગર મન્દિર વૈરાગ. મહાવીર. ૧૪

(૮૬)

પ્રભુ વીર પત્ની યશોદા હેઠીની ગૃહસ્થદર્શા.

સનેહી સંત એ ગિરિ સેવો. એ રાગ.

- પ્રભુપત્ની યશોદા કૃપાળી, સતીયોમાં શિરોમણી સારી;
કર્મચોગિની ભહુ પ્રેમવાળી, યશોદા હેઠીની ભડીહારી. ૧
- સાસુ સસરાની આજાકારી, કરે લક્ષિતો વિનય અપારી;
સહુ કુદુર્યની રખવાળી. યશોદા. ૨
- વૃદ્ધ શુરૂજન પાયે પડતી, કામ કરતાં ન થાકે રડતી;
નિશાદિન શુણુ ઓણી ચડતી. યશોદા. ૩
- સત્ય બાલે હથાશુણુ પાણે, હોથ છાઈને જન શુણુ ભાણે;
સત્ય આનંદ લુધન ગાણે. યશોદા. ૪
- પ્રભુ મહાવીર યોધ અહંતી, નિરાસકિતો કર્મ કરતી;
અદ્યાતમ દર્શિ વહંતી. યશોદા. ૫
- નિજ સખીયોને શિક્ષણુ આપે, નિજ સરખા ગુણોએ ઠથાપે;
હુંઘી લુધનાં હુઃઅડાં કાપે. યશોદા. ૬
- પશુ પાણી ને ભાળ સંભાળે, કરી પોખણુ પ્રેમથી પાણે;
સર્વ શુણુથી ભારત અજ્વાળે. યશોદા. ૭
- મહાવીરની આજાએ રહેતી, સમજાવે શુલાશુભ સહેતી;
સારી શિક્ષાએ લોકને કહેતી. યશોદા. ૮

(૮૬)

- આવિકારત શક્તિઓ પાણે, જૈનધર્મમાં વિશ્વને પાણે;
મોહતું જેર અગટથું આણે. યશોધા. ૧
- શુષ્ણ કર્મથી શોખે સારી, ટાપટીપ ન આદ્ય લગારી;
આચે ઇન્દ્રાણીએ શુષ્ણાબારી. યશોધા. ૧૦
- જુદ્ધ ગારવે રહ્વં ન કરતી, આત્મપેઠે લુચો અતુસરતી,
જગ તારે ને ચોતે તરતી. યશોધા. ૧૧
- વીર જાપને જવતી પ્રેમે, રહેતી સર્વ લુચોપર રહેમે;
શોખે પતિત્વતા શુષ્ણ નેમે. યશોધા. ૧૨
- સર્વ ભારતમાં વખાણાઈ, વીર અભિતથી શોખા પાઈ;
દોડે પ્રેમે રહ્યા શુષ્ણ ગાઈ. યશોધા. ૧૩
- સાધુ સંતને આપે હાન, મખુ વીરની સમજે સાન;
હિલમાં વીર છે લગવાન. યશોધા. ૧૪
- ઘાણુ પોષે રહે નહીં રોષે, કામ કોધ્યાહિ દોષો શોષે;
રહી વીરમલુના લરોસે. યશોધા. ૧૫
- અતિથિનો કરે સંતકાર, હાન હેવામાં બહુ હાતાર;
આત્મ જયોતથી શોખે અપાર. યશોધા. ૧૬
- મિરી વાણી વિચારો સારા, રહ્યા હુર્ઝુથુ હુર નહીંરા;
મખુસંગ સંક્રલ અવતારા. યશોધા. ૧૭
- મખુમાં નિજ આત્મને જયોતિ, નામ હેહાધ્યાસને ચોતિ;
જેની અણકે અળહળ જયોતિ. યશોધા. ૧૮
- વીર પત્નીને પ્રેમે જાતાં, લક્ત સોાકનાં પાતિક જાતાં;
ઇચ્છયાં કાસો વેગે થાતાં. યશોધા. ૧૯
- ક્ષવિયાણી અની શુષ્ણશાલી, અંતરાતમ શુષ્ણ રઢિયાલી;
પરમાત્મ દૃષ્ટિવાળી. યશોધા. ૨૦
- યશોધા જેવી જગમાં ન નારી, મહાવીર હૃદયમાં ર્યારી;
શુદ્ધિસાગર જગ જયકારી. યશોધા. ૨૧

(८७)

(८८)

दीक्षा लेती वर्खते महावीर ग्रन्थुनी मोटाकाई
नंदिवर्धनने शिखामण्.

सनेहीसंत ए गिरि सेवा, ए राग.

- मुण्डा नंदिवर्धन अनंधु, कड़ण्डा आहि गुणगण्य सिन्धु,
मारा छूटचो हुनिया संध, शिखामण् चितमां तमे धरयो॥
स्वाधिकारे राज्यने करयो॥ शिखामण्. १
- वर्धिनान यथा कव्य दीधां, दानथी त्याग संयम सिद्धयां,
उपकारे दीधांने लीधां॥ शिखामण्. २
- उपकारनां कामो करने, धर्मभार्गमां नित्य संचरयो;
पाप मार्गमां पगलुं न भरयो॥ शिखामण्. ३
- क्षात्रधर्म न शूळयो कुयारे, साधु हुमीनी चढयो बडारे;
सत्य शूळे ते जगमां ढारे॥ शिखामण्. ४
- न्याय आपवा सर्वने साचो, पक्षपातने हेठ तमाचो;
हेठ उन्निश्च सुखमां न राचो॥ शिखामण्. ५
- आतम सम जगने गणुयो, हृष्ट कोधाहिने हणुयो;
हुठा अनुलब पाठा बणुयो॥ शिखामण्. ६
- शुलाचारथी हेश सुधारो, सत्य नीतिथी धर्म वधारो;
जैनधर्मने जगमां प्रयारो॥ शिखामण्. ७
- धर्मयुद्धथी पाठा न इरुवु, सत्य कार्यमां कुयारे न डरुवु;
न्याय सत्यमां पगलुं भरवु॥ शिखामण्. ८
- उच्च नीचने राखो न लेह, मुळी केने आपो न घेह;
राखो सिद्ध थवानी उभेह॥ शिखामण्. ९
- भनयो नहीं मोहे प्रभाही, करयो शुद्धातम याही;
कहि थायो न जोटा विवाही॥ शिखामण्. १०

(૮૮)

આર્થવંશની કીર્તિ વધારો, સર્વ વિદ્યાએ વિશ્વ પ્રચારો;
હિંસા થશો અનેક નિવારો. શિખામણ. ૧૧

રાજ્ય દેશમાં કરશો સુધારા, હેઠાંયાસથી થાશો ન્યારા;
તેથી સંક્રાંતિ થશો અવતારા. શિખામણ. ૧૨

સર્વ સંઘની કરણે સેવા, અરિહંતને માનો હેવા;
હાન હેવાની રાખો હેવા. શિખામણ. ૧૩

થાશો શુદ્ધાત્મ શુણુરાણી, જ્ઞાન ગર્ભિત થાશો વૈરાણી;
થાશો મન ભમતાના ત્યાગી. શિખામણ. ૧૪

ન્યવહારે કરો પુષ્ય કર્મ, જાની દર્શન ચારિત્ર ધર્મ;
સાધી પામો શાવપુર શર્મ. શિખામણ. ૧૫

આત્મવિષય સહુ લુચોને નિરણી, કરો વિશ્વ દ્વા મન હરણી;
લૈને સાચું અનુભવ પરણી. શિખામણ. ૧૬

જૈનધર્મને પ્રેમ પાળો, મિથ્યા મોહ પરિણુતિ ટાળો;
આત્મ શક્તિયાને સંભાળો. શિખામણ. ૧૭

નંદિવર્ધનને શીખ લીધી, વીરે સંયમની વાટ લીધી;
શુદ્ધિસાગર સંયમ સિદ્ધિ. શિખામણ. ૧૮

(૮૯)

કીર્તિરમલુની દીક્ષા પ્રસંગે યશોદાએ ગાયેંકી ગુંડબી.
વહેલાં વહેલાં દર્શન દેશોરે, સ્વામી શાતામાં રહેશો. એ દાં.
નહાલા વીર પતિ વૈરાણી, સંયમ લેખ થયા તમે ત્યાણી.

નિશાહિન તમારી રાણીરે, પ્રલુ જગ ઉદ્ધરણે,
અટ કેવલજાનને વરશોરે. પ્રલુ. ૧

તમને શુદ્ધાત્મની ધૂન, તુમ સંગતવિષ અથ નું ગુંડબી.
મારું રહ્યું હવે કોણું રે.

વનમાં ડોણું કરે બરદાસ, છાડ્યે તમે જાણ નાખ્યું ન,
સહેવાં બુખ ને જ્યાસ રે. પ્રલુ. ૨

(८८)

ને ને કર્યા તે ચોગધન માતું, પતિકાંતિથી એમ પ્રમાણું, હિલડું શોકે છાવાણું રે.	પ્રભુ.	૪
તવ વિચોગ સહ્યો નવ જાતો; નેત્રે અશુદ્ધાગર ડલારાતો, થયો શોક ન આગે માતો રે.	પ્રભુ.	૫
મુજને એકદી મુકી ચાદ્યા, તમને ઘટે નહીં સ્વામી ઠણલા, માનનો કાલાવાલા રે.	પ્રભુ.	૬
વિસરશો નહીં ડેવલ પામી, દર્શન હેશો મુજ વિશ્વામી, વિનતિ કરું શિર નામી રે.	પ્રભુ.	૭
એક તમારો છે આધાર, વિનતડી હિલમાં અવધાર, કરશો મુજ ઉદ્ધાર રે.	પ્રભુ.	૮
ભૂલશો નહિ મુજને ડો કાળે, સાચા સ્વામી પત્નીની ઠણારે, થધને શીધ સંભાળે રે.	પ્રભુ.	૯
ડેવલજાન ધરી ધર આવો, વાંદી પૂજને લઈશું હણાનો, પૂરને મહારા એ ભાવો રે.	પ્રભુ.	૧૦
સમતાએ ઉપસગને સહેલે, આત્મસ્વરૂપમાં તન્મય રહેલે, બ્યક્ત શુણો કરી વહેલે રે.	પ્રભુ.	૧૧
શુક્લધ્યાનને ધ્યાશો સ્વામી, પૂર્ણસ્વરૂપે ણની નિષ્કામી, સર્વજ્ઞ અન્તર્યોભીરે.	પ્રભુ.	૧૨
વિધન સકલ આયાં હર થાશો, ડેવલજાન હૃદય મકટાશો, સમ્ભવસરણું સ્થિર થાશો રે.	પ્રભુ.	૧૩
સંધ ચતુર્વિધ તીર્થને સ્થાપો, વિશ્વ જીવોને સુખદાં આપો, તીર્થ કર યહ બ્યાપો રે.	પ્રભુ.	૧૪
સતી યશોદા ભક્તિ લરાણી, સહૃદ્યુણની એ ણની છે આણી, ઓલી શુંહલી વાણી રે.	પ્રભુ.	૧૫
હેવી યશોદા એમ વહંતી, વીર પ્રભુને પાય પડંતી, ખુદ્ધિસાગર સુખ શાન્તિરે.	પ્રભુ.	૧૬

(६०)

(६०)

શ્રી મહાવીર ગ્રલુના કાનોમાં ગોવાળે ખીલા ડેકથા
તે સમયની વીરગ્રલુની શુદ્ધાત્મદશા.

સનેહીસંત એ ગિરિ સેવો એ રાગ.

મન ! ! ! આત્મમાં થા લયલીન, ટેક હુઃએ ન થાઉં દીન;
હુઃઅ સહી લે સમતાએ પીન, નિનાતમ થાવ નિજ ઉપયોગી,
તું તે ચિદાનંદ શુણુ કોણી. નિનાતમ. ૧

કર્મ ઉહ્યમાં આવે ને થાય, તેક રૂપ ન રહાડું કહાય;
કર્મ નિર્જરે છુટકે થાય. નિનાતમ. ૨

કર્મને કર્મઝ્ઞે નિહાળ, શુદ્ધ ચેતન નિશ્ચય ભાળ;
શુદ્ધાત્મમાં દષ્ટ વાળ. નિનાતમ. ૩

કર્મોદ્યમાં નિમિત્ત ગોવાળ, તેને આત્મરૂપે ભાળ;
સંમલાવે વિશ નિહાળ. નિનાતમ. ૪

આપ કર્તાને આપહિ હતો, સ્વયં શાનાદિ શુણુધતો;
આત્મભાવે છે આત્મવિમળતા. નિનાતમ. ૫

મનભાવે શાતા અશાતા, હેઠાંથાસે સ્વયં હુઃઅ દાતા;
હુઃઅ લેશ ન આત્મરંગતાં. નિનાતમ. ૬

આત્મભાવે કર્મ ન રહેતાં, કર્મબંધ ન સમતાએ સહેતાં;
મન આત્મમાં લીન કરતાં. નિનાતમ. ૭

દેવાદારતું દેવું ચૂકાવ, આવ્યો ઉત્સવ હિવસ ભાવ;
શુદ્ધ અદ્ધમાં લીનતા લાવ. નિનાતમ. ૮

શુદ્ધાત્મમાં મનહું ઢારી, શુભાશુદ્ધ વિકલ્પો વારી;
થચા ધ્યાનમાં રિથર શુણુધારી. નિનાતમ. ૯

ધન્ય વીરની ધ્યાન સમાધિ, જેમાં લાસે ન હુઃઅ ઉપાધિ;
જેણે સાધના અન્તર્દું સાધી. નિનાતમ. ૧૦

(६१)

એવા મહાવીરને મન ધારો, શુદ્ધ આત્મકૃપ સંભારો;
યુદ્ધિસાગર વીર આધારો.

નિજતમ. ૧૨

(६२)

અશોદાની મહાવીર પ્રલુને ઘેર પધારવાની વિજાપ્તિ.

આવને આવને આવને રે, મહાવીર પ્રલુ ઘેર આવને,	
વીનતિ હિલમાં લાવને રે.	મહાવીર.
અકિત આપીન જગવાનું આમારા, સત્યોપહેશ સુણવને રે. મ૦ ૧	
જગળવન પ્રાણુંથર ર્યારા, શુભ સંહેશ જણાવશો રે. મ૦ ૨	
પરમાત્મ પરમેશ્વર પરગાટ, શુદ્ધ સ્વકૃપ પ્રગટાવશો રે. મ૦ ૩	
ધૂન્ય ધૂન્ય ત્રિશલાના જાયા, ધર્મ સ્વકૃપ સમજાવશો રે. મ૦ ૪	
યુદ્ધિસાગર વીરજિન ઠ્ઠાલા, પલક ન ફૂરે થાવશો રે. મ૦ ૫	

(૬૩)

હેવી અશોદાની શ્રી વીરપ્રલુને વિજાપ્તિ.

તારશો તારશો તારશો રે, પ્રલુ ઠ્ઠાલા મને અટ તારશો,	
સાચી એક તમારી સગાઈ, કૃપા કરીને ઉદ્ધારશો રે. પ્રલુ. ૧	
સત્યોપહેશો દઈને પ્રીતમ, સંસાર પાર ઉતારશો રે. પ્રલુ.	
અધમાધમ શત્રુ ઉદ્ધાર્યો, લક્ષ્મિ હૃદયમાં સ્વીકારશો રે. પ્રલુ. ૨	
સાચા ધર્મી સુજ માથે ગાળે, મોહ માયાને મારશો રે. પ્રલુ.	
પાછળ પડીયા હૃષ્ટ કધાયો, ઠ્ઠાર કરીને સંહારને રે. પ્રલુ. ૩	
પ્રદ્ય કુવનના સવામી સહુણ્ણ, શુદ્ધ સ્વભાવને સુધારને રે. પ્રલુ.	
જયેતિએ જયેત મિલાવી પ્રિય'કર, શક્તિ અનંતી વધારને રે. પ્રલુ. ૪	
આત્મરંગ વધારી વિખુ જિન, નિશ્ચલ ઠામે ઠારને રે. પ્રલુ.	

(६२)

भारा भनतुं सधगुं जाणो, न्यां त्यां भने संलारशो दे. प्रभु.
खुद्धिसागर शुद्ध वीर ०डालम, विनतडी अवधारशो दे. प्रभु. ६

(६३)

अलु महावीर स्वामीनुं निशापामां गमन.

स्थुपति राम हृष्यमांहि रहेन्ने दे. ए राग.

वीर आठ वर्ष थया जाणी दे, मात निशाला छर्ष लराणी दे;
हृष्यो सिद्धारथ शुण्यभाणी, प्रभु महावीरनी बालहारी दे, १

वरद्घोडा यढांयो लारी दे, हाथी घेडा रथ शाण्यगारी दे;

नव नवलां आभूषण्य धारी. प्रभु. २

नवरावी प्रभु शाण्यगारी दे, हाथी उपर प्रेमे गोसाइया दे;

इपे हेवकुमार अवतारा. प्रभु. ३

विद्या शुद्धनी पासे आवे दे, आकाशु भन गर्वने लावे दे;

धन्द्रासन केपे प्रबावे. प्रभु. ४

महावीर प्रभु नष्ट जानी दे, जलु शालामां उचित न जाणी दे.
आप्या ईन्द्र, लक्षित भन आणी. प्रभु. ५

आकाशुहेपे ईन्द्रे पधारी दे, वांदा वीर प्रभु जयकारी दे;

भुजेहे आसनपर ऐसाती. प्रभु. ६

ईन्द्रे पुरुष्या अक्ष हनार दे, शपहशाखाताण्या धरी आपरदे;

आप्या उत्तर सहु निधीर. प्रभु. ७

विद्याशुहना संशय टाळयारे, सहु प्रश्नता उत्तर वाण्या दे;

द्वाक्षे अचरिज्ञी वीर लाण्या. प्रभु. ८

सर्व शाश्वता पारंगामी दे, जाण्या द्वाक्षे प्रभु वीर स्वामी दे;

ईन्द्र जाले प्रभु शिरनामी. प्रभु. ९

(६३)

- वीर तीर्थ'कर अवतारी है, ग्रन्थज्ञान संहित शुशुलारी है;
स्वयं भुख जगत् उपकारी। प्रभु. १०
- ज्ञानी आकृष्ण युद्ध अमारे है, पदयो पाये प्रभुने लाये है;
सत्ता वंडे हर्षना हाये। प्रभु. ११
- मैन्द शापिड क्षात्र रथयुँ है, देश भारतमांडि सुहायुँ है;
भासि पिताए सुण अहु पायुँ। प्रभु. १२
- धन्द्र वंडी-गया निज ठाम है, भक्तावीर रमे निजधाम है;
उर्मीचौपी प्रभु निष्काम। प्रभु. १३
- ग्रन्थ सानी नहीं अलिमानी है, सागरवत् गंभीर जायी है;
थोड़ा आकृष्ण निरलिमानी। प्रभु. १४
- प्रभु योहे न गर्वना योहा है, थाय हीरानां लायो योहा है;
पुद्धिसागर शुष्णा अमोहा। प्रभु. १५

(६४)

श्रीवीर प्रभुनी हीक्षा वर्खते तेमनी पुत्रींमि पिता ग्रन्ति
काढेला उद्घगार।

स्वामी शातामां रहेशा॥ ए. २१॥

- धन्य प्रभु भक्तावीर अमारा, पिता तीर्थ'कर अवतारा,
सर्व लोकाना तारणुहारा, केवला शुशुना लांडरा है; १
सुजने न विचरयो, मारो स्नेह न आछो करयो है. सुजने २
प्रेमे उछरी शिक्षण्यु आयुँ, धर्मज्ञान सुज हृक्यमां व्यापुँ;
तरव अहिंसा थायुँ है। सुजने ३
- सर्व कणाओ शिखवी सारी, परमेश्वर पूरण्य अवतारी,
हुज अवननी बलिहारी है। सुजने ४
- तरव शुशु राचीने भन माची, वात तमारी सर्वे साची,
हुनियाहारी काची है। सुजने ५

(४४)

જીડ વિષયોના લોગે ન શાન્તિ, મોહથકી રહે તેહમાં આન્તિ,	સુજને ૫
આતમભાવથી કાન્તિ રે.	
શુદ્ધાતમ રઢ પૂરણું લાગી, શુદ્ધ પરિષુતિ અંતર જાગી,	સુજને ૬
પરમાતમ સૈંકાણીરે.	
તવ વાગી જાગામાં ન્હાયું, શરણું અહી શિવપુરમાં જાયું,	સુજને ૭
ઝુંદિત કમાણી કમાણું રે.	
લાડકનાઈ ખાલિકા તહારી, તવ ડિસંગે રમી શુણુશાલી,	સુજને ૮
ફેલ ન હેઠો ઉતારી રે.	
ધ્યાન ધરીને લે તમે લેશો, અત્ર પધારીને રહેને હેશો,	સુજને ૯
પાડવળે સહેશો રે.	
કાળજી ઝડ્હાડું ચરર ચિરાય, હુઃઅ થતું વચને ન કથાય,	સુજને ૧૦
આજે સધજું શ્વય જાણ્ય રે.	
ચોગી થઇને જાગલ જાશો, શુદ્ધાતમમાં લયલીન થાશો,	સુજને ૧૧
કૃપલજાનને પાશો રે.	
અલાવાલા કથી તવ આગે, પિતા રંગાધ શુણ રાગે,	સુજને ૧૨
અતુસરશું વેશાગે રે.	
પ્રિયદર્શના એમ કથાંતી, વીર નામનો જાપ જપાંતી,	૧૩
વીરને લાવે નમાંતી રે, નિજ ઘેર વળાંતી.	
પ્રિયદર્શના લક્ષ્મિ ભરેલી, સત્યાચાર વિચાર ઠરેલી,	
શુદ્ધિસાગર શુણુંથી ભરેલી, વેના જનક વીર એલી રે. સુજને ૧૪	

(५५)

(५५)

શ્રી વીરકુમારતું હાલરકું.

આતા નિશલા જૂલાવે પુત્ર પારણે.

વારી જાડ નહાતા વીરકુમારને વારણે,
ગાડ વીર પ્રભુતું હાલરકું હરખાઈ;
મારી આંખો પાંખો નહાલો હૈયું હેતતું,
મારી સંઘળી આશા લુચંતી જગ થાઈ. વારી. ૧

જૂલો પારખુચિયામાં વર્ધમાન જિન આલુડા,
ગાડ ગીત તમારાં મીઠાં રસ ભરપૂર;
હાલો હાલો હાલો હાલો નંદન વીરને,
દૃઢું અણકે ત્રષ્ય કુવનમાં સંઘળે નૂર. વારી. ૨

ક્રાટિ શશીને લાનુ ઢેવ કરે તુજ આરતી,
કરતા મંગલ દીવા દેવીઓ નરનાર;
દર્શન કરવા આવે સુરપતિ નરપતિ નહાલથી,
વર્ષે આંગખિઓ મખિકંચનના લંડાર. વારી. ૩

ધન ધન વૈદેહી જગણુવન રાજકુમારને,
અણકે અંગો અંગો પરથળતું તેજ;
તહારી લીલા સંઘળી પરમેશ્વર શક્તિ બરી,
તે તો જાણ્યાં તીર્થ્યકરના લક્ષણુ સહેજ. વારી. ૪

મારી કૂણે જન્મયો જગણુવન જગનો ધણી,
તેથી ત્રષ્ય કુવનમાં બની ધણી પ્રખ્યાત;
મારા હૈયામાં ઉછળતા સુખના સાગરો,
કું તો કહેવાણી તીર્થ્યકરની જગ માત. વારી. ૫

ક્રાટિ રનિ શશી તારા તુજ આંખોમાં શોલતા,
તારા હૈયામાંહિ પૃથ્વી સર્વ સમાઈ;

(૬૬)

- અજિન વાયુ નસ તુજ હુદ્ધે ગિરિવર પાડમાં,
સાગર ઉરમાં તારી સ્તુતિ વેહે ગાઈ. વારી. ૬
- સધળી જાનસ્યુષિ તવ આતમમાં વિલસી રહી,
પ્રગટ્યા જગમાં કરવા કૈનદર્મ ઉદ્ધાર;
લંઘન સિંહતાણું સમજાવે પૂર્ણ પરાક્રમી,
હું તો પાસું નહીં તુજ ચુણું કલાને પાર. વારી. ૭
- તારો મહિમા ગાવા વિશ્વ સકલ અવી રહ્યું,
લક્ષ્યાં ખાદ્ય અભ્યંતર સહશ્ર લક્ષ કરોડ;
નંદન આનંદામૃત. ઉધે ઘટમાં ઉઘતા,
કૃપે તહારા જેવી મળે ન જગમાં જોડ. વારી. ૮
- મારાં અનેક ભવનાં તાપ કીથાં આ ભવ ફર્જયાં
પ્રભુની માતાર્થાના મળિયો શુભ અવતાર;
મારા સર્વ મનોરથ પૂરા આ ભવમાં થયા,
પ્રભુની માતા ભક્તાણી યે જગજ્યકાર. વારી. ૯
- આવે ધન્દ્રાણીઓ તુજને રમાડે છેતથી,
દર્શન કરીને થાતાં તુજમાંહી લયલીન;
મારા હિલદામાંહી અગમગ જયોતે જળહળે,
નહાલા નંદન તું છો તીર્થંકર મહાજિન. વારી. ૧૦
- ગાવે ત્રિશલા માતા વીરકુમારનું હાલર્દ,
સુષુપ્તા વર્ધમાનનું ત્રિશલા માતા ગોલ;
ઉછળે પારણીયામાં પગ અંશુડી ધ્યાવતા,
કરતા આનંદમય ચેષ્ટાના ખહુ કલ્લોલ. વારી. ૧૧
- નહાલો નહાલો નહાલો નરણ જુવનના નાથને,
ભાપા વૈખરી વાણી વિશ્વગુરુને ગાઉ;
સુદ્ધિસાગર ભાસે પરાપ્રશ્યંતીમાં વિલુ,
ઝાંખી પામી હાલરડું ગાઈ હરખાઉ. વારી. ૧૨

(૬૭)

(૬૮)

શ્રી મહાવીર પ્રભુની ગરથી.

મહાવી જણીએ આજે મહાવીર પ્રભુને ગાઈએ રે,
 ખાતાં હરતાં ફરતાં મહાવીર પ્રભુને ધ્યાઈએ રે;
 જેથી પ્રગટે પરમાનંદ અરે। નિર્ધાર,
 આતમમાં જિનશાસન લુચંતુ નિર્ધાર.
 એવા જૈન ધર્મને આતમમાં અગટાવીએ રે.

સાધી.

ત્રિશલા નંદન જગધારી, નિરાકાર સાકાર;
 અનન્ત શક્તિમય પ્રભુ, તીર્થ્યકર અવતાર.

આરત દેશ ઉદ્ઘાયો હુઃઅ હુર્ગણુ સર્વે હરીરે,
 દીધા સહૃપદેશો લારતમાં સધળે દરીરે,
 કીધા ઉપકારો વર્ણવતાં નાયેપાર, માટે ધન્ય ધન્ય મહાવીર પ્રભુ
 અવતાર. મહાવી. ૧

સાધી.

દર્શાન હાન ચારિને, વીર્ય અનન્ત અપાર;
 આતમરૂપ જાણુવિયું, જિનશાસન જયકાર.

આતમ શક્તિયેને જૈનધર્મ સમજાવીએ રે,
 નથી કંયાં નાતિ જાતિનો બેડ જરા નિર્ધાર.
 એવા દ્રવ્યભાવથી પ્રભુ ધર્મ હિંલ ભાવિયે રે,

મહાવી. ૨

સાધી.

આતમ તે જૈનધર્મ છે, સત્યરૂપ છે એહ;
 પરમાત્મપદ હેતુએ, જૈનધર્મ છે તેહ.
 ૧૩

(६६.)

એવો કૈનધર્મ જગમાં સહુ લુચેમાં રહ્યોરે,
સત્તાએ તે પ્રગટપણે કરવા નિર્ધોર.
મહાવીર પ્રભુએ સર્વજ્ઞ જગમાં સાચો કહ્યો રે. ઠાલી. ૩

સાખી.

કૈનધર્મમાં જીવતા, સર્વ ધર્મ સમાય;
સદકસત્ત વ્યક્તાવ્યક્ત સહુ, અર્થિતનાસ્તિત્રય પાય.
મહાવીર શરણે રહેતાં સર્વધર્મ પ્રગટે ખરા રે.
નાસે કર્મ મોહાહિ સહુ અનાહિ કીધ.
આટે મહાવીર પ્રભુને દિલડામાંહી રહેં ધર્યા રે. ઠાલી. ૪

સાખી.

અનન્ત વિશ્વ સમાય છે, મહાવીર જ્ઞાનનીમાહિ,
આત્માએ સહુ વીર સમ, સત્તા વ્યક્તિત્વી છાંધ;
મહાવીર જગ દ્વૈપેને જગ સહુ મહાવીર જાણીએ રે,
સત્તા સાપેક્ષાએ લુચો વીર નિર્ધોર,
એવા મહાવીર પ્રભુને અન્તરમાંહી આણ્ણીએ રે.
બુદ્ધિસાગર ક્યાંચે મહાવીર આપો આપ. ઠાલી. ૫

(૬૭)

કૈન ધર્મની ગુંહલી.

ભુનિનર સંધગમાં રગતા એ શાગ.

જિનેશ્વર ધર્મની અલિહારી, ચડતી લહે નર ને નારી, જિનેશ્વર.
કૈનધર્મ જગ જયકારી, અહિંસા સંધમ તપધારી;
દાન શીયત્વમાં અત્રસારી. જિને૦ ૧

(४६)

મન વાણી કાયા શક્તિ, વિદ્યાહિક શક્તિ વ્યક્તિ;	જિને૦ ૨
થરપણ્ણાની છે અક્ષિત.	
નિર્ણયા હું કરવી, આત્મહશા ચક્તી વરવી;	જિને૦ ૩
હું ટેવેને સંહરવી.	
આત્મસસું જગ્ઞને ગણું, શક્તિતથું ભણુતર ભણું;	જિને૦ ૪
નિશાહિન મન કણજે કરણું.	
કમે વીરાર્પણું કરવાં, કામ ન કરવાં ને વરવાં;	જિને૦ ૫
હિલાં સહયુષ્ણથી ભરવાં.	
સત્યને માટે ને ભરતા, સ્વર્ગવિષે તે અવતરતા,	જિને૦ ૬
કાયર જન પાછા ફરતા.	
નૈનોની છે એ રીતિ, ગણે નહીં ભૂત્યતથી સીતિ;	જિને૦ ૭
છ'ડે નહીં ભરતાં નીતિ.	
ધર્મયુદ્ધમાં ને ભરતા, દેવદેવાકને તે વરતા;	જિને૦ ૮
વીરાર્પણું ને સહુ કરતા.	
નામ રૂપ ભમતા ટાળી, મહાવીરમાં મનને વાળી;	જિને૦ ૯
નૈનો મુક્તિ લહે સારી.	
શક્તિ વધારે ને ઉદ્ઘારે, ધર્મ કદ્દો તે વ્યવહારે;	જિને૦ ૧૦
આત્મ વિચારે ને આચારે	
દેશ રાજ્ય વિદ્યા પ્રગતિ, આપે ધર્મ તે સત્ય મતિ;	જિને૦ ૧૧
ધર્મ તે શક્તિઓ સર્વ છતી.	
નૈનધર્મ સમજે સાચો, આહરી સર્વ લુચો સાચો;	જિને૦ ૧૨
ષુદ્ધિસાગર મન રાચો.	

(१०६)

(८८)

શ્રી મહાવીર પ્રલુની ગુંડલી-ગરથી

મુનિવર સંયમમાં રમતા.

- | | |
|--|-----------|
| પ્રલુ મહાવીર લલે ભાવે, કુમતિ ઠળે સુમતિ આવે; | પ્રલુ. ૧ |
| આતમ નિર્બિંદુ જટ થાવે. | |
| કર્યું જેણુ મહાવીરનું શરણું, પછીથી નહીં તેહને મરણું. | પ્રલુ. ૨ |
| પ્રગટે હૃદય અમૃત જરણું. | |
| નીર લલે નાસે પાપો, શરણું કરે નહીં સાંતાપો; | પ્રલુ. ૩ |
| પૂર્ણ પ્રેમે જપતાં જાપો. | |
| આતાં પીતાં હરતાં હરતાં, વીર વીર મુખું ઉચ્ચરતાં; | પ્રલુ. ૪ |
| નર નારી શિવપુર વરતાં. | |
| તર્ક વિવાહો સહુ છ'ડો, મહાવીરથી રઠને મ'ડો; | પ્રલુ. ૫ |
| ચાઢ કરી વીરને વહે. | |
| પરમાત્મ વીરના જેવો, પ્રષ્ય કુવનમાં નહીં હેવો; | પ્રલુ. ૬ |
| પૂર્ણ સ્નેહ ઘટમાં સેવો. | |
| વીર વીર જે ઉચ્ચરશે, તેહનાં પાપો સહુ ઠળશે; | પ્રલુ. ૭ |
| આતમને તેહ ઉદ્ધરશે. | |
| અરિહંત વીર જપો જાપે, આતમ વિશ્વનિષે જ્યાપે; | પ્રલુ. ૮ |
| સુકિત સ્વયં નિજને આપે. | |
| કલિકાલે મહાવીર લલે, વિકથા અટપટ હુર તલે; | પ્રલુ. ૯ |
| વીર પ્રલુદ્ધપ એણખલે. | |
| વીર વીર મુખ જે એલે, સુકિત દ્વાર જટ તે એલે; | પ્રલુ. ૧૦ |
| આતમ શક્તિયે તેલે. | |

(१५२)

મહાવીરનું સંગપણું કીદું, અતુલવ અમૃતને પીદું;
બુદ્ધિસાગર મન સિક્કયું.

પ્રખુ.. ૧૧

(૮૮)

પતિવતા જીનાં લક્ષણુ. ગરભી.

શુનિવર સંયમમાં રમતા એ રાગ.

પતિવતા નારી જગસારી, દેવી સતીની બળિહારી,	પતિવતા.
પરછ્યો પતિ કર્મે પાપી, સંતોષે રહે શુષ્ણુરામી;	પતિવતા. ૧
થાય ન પરનરની કાની.	
શ્રૂપથકી નહીં લલચાતી; પતિને અવરાવી આતી;	પતિવતા.
શાંકા પડે ત્યાં નહિં જાતી.	૨
લાજ મયોદી નહિં મૂકે, શીયલ મતને નહીં ચૂકે;	પતિવતા.
કામની વાતો નહીં કૂંકે.	૩
જડ લોગોની ન પૂજારી, કર્મ કરે શુભ સંલાળી;	પતિવતા.
વાણી વહે શુણે રદ્દિયાલી.	૪
સાસુ સસરાને નમતી, વૃદ્ધ જમાઈને જમતી;	પતિવતા.
મેંણાં ટોણ્યાં સહુ સહતી.	૫
કલુધા કંકાસા ત્યાગે, સહુ પેલાં ધરમાં જાગે;	પતિવતા.
હેવશુર પાયે લાગે.	૬
પર ઘેર નવરી નહીં લમતી, કુલટા સાથે નહીં રમતી;	
હુઅ પડેલાં સહુ અમતી.	પતિવતા. ૭
ચિંતા પતિથી નહીં ચાદે, પીડા નકાની નહીં ઠોદે;	
પતિને ન અવળાપથ હોદે.	પતિવતા. ૮

(१०२)

- जेवा तेवा पति निज सारो, कर्म भजेया माने आरो;
धर्ष्णे न थीजे इपाणो. पतिव्रता. ६
- मन मारी धरमां रहेती, कार्य करे धर्माने नीति;
पाणे कुलवटनी रीति. पतिव्रता. १०
- अरिहंत वीर प्रभु जपती, सापे न मन काया तपती;
संतोषे राखे त्रृपति. पतिव्रता. ११
- निंदा विकथा सहु वारी, शुण्युथी थाती जग आरी;
झुँडिसागर शुण्य खारी. पतिव्रता. १२
-

(१००)

प्रलभ्यमावीरनी शुँडली.

मुनिवर संयममां रमता ए राग.

- हुक्यमां वीर प्रभु वसने, पाप कर्म सधाणां असने, हुक्यमां.
सुख हुःभमां वीरनी यही, मनमां न बानशो उन्मादी; हुक्यमां. १
- माशुं प्रभु एह परसाई,
वीर वीरमय सहु हेखुं, भीजुं सधगुं उवेखुं;हुक्यमां. २
- गांजुं निज आतम वीर लेखुं,
वीर वीर नहीं लुलाशो, पूर्ण थशो छोल्लाशो;हुक्यमां. ३
- आतम रहो वीर विश्वासो,
तव जापो शुँडा जपशो, भनडुं तव तपने तपशो;हुक्यमां. ४
- आतम वीर विना भप शयो ?
वीरपर्ण्यु सधगुं हेशो, वीरप्रभु सन्सुख लेशो;हुक्यमां. ५
- क्षाणु पण्यु द्वर नहीं हाशो,

(103)

અહેને પ્રભુ તુજ લાગી માયા, તુજને સેંપી સુજ કાયા, ક્રાંત્યાં ત્યાં વીર હો સુજ છાયા,	હૃદયમાં. ૬
આંધકાર હુદે ટણો, પ્રકાશમાં સુજ આતમવાળો; સદ્ગ પ્રિયતમ તું સુજ નહીં હોલો,	હૃદયમાં. ૭
તુજ શક્તિ અપરં ધારા, પરમથ્રદ્વારા તું છે રહારા; અન્તર બાદથી આધારા,	હૃદયમાં. ૮
તુજમાં લયલીન થધ જાવું, એક પ્રલો તું મન લાવું; ક્ષણું ક્ષણું ગુણું તહારા ગાવું,	હૃદયમાં. ૯
ભીડસાં નહીં આવો, શક્તિ અનંતી પ્રગટાવો; વીરપ્રભુ મીતિ લાવો,	હૃદયમાં. ૧૦
પ્રહેણો પ્રહેણો વસનારા, શુદ્ધાત્મ ગુણું આધારા. બુદ્ધિસાગર ઘટ જ્યારા,	હૃદયમાં. ૧૧

(३०३)

ਪਟਿਆਲਾਨੀ ਗੁਰਥੀ.

આનવર સંયમગ્રામ રમતા. એ રાજી.

શુદ્ધિવંત પતિની અલિહારી, હૃર્ષ સની નહીં વ્યલિચારી, શુદ્ધિવંત.
કદ્મણ નહીં કદ્મિ પરનારી, શુદ્ધ પ્રેમનો અવતારી;
બાળી મધુરી ઉપકારી.
શુદ્ધિવંત. ૧
કામ કરે સર્વે સારાં, હૃષ કર્મ કરતો નયારાં;
સ્વજન ગણે મનમાં આરાં.
શુદ્ધિવંત. ૨
ખર્તીથી નહીં કલેશ કરે, કુદુરી હુદ્ધે સર્વ હુરે;
નવરો નજીટ થઈ નહીં કરે.
શુદ્ધિવંત. ૩

(१०४)

આચારો સાચા પાળે, પત્નીને મનહું વાળે; ચઢતો નહીં મોહના વાળે.	શુણુવંત. ૪
ઝુંઝે ન પરનારી ર'ગે, રહેતો નહીં હજુંન સ'ગે; કર્તાંથી કરતો ઉમ'ગે.	શુણુવંત. ૫
આત્મસમી પત્ની હેઠે, એક સ્વરૂપે મન પૈછે; અશુદ્ધપ્રેમને ડેવેણે.	શુણુવંત. ૬
પત્નીને વરો લોણી, શુદ્ધ પ્રેમ શુણુ સ'યોણી; દેશકાલ શુણુ ઉપયોણી.	શુણુવંત. ૭
નીતિ રીતિ સ્તરને પાળે, હુર્ઝુંખુ પ્રગટચા સહુ ટાળે; વંશ કુળ નિજ અજવાળે.	શુણુવંત ૮
પ્રામાણિક પૂરો થાવે, અવળા પન્થે નહીં જાવે; સહુને ખવરાવી ખાવે.	શુણુવંત ૯
સાધુ સંત સેવા સારે, અતિથિને આદર ભારે; નિર્દેખ વરો સંસારે.	શુણુવંત. ૧૦
પત્નીયી નહીં કલેશ કરે, શુસ્સો અને નહીં ગર્વ ધરે; ધર્મ માર્ગ માંહિ સંચારે.	શુણુવંત. ૧૧
વીરપ્રભુ હૃદયે ધારે, વીર જાપ જપતો ભારે; કામ કરે સહુ અધિકારે.	શુણુવંત. ૧૨
વીર પ્રભુ શુરૂનો રાગી; આત્માર્પ ષુદ્ધભાવે ત્યાણી; ષુદ્ધિસાગર શુણુરાગી.	શુણુવંત. ૧૩

(१०५)

(१०२)

મહાવીર પ્રભુપરે પ્રેમ.

સુનિવર સંયમમાં રમતા. એ રાગ.

પ્રભુ મહાવીર ભલ્લુ ભાવે, નિલતમ વીર પ્રભુ થાને,	પ્રભુ.
મહાવીર આંખે હેખાશો; મહાવીર દિલ માર્દ થાશો;	
નિલતમ મહાવીર સમજશો.	પ્રભુ. ૧
વીરહાશો સુજ હાથ થશો, વીર વિના નહીં પ્રેમ કશ્યો ?	
નિજ હૈડામાં મહાવીર વસો.	પ્રભુ. ૨
મારા કણ્ઠો વીરને સાંભળશો, મહાવીર પ્રભુ વચ્ચેનો સુણુશો;	
મારી અંદ્રા વીર પ્રભુ લણુશો.	પ્રભુ. ૩
મારી આંખો વીર પ્રભુ હેણો, માર્દ દિલડું વીર પ્રભુ પેણો;	
શીંડ માયાને જટ ઉરેણો.	પ્રભુ. ૪
મારા પગ મહાવીરસમા થાશો, વિશહિતાર્થી પગ વપરાશો;	
મહાવીરને હેશો વિશાશો.	પ્રભુ. ૫
બદ્દ ચક્કોમાં મહાવીર વસ્યા, શુદ્ધપ્રેમે અદ્વૈત થઈ ઉદ્વસ્યા;	
ઓની મહાવીર પ્રેમે જાગી હશા.	પ્રભુ. ૬
બાગયા ગગન ગઢ વીરના ડંકા, સુણે અનહંહ મહાવીરના બંકા;	
પૂર્ણ આનન્દી વીર અવટંકા.	પ્રભુ. ૭
ચઢી ગગનગઢે વીરને દીકા, ઉનસુની સુદ્રાએ મીકા;	
સુદ્રિસાગર આનન્દ ઉરુધા.	પ્રભુ. ૮

(१०६)

(१०३)

મહાવીર મલુની ગરખી.

મલુ મહાવીર વિલુપ્ત સર્વાંગે શોભી રહ્યા ને,
જેનો મહિમા જગમાં સંઘળે અપરાપાર;
શક્તિ જેની છાંકે સર્વ વિશ્વ આધાર,
એવા વીરમલુ તો વચને નહીં જાવે કહ્યા ને;

સાખી.

આતમ તે પરમાત્મા, પરમાત્મ તે વીર,
પર અદ્ધ હરિહર વિલુ, અરિહંત જગધીર;

કેવલજ્ઞાન અને દર્શન-ગુણુથી જગમાં વિલુ દે,
વિશ્વોક્ષારક તેથી, જગમાંહી સાચા મલુ ને;
ચિંત અદ્ધાંડ જળહળતી-જગમગ જયોત,
તેથી નૃષ્ય લુલનમાં-વીરતણે ઉદ્ઘોત;
સાપેક્ષાંચે કર્તા હુત્તા, પાલક જગ ધણી ને.
સત્તાંચે વ્યાપકને કેવલજ્ઞાને જગમણુ ને. મલુ. ૧

સાખી.

અનંત જ્ઞાનાહિક શુણી, જળકે અનંત નૂર,
ચિહ્નાનનંદ અનંતરસ-સાગરના છો પૂર;

ચિંત અદ્ધાંડ વટકારક મય શોભા લહ્યા ને,
અનંત શુણુપચ્છી, દ્રવ્યપણે નિત્ય જ વહ્યા ને;
જેના શુણુ પચ્છોયો અનંતહેવ સ્વરૂપ,
સહસ્રતુ પચ્છોયોચે વતો રૂપારૂપ;
ધાર ધાર આત્મવીર સત્તાંચે પરમાત્મ સદ્ગા ને,
આવિર્બાવે વ્યક્ત જિનેશ્વરકેવલી છો સુદ્ગા ને. મલુ. ૨

(१०७)

શાખી.

બધયકોમાં નર હુજ, લાસે અનંત અપાર,
સત્તાએ જીવે સહુ, એકાત્મા નિર્ધોર;
નથુ નથવહાડે આત્મ-અનંત નથકિટએ છતા જે,
સુભળ્યા વથુ નથોને, મૂકજનો ખાવે ખતા દે;
માટે નયના જ્ઞાને સમજે વીરસ્વરૂપ,
જેથી નાસે મિથ્યા ક્ષાંતિ હુઃખાં ધૂપ;
ઝુદ્ધિસાગર આત્મ મહાવીર ઘટમાં દેખશો જે;
શુદ્ધેમાદેતે આત્મ સસુ' જગ પેખશો જે. પ્રભુ. ૩

(૧૦૪)

નૈનોના ગુણોની ગુંડલી.

ચુનિવર સંધ્યમભાં રમતા. એ રાગ.

નૈનો તે ગણુંબા સાચા, મીઠી સત્ય વહે વાચા. નૈનો.
વીરાર્પણ કરેં કરતા, કેશરિયાં કરી સંચરતા; નૈનો.
વીર વીર સુખ ઉચ્ચરતા. નૈનો. ૧

મહાવીર હિલડું નિજ કરતા, મૃત્યુ કાલથી નહીં ડરતા;
મોહના માર્યો નહીં મરતા. નૈનો. ૨

મહાવીર દેવને દિલ ધારે, ચડતા ધર્મિજન બહારે;
આપ તરે પરને તારે. નૈનો. ૩

વીરસમા દાની થાતા, ધૂતોથી નહીં વંચાતા;
અજવાણે ત્રાતા માતા. નૈનો. ૪

સર્વ શક્તિયો પ્રગટાવે, સત્ય પ્રેમ હિલમાં લાવે;
નૈનને અવરાવી આવે. નૈનો. ૫

(१०८)

वीरजनोने संतोष; सेवा लकित करी होशी;	जैनो. ६
रहेता न अन्याये रोषे;	
जुवे वीरभक्तु माटे, धर्म न हड्डे शिर साटे;	जैनो. ७
जाय न पापतण्ठी वाटे.	
अरिहंत महावीर मनप्यारा, शरणु करी जगहाधारा;	जैनो. ८
सङ्कल करे निज अवतारा.	
जैनधर्म माटे भरता, स्वर्गविषे ते अवतरता;	जैनो. ९
हुःअी जैने उद्धरता.	
धीरा वीरा रघुश्रा, हीन ज्ञेनापर नहीं हुरा;	जैनो. १०
जुवन सूत्रेथी पूरा.	
आधुसंत सुजसम होये, निन्दा होधने उवेषे;	जैनो. ११
आत्मा सभी हुनिया चेषे.	
जैनोने महावीर समा—गण्ठता राये न स्वार्थतमा;	जैनो. १२
समने सङ्कुट ज्ञान गमा.	
जैनो वीरजनो चेवा, करता विद्यतण्ठी सेवा;	जैनो. १३
युद्धिसागर शुद्धेवा.	

(१०५)

अरिहंतपदनी युहली.

भवि तमे वहोरे सूरीथर गच्छराया, ए राग.

वीर उपहेशोरे अरिहंत भक्तु जगहेवा,
 अरिहंत पहनी रे करने लावे सेवा;
 आनीश अतिथय महिमा धारक; वाणी शुशु पांचीश;
 समवसरणुभां घेसी जिनवर, उपहेशो जगहीश. वीर. १

(१०८)

- धातिकर्मनो नाश करीने, डेवल ज्ञाने शोषे;
शुद्धातम तीर्थंकर अरिहंत, अनंत गुण्यथी आपे. वीर. २
- अरिहंत ते निः आतम जाणु, सत्ता व्यक्ति पिष्ठानो;
आतमना उपर्योगे चाते, परगट ईश पिष्ठानो. वीर. ३
- अरिहंत परमातम चाते, अगटे आतम जयेते;
भुद्धिसागर भ्रमु अंतरमां, शोषे शुद्ध उव्याते. वीर. ४

(१०९)

सिद्धपदनी गुण्डली.

राग उपरनो।

- लवि तमे वहोरे सिद्ध भ्रमु जयकारी,
शुद्ध उपर्योगी रे कर्म रहित गुण धारी;
सिद्ध भ्रमु निनातम जाणु, शक्ति निश्चय आणु;
निराकार निर्भव शुद्धातम, अनंत सिद्धो मानो लवि तमे. १
- सत्ताचे निः आतम सिद्ध ज, व्यक्तिपछु भ्रगटावो;
अनंत तीर्थं स्वयं निः आतम, ईशानविषे लय लावो. लवि. २
- अनंत ज्ञानाहिं गुणु आगर, शुद्धातम हिलभावो;
भुद्धिसागर आतम उजागर, शुद्ध समाधि सुहावो. लवि. ३

(११०)

(१०७)

આચાર્યપદની શુંહલી.

રાગ ઉપરનો.

જવિ તમે વહેં રે આચાર્ય શુણુખાણી,

અમૃત સરળી રે જેહની ગીઠી વાણી;

દ્રવ્ય ભાવથી છત્રીશ છત્રીશ, શુણ શુત શાનના ફરિયા,
નૈનધર્મના રક્ષક અતુભવી, અતિશયી સુખ ભરિયા. ભવિ. ૧

અનેક ઉપમા જેહને શોલે, ચુગ પ્રધાનાવતારી;

અન્તરાત્મપદ્ધારક યોગી, જેહની સંગતિ સારી. ભવિ. ૨

સવોગમ દર્શન વડવીરા, ધીર વીર ગાંધીરા;

નિક્ષેપ તે વ્યવહારે પૂરા, સર્વ શક્તિથી થરા. ભવિ. ૩

નિક્ષેપ સત્તાએ નિજ આતમ, સૂર ગુણોએ ભરિયા;

શુદ્ધિસાગર આતમજાને, ભવસાગરને તરિયા. ભવિ. ૪

(૧૦૮)

ઉપાધ્યાપદની શુંહલી.

રાગ ઉપરનો.

જવિ તમે વહેંદે ઉપાધ્યાય શુણુધારી,

શથીરવિ સરણોરે નિર્મમ નિરહંકારી;

શુનિગણુને આગમ વંચાને, લણે લણુાને ભાવે;

જ્હાણુને નવ પદ્ધતિને કરતા, પાઠક શક્તિ પ્રભાવે. ભવિ. ૧

શોલે જે ખુચરાજ સમા નિત્ય, સદ્ગારારત ધારી,

તથી જપી અતિશયી પ્રભાવક, પંચવીશ શુણ ભારી. ભવિ. ૨

ઉપાધ્યાય નિજ આતમ જણો, વ્યકૃત કરો નરનારી;

શુદ્ધિસાગર આતમ વાચક, દ્રવ્યસાવ નિર્ધોરી. ભવિ. ૩

(१११)

(१०६)

સાહુપદની શુંહલી.

રાગ ઉપરનો.

જવિ તમે વંદોરે સુનિપદ જગહિતકારી,
અધિ શુભ સ'યમી રે સાધુ ત્યાળી શુષ્ણધારી;
સત્તાળીશ શુષ્ણ દ્રોયભાવથી, ધારક તપસી મહાત,
શાંત હાંત તપસી શુષ્ણયોગી, સદાચારી શુણી સાંત. જવિ તરે. ૧
કિયા વેપમાં આશ્રણી નહીં જે, જાનાદિક શુષ્ણ અપિયા;
સહાચારી પરમાર્થે પૂરા, શૈહવિનાશક તપિયા. જવિ. ૨
નિશ્ચયથી નહીં લુંચે સુંડે, આતમ સાધુ સુહાયો;
ઝુદ્ધિસાગર સાધુ આતમ, જાને અનુભવ પાયો. જવિ. ૩

(૧૧૦)

દર્શનપદની શુંહલી.

રાગ ઉપરનો.

જવિ તમે વંદોરે દર્શનપદ શુષ્ણકારી,
જિન શુરૂધર્મની રે અદ્વાની અલિહારી;
દ્રોયભાવથી અદ્વા દર્શન, આતમ જાને પ્રમાણ્ણ,
ક્ષોપશમ ઉપશમને ક્ષાયિક, નિશ્ચય સમકિત માનો. જવિ. ૧
સુર્ખધર્મનું મૂલ છે અદ્વા, નિશ્ચય મનમાં લાયો;
અન્તરભાગ અદ્વાયોગે, અંતરમાં મગટાયો. જવિ. ૨
દર્શન શુષ્ણથી અલેહી આતમ, અનેકાન્તથી કયાયો;
ઝુદ્ધિસાગર આતમ ચોતે, અરૂપી પદ લાયો. જવિ. ૩

(११२)

(१११)

જ્ઞાનપદની શુંહલી.

રાગ ઉપરનો.

જવિ તમે વંદોરે આત્મજ્ઞાનને લાવે, શાસોક્ષાસમાં રે જાની શિવપદ પાવે;	
જ્ઞાનાજિન સહુ કર્મકાઠને, ક્ષણુમાં ભર્તમ કરંતી, જ્ઞાનાજિન હિલમાં પ્રગટયો, ક્ષણુમાં સુક્રિત વરંતી.	જવિ. ૧
જ્ઞાનસમું નહીં કોઈ પવિત્ર જ, પંચજ્ઞાન જ્યકારી; તેમાં પણ ઉપકારી કુત છે, પામો નરને નારી.	જવિ. ૨
અનંત વેદાગમ શુણુ હરિયો, નિજ આત્મ નિર્ધારો; ખુદ્દિસાગર અતુલની જાની, સેવી લહે લવ યારો.	જવિ. ૩

(૧૧૨)

ચારિત્રપદની શુંહલી.

રાગ ઉપરનો.

જવિ તમો વંદો રે ચારિત્રપદ સુખકારી, રંકનો રાલ રે થાવે સુનિ શુણુ ધારી.	
પંચાચારને પંચ મહાબત, મૂલ ઉત્તર શુણુ ચોણી, બ્યવહાર વરો ચારિત્રી, નિશ્ચય નિજ શુણુ કોણી.	જવિ. ૧
દ્રોધ ચારિત્ર તે વેપાચારે, શુણુથી ભાવ પ્રમાણો; કોધાઠિકનો ઉપશામ ક્ષાળિક, ચારિત્ર નિશ્ચય માનો.	જવિ. ૨
આત્મ સ્વભાવ રમણુતા નિશ્ચય, ચારિત્ર આત્મસ્વરૂપી; શુલ ને શુદ્ધોપથોળે તરતમ, ચોગે ધ્રદ્ધ સ્વરૂપી.	જવિ. ૩

(७२३)

निज आतम चारित्र वर्णणा, शुद्ध परिष्ठाम स्वल्पावे;
 निरासकित चारित्र निजतम, निर्वेपी मन दावे. अवि. ४
 जलपंडजवत् आतग निज ते, सत्यचारित्र विवेक;
 भुद्धिसागर आतम रंगे, लीनपञ्चानी टेके. अवि. ५

(११३)

तपपहनी शुङ्खली.

राग उपरना.

अवि तमे वंहो दे, तपपह अतिशय धारी,	अवि.
तपशुषु सेवो दे, लावे सहु नर नारी.	
आरक्षेहे तप तपां निर्भव, कर्म निकायित नासे;	अवि. १
आहोन्हारोधक ते तप छे, कर्म तपे ते उल्लासे.	
पद्माश लिंग उपने तपथी, अनंत शक्ति भगवती;	अवि. २
शोग शोक सहु द्वारे नासे. वासनावृति विघटती.	
प्रवृत्ति निवृत्ति येणी, कर्म करे प्रथु तपिया;	अवि. ३
निर्वेपभावे रहेतु तप छे, तपपहना शुषु अपिया.	
निज आतम तपझपी निहणी, द्रव्य लाव तप तपवुं;	अवि. ४
शुद्धोपयोगे रहेतु धर्मां, नाम भक्तुं जपवुं.	
शुङ्खली गरणी लाग थीलामां, पंचातरनी सावे;	अवि. ५
नगर पाहरा चोमासामां, रथी आतमशुषु अचावे.	
तपागच्छ रविसागर शुद्धल, सुखसागर शुद्धशाया;	अवि. ६
धर्म धुरधर वीरनी पाए, ग्रेमे ग्रेषुमा पायो.	
भंगल पामारे जगमां नर अने नारी.	अवि. ७
नवपह आतममांडि जाणो, नय निकेप अमाणो.	
भुद्धिसागर शुद्ध उपयोगे, आपोआप पिण्डाणो. भंगल. अवि.	

(૧૧૪)

(૧૧૪)

શ્રી મહાવીર જન્મ જયંતી હિત.

માતા નિશલા જૂદાંથે પુત્ર પારણે, એ રોજ.

આજે મહાવીર જન્મથા જગમાં આનંદ આપવા,
કાટિ ચંદ્ર સૂરજની અળફી જગમાં જયોતા;
પ્રગટ્યો તૃષ્ણુ કુવનમાં આનંદમય ઉદ્ઘોત,
વિરમયા જડવાહી પાપી પંડિત અધોત.

આ. ૧

જગમાં સાત્ત્વિક આનંદના વાચા શુષ્ઠ વાચા,
પામ્યા નારકીઓ પણુ મનમાંડિ આનંદ;
કૃદા આનંદના વરસ્યા બહુલા શુલ મેહુલા,
ભારત ઉલ્લંસ્યુ હરણે પાય પલાયાં મંહ.

આ. ૨

કૃદી સર્વ દિશાઓ આનંદ ચોંધે નીતરે,
કસો ઠસ હેલ હેવીથી અરિયુ બહુ આકાશ;
દીનો ગાંચે હરણે ને નાચે ઈદ્રાખીઓ,
ચાંદા તેજે ભાસે દ્વાસમ આવાસ.

આ. ૩

અહેં ને બોક્યાલ સહુ ગાવે વીરનાં હીતડાં,
વિશ્વોદ્વારક પ્રભુનો જાણીને અહેવાલ;
પ્રભુને મેહૃપર નહુવરાવે સુરપતિ ભાવથી,
કૃદી ભારત ધરધર પ્રગટી મંગલમાલ.

આ. ૪

ધ્યાક્ષણુ ભાતિ હરણી ધ્યાક્ષણુ ધીજ દ્વિજત્વથી,
હરણથા ક્ષત્રિયો સહુ ક્ષત્રી ધર અવતાર;
ક્ષત્રીકુંનયશમાં મંગળ વાળ વાળીયાં,
નહાનાં શ્રોટાં સહુને આનંદનો નહિ પાર.

આ. ૫

પ્રેમે આનંદના શાસો લે ભારત ગાળુને,
શાંતિ આનંદના ઉદ્ધાર્સો લે નરનાર;

(११५)

હરખ્યાં નિશલામાતાને સિદ્ધારથ રાજ્યા,
હરખ્યા નોંધીએ જાણી ભારત ઉદ્ધાર. આ. ૬

રાજ વેશાલી ચેટક મનમાં આનંદિયા,
ધરધર આનંદ ઉત્સવ વરો જયજયકાર;
આખા ભારત હેઠે ધરધર પુત્ર વધામણું,
પ્રગટ્યો જગઝુરુ પ્રભુ મહાતીરનો અવતાર. આ. ૭

નેવીશ તીર્થકર ભાવિત ચોવિશમા જુનપતિ,
આને પ્રકટ્યા જાણી સૈને થગો નિર્ધોર;
માળે એરી કરતાં કલોલો સહુ પણીએ,
કરતાં આનંદના નાડો તેમ પશુએ સાર. આ. ૮

સધણે પ્રસિદ્ધ થથ તેરસ મહાતીરના જનમધી,
જગમાં મહાતીર તેરસ વેરેવેર અવાય;
સોનું રત્ન અને રૂપા હીરાના પારણે,
વીરને જૂલાએ નિશલા માતા સુખાય. આ. ૯

નિશલા એલે મારી કૂળે પ્રગટ્યા વીરજિન,
તેથી સતીએમાંહી થથ પ્રથમ શિરતાજ;
ગહારી કૂળે આંદ્રા ધરોદારક રાજ્યા,
રાણી ભારતજનની ધર્મતણી શુભ લાજ. આ. ૧૦

પ્રભુની જમણી જાઘે લંછન સિંહનું શોભતુ,
પ્રભુજ સિંહની ચેહે કરો પરાક્રમ એશ;
દ્વારા ઉપહેશે નિર્દીયતા ટાળી વિશ્વથી,
ટાળો નરનારી પશુ પણીના સહુ કલેશ. આ. ૧૧

વીરલુન એક હન્દર ને લક્ષ્ય આડે શોભતા,
તેથી જણ્યા ચોવીસમા સોટા જુનરાજ;
કેશીકુમાર સુખથી નિશલા જાણી ગાવતી,
દૃકાં હાલરડાનાં ગીતો શુણું શિરતાજ. આ. ૧૨

(૧૧૯)

જગમાં નેર પ્રકટતું જ્યારે હિંસા પાપતું,
કરતાં નરનારીઓ ત્રાહિ ત્રાહિ પોકાર;
જગમાં લુલમ ધણ્ણા ને અંધકાર અજ્ઞાનમો,
ત્યારે તીર્થકરનો જન્મ થાય નિર્ધોર.

આ. ૧૩

ભારત આર્થ દેશમાં સોના સૂરજ બોળીયો,
આને જાણું ભારત સર્વ દેશ શુદ્ધરાજ;
સાચે જન્મયા કેદીક ગણ્યુધર આહિ અખિયો,
જન્મયા હૈલી લુચો કરવા સંઘે સાજ.

આ. ૧૪

હડું ભારતનું તપ ઇણ્ણું જુનેખર જન્મથી,
કરવા સર્વ વેદનો સાચ્ચા અર્થ પ્રકાશ;
જન્મયા જાણ્યા ઈદ્રાહિકના વચને ભારતે,
પાચયા અખિ તપસ્વી ચોળીયો ઉલ્લાસ.

આ. ૧૫

ખાંદીખાનેથી છોડયા સધળા ખાંદિજનો,
ભારત દેશ નગરમાં ઉત્સવ ખંહુલા થાય;
નગરમાં નાટારંલો ડેર ડેર થાતા ધણ્ણા,
અમરાપુર સસું ક્ષણીકુંડ સુણ ઉલરાય.

આ. ૧૬

પ્રભુને જોવા આવે હેવઢેવી નરનારીઓ,
જોપી જોળીઓ સહુ જોવા આવે હેડો,
વરસે સિદ્ધારથ ધર કંચનની ખૂબ કેડીઓ,
પ્રભુની જગમાં જોતાં મળો ન બીજુ જોડ,
વીરના તેજથકી કોઈ કરે ન જગમાં હોડ—

આ. ૧૭

પ્રભુજ તીર્થ સ્થાપણે સમબસરણુમાં જેસીને,
કરણો કેવલજાને સત્ય ધર્મ ઉપહેશ;
ગણ્યુધર દ્વારાંની શુંથીને ધર્મ વધારણો,
એથી ટળણો આધિ વ્યાધિના સહુ કલેશ.
મહાવીર ભારત ધર ધર જોનાસિ અગરાંબણો,
કરણો હર્ષણોનો જોધથકી સંહાર;

આ. ૧૮

(૧૧૭)

- સર્વે આચોં એક સ્વરૂપી થઈને ચાલશે,
રાજ રંક સકલને સરળા હક નિર્ધાર. આ. ૧૬
- સર્વે આચોં હુંઘ અંધને છેદી નાખશે,
જાચા નીચાનો રહેશે નહીં મન અહંકાર;
સહૃદો ન્યાય થશે સમલાવપણે જગ સારીઓ,
ટળશે હિંસા થજો તથા મતુજ સંહાર. આ. ૨૦
- થાશે પ્રભાસંધનાં રાજ્ય અને સુનીતિઓ,
રક્તથી અરડાશે નહીં સર્વ પ્રભનો સંધ;
રાજ રૈથત સર્વે આત્મહૃપથી એક થઈ,
કરશે અરસપરસ સાહાય્ય ધરી મન રંગ. આ. ૨૧
- પ્રભુજી આત્મજ્ઞાનથી આદ્વાણુ સુખ્ય કહાવશે,
ક્ષત્રી અનીને કરશે સર્વ કર્મ સંહાર;
જગતમાં ધર્મશરૂનો ક્ષાત્રપણુથી જગ્યાવશે,
આંતર વૈશ્ય અનીને કરશે શુણુ વ્યાપાર. આ. ૨૨
- દેવલજ્ઞાની અનીને સેવા સહૂની સારશે,
ગામોગામ કરીને પાહ થકી વિહાર;
સેવા ધર્મતણુ હેલાનો કરશે વિશ્વમાં,
અતુર્વિધ સંધ અનાની કરશે જગ ઉદ્ધાર. આ. ૨૩
- સાચી ભક્તિ સાચાં કર્મો જાને જગ્યાવશે,
વિચારો આચારોમાં થાશે ઠાકુ ઉદાર;
હથાનો હેલાયો કરશે ભારતમાં ભાવથી,
ધરોધર પણીઓ માળા કરશે નિર્ધાર. આ. ૨૪
- અતી રાગદ્વૈધને હુનિયા કરશે નિર્મલી,
આચોં જૈને જિનને અતુસરશે દિનરાત;
આદ્વાણુ આત્મજ્ઞાનીઓ અનીને વિશ્ય જગાવશે,
નવદ્વાં રૂકું પ્રગડયું ભારતનું પરલાત. આ. ૨૫

(६२८)

ચારે વળો કૃથિત્યન પોટાં લાગશો,
ધરેધર આત્મજાનનાં પ્રગટાશે બહુ સૂત;
સ્ત્રાચા વ્યવહારો વર્તાશે સાચી નીતિથી,
જ્ઞાનીશો ચોણી થાશે ભારત માતા પુત્ર.

આ. ૨૬

ધરેધર અદ્ધુ ભાવના ચેઝો શુલ પ્રગટાવશો,
જ્ઞાનલુ ચ્યાલીંશમો મંહાલીરતણો અવતાર;
ક્ષાળે ભવિષ્ય કેશી ઈદ્રો ને બહુ ઋષિયો,
એલું સુણીને હરખાં ભારતનાં નરનાર.

આ. ૨૭

જ્યાંતી વીર પ્રભુની ઉજવે સુરનર નારીઓ,
વત્થો ત્રણુ ભુવનમાં જન મનમાં આનંદ;
પ્રગટશો સાત્ત્વિક આનંદ માય ન દોકાલોકમાં,
નાડો મોહરાચના સથળા સથળા હેંદ.

આ. ૨૮

શૈતર તેરસ મહાવીર જનમ જ્યાંતી ઉજવી,
સુરપતિ ઈદ્રાણ્ણીઓ નાંહીશરમાં જાય;
માંડે અહુદી મહેત્સવ ત્યાં ભાવે ભાવના,
ત્યાંથી દેવલોકમાં પહેંચીને હરખાય.

આ. ૨૯

ક્ષત્રી કુંડ નગરમાં દશ દિન ઉત્સવ માંડિયો,
પ્રભુનાં મહિદેશમાં પૂજાયો બહુ થાય;
જમણો જમતાં સર્વે જાતિ નર ને નારીઓ;
દેવાં દેશતથ્યાં નહિં રહેતાં માહેમાંદ્ય.

આ. ૩૦

આજે વીરપ્રભુની જનમ જ્યાંતી ઉજવી,
સાહ્યો જનમ થયો ને કણી હૃદયની આશા;
ભારત અદ્ધુસાનથી શુરૂ બની સહુ દેશનો,
દેશે સ્વતંત્રતા ને આત્મિક જ્ઞાન પ્રકાશ.

આ. ૩૧

ગાયકવાડી રાજ્યે નગર પાદરા શોભતું,
જ્યાંતી વીર પ્રભુની કીર્ધી હેરોલ્ડાસ;

(११६)

अंवत् अोगचिंश चोत्तरनी दृढी शालमाँ,
गावे युद्धिसागरसूरि ज्ञान प्रकाशः

(११५)

श्री महावीर भ्रष्टुन् आरण्डः

विशेषा भावातुं गानः

श्री भहावीर भ्रष्टुन् खालरङ्कः

० हालो हालो हृदयनो ग्राघ, महावीर भालुड़;

मातृं सर्वं मनोदश रथान, महावीर भालुड़।

आंगलडी अख्यायाणी अभूली, नेतां तुसि न थाती दे;

नाचे नयावे आंग उसारे, निर्मल नेहे सोहाती. महा.

अक्षतेज आंगे उलसातुं, प्रियज्ञने अट परण्डे;

आंग उलाणे विश्व उलाणे, सहु उरधाणी हरणे. महा. १

कारमां नयण्णां लोडेत्तर इयां, कालजडाने कौरे दे;

नालुक नातुं नाक भजन्तुं, उलरे आनन्द छोणे. महा. २

डाडमकणी सम हांतनी पांकित, हंस पांकित अट लुते दे;

उपमालायक डौध न जगमां, अनुबव रीत प्रतीते. महा. ३

कुसतां पुष्प गरे ज्यम भेति, हास्य मधुइँ सुहातुं दे;

सर्वं अक्षांडोनी सहु लीला, करतुं दील जण्णातुं. महा. ४

कालजडुं हृते कालु योली, करे तन्मय भन ढारा दे;

अद्वैत अद्व्यना भेणे ज्येष्ठे, प्रेमाद्धि अवतारी. महा. ५

इकत कमल अणतानां जेवां, पुनित पगलां भरतो दे;

अगुमगु चाली विश्व डालावे, छातीये आलु पडतो. ६

उछणी आनंहोमाव उछाणे, जेणे परी शुक ऐके दे;

आंगुठो मुखमांडी चावी, रमतो नव नव गेके. महा. ७

(१२०)

બાલપ્રભુ પારણીએ પોઢે, હાલરકે હુલરાહુ રે;
 પ્રભુના લક્ષણુ પારણીયામાં, દીકાં તે શું ? જણાહું. મહા. ८
 હાલો હાલો કરતાં હુલાવે, ત્રણુ લુલનને પ્રેમે રે;
 અકલ અલખ લીલામાં લચપચ, રહેતો જીવન ક્ષેમે. મહા. ९
 અતુભવ રમ્ભત ગમ્ભત કરતો, વિશ્વ જીવાડી એ જીવે રે;
 ત્રણુ લુલન અંધારું નાહું, પુત્ર પનોતા દીવે. મહા. ૧૦
 ઠાલ કરીને ધાતી સરણો, ચાંપી આનંદ પાસું રે;
 આહિર અંતર બાલ પ્રભુના, રૂપે જગ સહું નાસુ. મહા. ૧૧
 પગ અંગરીએ જગ અમકાવે, આંખથકી આકર્ષેં રે;
 આનંદ તેજે દેહ ભરેલી, પ્રેમ તેજે બહુ વર્ષે. મહા. ૧૨
 ભૂમિ પડીને સાસું જેતો, આંખ મીચી કંઈ હસતો રે;
 ઘાસે આવી જોળામાંથી; કળા કરીને ખસતો. મહા. ૧૩
 ઝીલે ઝીલાવે જુદે જુલાવે, હસે હસાવે રમાવે રે;
 અંધકાર્ય તન્મયથા માટે, લાડ કરે ને લડાવે. મહા. ૧૪
 સુધીએ આવો બાલ પ્રભુને, હેત કરીને રમાડો રે;
 જગજીવન જગનાથ જીવન સુજ, દેણો ને દિવિ ઠાલો.મ. ૧૫
 નવ નવ ચેતન શુણો ઝીલે, અતુભવ રસને ઝીલે રે;
 જીવનશક્તિ અમીરક્ષ દીલે, તેજ સર્મખ્યું' રચીલે. મહા. ૧૬
 અંગોઆંગો શૈમારોમે, આનંદ હેલી વિલસે રે;
 કામણુગારી કાચા ઉજ્જ્વલ, દેખાતાં દિવિ ઉલસે. મહા. ૧૭
 પ્રભુ બાલ સુજ એણે હુલાહું, તન્મય થધ અન જાહું રે;
 સુખ પર અરમર જયેતિ અળકે, ઠાલ કરીને વધાવું.મહા. ૧૮
 નાચે રાચે ધાવે પ્રેમે, મીચી આંખ ઉઘાડે રે;
 જેધ રહે સુજ સાસું ધાતાં, અદૈત અંધ જગાડે. મહા. ૧૯
 ઠાલ કરીને અંગો વળગે, અંપે નર્હી ક્ષણુવારે રે;
 વિશ્વાસીમાં સહુથી સાચો, શુદ્ધ સરલતા ધારે. મહા. ૨૦

(१२१)

- कुष्टती शेषा सैथी सारी, रनि शशी वारी जाऊं दे;
भालक राज आनौंह ताज, शुणु केटला हुं गाउं. महा. २१
आतम प्रतिभिंभ निर्मल न्हातुं; मलके सुअथी मजातुं दे;
हलथी हिल परभावे नयने, मैन रही कहे छातुं. महा. २२
- तुसि न पासुं लाड लडावे, प्रलु ऐसे मुज घोवे दे;
जन्म सङ्कल थयो पुण्योहयथी, आवे न डै मुज तोले. म. २३
अलंकारथी अंग आपातुं, अलदां सरस पहेचातुं दे;
हिल अंगाणीमे आलुडाने, लय लानी पधरातुं. महा. २४
- आलुडाना लाडाना छावे, हरभी धातोधाते दे;
पूर्यो पूर्वु भनोरथ प्रलुओ, लय लुवन हरभाते. महा. २५
- केवपवृक्ष धीज चंद्रनी घेठ, वधतो हुर्ष वधारे दे,
वेरीने पलु न्हालो लागे, घेली अनी अवतारे. महा. २६
- आलुडा प्रलु आगण गाती, गरणो नव नव गाने दे;
प्रलुभय गानो तानो जखुतां, भने समजावे साने. महा. २७
- आलुडामां सर्वे अर्युं छे, आडी रहुं नहीं कांध दे;
सर्व भनोरथ कृणीया मारा, रही केवपवृक्षनी छांही. महा. २८
- लुवनमां अभीरस देहोयो, पत्ती लुवन शुल सिध्धयुं दे;
डाटि वर्षतक नंहन लुवो, प्रलु चुंथी अमृत पीछुं. महा. २९
- रत्न कुक्षीने जननी शिरोमणि, निश्चला भात गच्छाणी दे;
ऋषु लुवनमां थध हुं आवी, विश्ववत्सल अह्माणी. महा. ३०
- अंबाडेवी शक्ति पुराणी, नाम अनेके गवाई दे;
हुनिया शांति श्वास अहंती, धरधर करती वधाई. महा. ३१
- बाला प्रलुमां हेव हेवीओ, प्रियपणुं सहु जेती दे;
भुज्जिसागर वारी जाऊं, प्रलुने वधातुं गीती. महा. ३२

શ્રીમહુ શુદ્ધિસાગરજી અન્થમાળામાં પ્રગટ થયોદ્વા અથે.

	પૃષ્ઠ
૧. ક લજન સંગ્રહ ભાગ ૧ લો.	૨૦૦ ૦-૬-૦
૨. અધ્યાત્મક વ્યાખ્યાનમાળા.	૨૦૬ ૦-૪-૦
૩. લજનસંગ્રહ ભાગ ૨ લો,	૨૩૬ ૦-૮-૦
૪. લજનમંત્રક ભાગ ૩ લો.	૨૧૫ ૦-૮-૦
૫. સમાધ શતકમુ.	૩૪૦ ૦-૮-૦
૬. અનુભૂવ પચ્છિયા.	૨૪૮ ૦-૮-૦
૭. આત્મપ્રદીપ.	૨૧૫ ૦-૮-૦
૮. લજનસંગ્રહ ભાગ ૪ થો.	૩૦૪ ૦-૮-૦
૯. પરમાત્મદર્શન.	૪૩૨ ૦-૧૨-૦
૧૦. પરમાત્મજ્ઞાતિ.	૫૦૦ ૦-૧૨-૦
૧૧. તરણબિદ્ધુ.	૨૩૦ ૦-૪-૦
૧૨. શુદ્ધિસાગર. (આદૃતિ ખીજ)	૨૪ ૦-૧-૦
૧૨-૧૩. લજનસંગ્રહ ભાગ ૫ મો તથા સાનદીપિકા.	૧૬૦ ૦-૬-૦
૧૪. તીર્થયાત્રાતુ વિમાન (આદૃતિ ખીજ)	૬૪ ૦-૧-૦
૧૫. અધ્યાત્મ લજનસંગ્રહ.	૬૫૦ ૦-૩-૦
૧૬. શુદ્ધેંદ્ર.	૧૯૨ ૦-૪-૦
૧૭. તરણસાનદીપિકા.	૧૨૪ ૦-૬-૦
૧૮. ગજુલીસંગ્રહ.	૧૧૨ ૦-૩-૦
૧૯-૨૦. આવધિમૈસ્વરદ્ધ ભાગ ૧-૨ (આદૃતિ ખીજ)	૪૦-૪૦ ૦-૧-૦
૨૧. લજન ૫૬ સંગ્રહ ભાગ ૬ ટો.	૨૦૮ ૦-૧૨-૦
૨૨. વચનામૃત.	૨૦૮ ૦-૧૪-૦
૨૩. યોગદીપક.	૨૬૮ ૦-૧૪-૦
૨૪. જૈન ઐતિહાસિક રાસમાળા.	૪૦૮ ૧-૦-૦
૨૫. આનન્દધન પદસંગ્રહ ભાવાર્થ સંહિત.	૮૦૮ ૨-૦-૦
૨૬. અધ્યાત્મ શાન્તિ (આદૃતિ ખીજ)	૧૩૨ ૦-૩-૦
૨૭. કાંયસંગ્રહ ભાગ ૭ મો.	૧૫૬ ૦-૮-૦
૨૮. જૈનધર્મની આચીન અને અવીચીન સ્થિતિ.	૬૬ ૦-૨-૦
૨૯. કુમારપાલ અરિત્ર (હિંડી)	૨૮૭ ૦-૬-૦
૩૦ થી ૩૪. સુખસાગર શુદ્ધગીતા.	૩૦૦ ૦-૪-૦

(२)

३५. पद्मन्थ विचार.	२४०	०-४-०
३६. विजयपुर छतांत.	५०५	०-४-०
३७. साधरमती काव्य.	१८६	०-६-०
३८. अतिरा यात्रा,	११०	०-४-०
३९-४०-४१. जैनगच्छमत प्रभाष्य. संघभ्रगति. जैनगतीता.	१-०-०	
४२. जैन धार्मिकता लेख संग्रह.	१-०-०	
४३. भित्रभैवी,	०-८-०	
४४. शिष्योऽपनिषद्.	०-२-०	
४५. जनोपनिषद्.	४८	०-२-०
४६-४७. धार्मिक गद्यसंग्रह तथा पत्र सहप्रदेश. भाग १ दो.	५७६	३-०-०
४८ भजनसंग्रह भाग ८	६०४	३-०-०
४९. श्रीमहेवर्यन्द ला. १	१०२८	२-०-०
५०. कर्मधोष.	१०१२	३-०-०
५१. आभासतन्त्रदर्शन.	११२	०-८-०
५२. भारत संहकार शिक्षण.	१६८	०-१०-०
५३. श्रीमहेवर्यन्द ला. २	१२००	३-८-०

* आ नीशानी वाला अथा सीलकमां नथी.

पुस्तक भगवानां स्थल.

भुजाध, पायधुणी. शुक्लेश्वर मेघल हीरल.
 " चंपागढी. लक्ष्मीलाल हीरमध्यंक दलाल.
 पुना, वेतालपेंड. शोठ वीर्यंहलाल हुभुल.
 पाहरा, वडोल मालुनलाल हीरमध्यंक.

